

# *Shree Kundkund-Kahan Parmarthik Trust*

302, 'Krishna-Kunj', Plot No.30, Navyug CHS Ltd., V. L. Mehta Marg, Vile Parle(w), Mumbai-400056  
Phone No. : (022) 2613 0820. Website : [www.vitragvani.com](http://www.vitragvani.com) Email : [info@vitragvani.com](mailto:info@vitragvani.com)

---

Atmadharma is a magazine that has been published from Songadh, since 1943. We have re-typed and uploaded the old Atmadharma Magazines to our website [www.vitragvani.com](http://www.vitragvani.com)

We have taken utmost care while re-typing, from the original Atmadharma Magazines. There may be some typographical errors, for which we request all readers to kindly inform us about the same, to enable us to correct and improve. Please send your comments to [info@vitragvani.com](mailto:info@vitragvani.com)

**Shree Kundkund-Kahan Parmarthik Trust  
(Shree Shantilal Ratilal Shah-Parivar)**

શ્રી જિનેન્દ્રાદેવનું ધર્મચક જગતનું કલ્યાણ કરો



હે વીરનાથ ભગવાન ! આપના વીતરાગીશાસનના પ્રતાપે  
ભરતક્ષેત્રના ભવ્યજીવોમાં આજે પણ ધર્મચક ચાલી રહ્યું છે.


શ્રી મહાવીરજનોત્સવ અંક



શ્રી મહાવીરજનોત્સવ અંક

તંત્રી: પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર \* સંપાદક: બ્ર. હરિલાલ જૈન  
વીર સં. ૨૫૦૧, ચૈત્ર (લવાજમઃ છ રૂપિયા) વર્ષ ઉર્દુ: અંક ૯

# મંગલ વદ્યાઈ



સર્વજ્ઞમહાવીર-કે જેઓ આપણા ભરતક્ષેત્રમાં વર્તમાન ચાલી રહેલા મોક્ષમાર્ગરૂપ ધર્મતીર્થના પ્રણેતા છે, જેમના તીર્થમાં આપણને ધર્મની પ્રાપ્તિ થઈ છે, -તે પરમેશ્વરના પરમઉપકારને પ્રસિદ્ધ કરવાનો અત્યારે મહાન પ્રસંગ છે. તેથી તે સર્વજ્ઞમહાવીરના મહાન ગુણોને ઓળખીને તેમના ગુણગાન વડે તેઓશ્રીનો મહાન ઉપકાર પ્રસિદ્ધ કરીએ છીએ. પ્રભુના જન્મોત્સવ પ્રસંગે આ ખાસ અંક દ્વારા હૃદયની ઉર્ભિઓથી તેઓશ્રીને અભિવંદીએ છીએ.

મોક્ષરૂપ મહા સુખની જેનાથી પ્રાપ્તિ થાય એવા સમ્યજ્ઞશન -જ્ઞાન-ચારિત તે ધર્મતીર્થ છે, તે તીર્થવડે ભવસમુદ્રથી તરાય છે. ભગવાન મહાવીર એવા ધર્મતીર્થના કર્તા છે. પોતાના આત્માને તો શુદ્ધોપયોગરૂપ પરિણમાવીને પોતે ભવથી તર્યા છે, ને તેમના તીર્થને પામીને આપણે ભવને તરી રહ્યા છીએ.

અહો, વર્દ્ધમાનદેવ ! આપનું આવું મંગલ તીર્થ વિપુલાચલથી વહેતું-વહેતું આજે અઢીઙજારવર્ષથી ભારતદેશમાં સર્વત્ર ચાલી રહ્યું છે ને તે તીર્થમાં સ્નાનવડે મિથ્યાત્વમેલ ધોઈને આનંદરસના પાનથી અનેક જીવો પાવન થયા છે.

હે વીરનાથ-સર્વજ્ઞદેવ ! આપના ઉપકારને અમે કેમ ભૂલીએ ? આપની પરંપરાથી આવી રહેલું, આપની સર્વજ્ઞતાના પ્રસાદરૂપ સમ્યજ્ઞાન આજેય અમને ભવદુઃખોથી છોડાવીને અપૂર્વ મોક્ષસુખનો સ્વાદ ચખાડે છે; તે સર્વોત્કૃષ્ટ ઉપકારની પ્રસિદ્ધિનો મહાન અવસર આજે આપના અઢીઙજારવર્ષાર્થી નિર્વાણમહોત્સવ પ્રસંગે અમને પ્રાપ્ત થયો છે. ત્યારે અંતરની લાખલાખ ઉર્ભિથી આપને અભિવંદીએ છીએ.

[ બ્ર. ફરિભાઈ દ્વારા લખાઈ રહેલ પુસ્તક “સર્વજ્ઞમહાવીર અને તેમનો ઈષ્ટ ઉપદેશ” માંથી ]

ભગવાન-મહાવીર-મંગલજનોત્સવ-વિશેષાંક:

આત્મધર્મ: ચૈત્ર ૨૫૦૯



અહો વીરનાથ જિનેન્દ્ર ! સર્વક્ષતા અને આનંદથી શોભતા આપના આત્માને ચેતનભાવે ઓળખતાં અમને પણ આનંદસહિત સભ્યકૃત્વ થાય છે.

[ શ્રી પરમાગમ મંદિરમાં બિરાજમાન મહાવીર ભગવાનની ભવ્યપ્રતિમાની વીતરાગમુદ્રાનું દર્શન સાધકના અંતરમાં અનેરી આડ્લાઈ-ઉર્મિઓ જગાડે છે. ]

જે જાણતો મહાવીરને ચેતનમયી શુદ્ધ ભાવથી,  
તે જાણતો નિજાતમને સમકિત લ્યે આનંદથી.

\* છ કારકોની સ્વાધીનતાથી શોભતો \*

## ચૈતન્ય ચક્વતી



સમયસારની ૪૭ શક્તિઓમાં આત્માના છ કારકોનું ધારું સરસ વર્ણન આચાર્યદેવે કર્યું છે. પોતાની નિર્મળ સમ્યક્ત્વાદિ કિયાના કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અવિકરણ-એ છાંએ કારકોરૂપે પોતે જ સ્વાધીનપણે પરિણમતો થકો, આ ચૈતન્યચક્વતી સ્વતંત્ર પ્રભુતાથી શોભે છે. ચક્વતીનું રાજ પણ જેની પાસે તદ્દન તુચ્છ છે - એવું આ ચૈતન્ય-ચક્વતીપણું છ કારકોના પ્રવચનમાં અદ્ભુતપણે ગુરુદેવે ઓળખાવ્યું છે. એ પ્રવચનોના રત્નાકરમાંથી ૮૬ રત્નો વીળીને ગૂંઘેલી આ ૮૬ રત્નોની મંગળમાળા વીરપ્રભુના જન્મોત્સવ પ્રસંગે સહર્ષ રજુ કરવામાં આવી છે.

( બ્ર. ફ. જૈન )

## \* આત્મહિતને માટે હુમેશા વીતરાગશાસ્ત્રનું વાંચન કરીશ. \*

૧. સ્વાધીન છ કારકોવડે સ્વયમેવ સર્વજ્ઞ થઈને જેઓ સિદ્ધપદ પામ્યા અને આપણને પણ એવું ‘સ્વયંભૂ’ નિજપદ દેખાડ્યું-તે વીરનાથ જિનને વંદન હો.
૨. જેણે ધર્મ કરવો છે એટલે આત્માની શાંતિ જોઈએ છે તેને તે પોતાના આત્મામાં દર્શિ કર્યે જ મળે તેમ છે, ક્યાંય બહારથી મળે તેમ નથી. શાંતિ જ્યાં ભરી હોય ત્યાંથી જ મળેને !
૩. આત્માની શાંતિ-સુખ કે આનંદ આત્મામાં જ ભર્યો છે, બહારમાં નથી; અને તે પ્રગટ કરવાનું સાધન પણ ક્યાંય બહારમાં નથી; સાધન પણ પોતામાં જ છે.
૪. અરે જીવ ! તારો આત્મા ‘સ્વયંભૂ’ છે; તારું કેવળજ્ઞાન વગેરે થવાના છએ કારકો તારામાં જ છે; સ્વભાવનું અવલંબન કરતાં તારો આત્મા સ્વયમેવ છ કારકરૂપ થઈને કેવળજ્ઞાનપણે પ્રગટ થશે.
૫. સ્વસન્મુખ થઈને જ્યાં આત્મા નિર્મળજ્ઞાનપણે પરિણામ્યો, ત્યાં તે જ્ઞાન-પરિણામનમાં આનંદ, પ્રભુતા વગેરેની જેમ કર્તાપણું; કર્મપણું, કરણપણું, સંપ્રદાનપણું, અપાદાનપણું ને અધિકરણપણું-એવા છ કારકોનું પરિણામન પણ ભેગું જ છે.
૬. આત્માના નિર્મળ પરિણામનમાં બહારના કોઈ કારકો છે જ નહિ, રાગના કારકોનો પણ તેમાં અભાવ છે. પોતાની નિર્મળપરિણાતિરૂપ કિયાના છએ કારકરૂપે આત્મા સ્વયમેવ થાય છે, તેથી તે ‘સ્વયંભૂ’ છે.
૭. ભાઈ, તારા ચૈતન્યમાં જ સંપૂર્ણ તાકાત ભરી છે, તેનો વિશ્વાસ લાવીને, તેમાં તારી નજર ઠેરવ; બીજે ક્યાંય નજર ઠરે તેમ નથી. તારા નિધાન તો તારામાં જ છે; તેની સુંદરતા અદ્ભુત છે.
૮. સમ્યગ્દર્શન કે કેવળજ્ઞાન વગેરે કાર્યરૂપે થાય-એવી શક્તિ આત્મામાં જ છે, આત્મા પોતે જ તે સમ્યગ્દર્શનાદિ કાર્યરૂપ પરિણમે છે;-પણ રાગ પરિણામીને સમ્યગ્દર્શનાદિરૂપ થાય-એમ બનતું નથી. કેમકે નિર્મળકાર્યરૂપે થવાની શક્તિ આત્માની છે, રાગની નહિ.

## \* મારા ઈષ્ટદેવને યાદ કરવા હું હંમેશા જિનમંદિરે જઈશ \*

૬. રાગ કરતાં કરતા સમ્યજ્ઞન થાય એમ જે માને તેણે સમ્યજ્ઞનને રાગનું કાર્ય માન્યું-પણ જેનામાં સમ્યજ્ઞનાંદિ કાર્યરૂપ થવાની 'કર્મશક્તિ' છે એવા આત્માને તેણે માન્યો નહિં; એટલે તેને નિર્ભળ કાર્ય થતું નથી.
૭. છ કારકોરૂપ જે સ્વભાવસામર્થ્ય, તેને અનુસરીને નિર્ભળ પરિણાતિ થાય -તે આત્માની કિયા છે. જ્યાં સ્વભાવને અનુસર્યો ત્યાં છ કારકરૂપે સ્વયં થઈને સર્વજ્ઞતા તરફ ચાલ્યો...ને વિભાવથી વિમુખ થયો. -એનું નામ સાધકદશા....એનું નામ ધર્મ....ને એનું નામ મોક્ષમાર્ગ.
૮. કોઈ કહે: "આત્મા આવી શક્તિવાળો છે તો તે દેખાતો કેમ નથી?" -અરે ભાઈ ! તું જુએ પર તરફ, ને કહે કે આત્મા દેખાતો નથી, -પણ ક્યાંથી દેખાય ? આત્મા તરફ જો તો આત્મા દેખાય ને ! પર તરફ જોયે આત્મા ક્યાંથી દેખાય ? માટે સ્વસન્મુખ થા...તો અનંતશક્તિવાળો આત્મા તને સ્વાનુભવમાં આવશે.
૯. ધાર્ણા જીવો 'નમો અરિહંતાણં' એમ કહીને સર્વજ્ઞ ભગવાનને નમસ્કાર કરે છે, -પણ નમસ્કાર કરનારો પોતે, જ્યાંસુધી પોતામાં પણ સર્વજ્ઞ જેવી અનંત શક્તિ છે-તેનો વિશ્વાસ કરીને સ્વશક્તિસન્મુખ ન નમે ત્યાંસુધી સર્વજ્ઞદેવને પણ તેના પરમાર્થનમસ્કાર પહોંચતા નથી. સ્વશક્તિની સન્મુખ થતાં જ સર્વજ્ઞને પરમાર્થ નમસ્કાર પહોંચી જાય છે.
૧૦. જૈનશાસનની આ અદ્ભુતતા છે કે સર્વજ્ઞ સામે બહારમાં જોયા વગર પણ સર્વજ્ઞને પરમાર્થનમસ્કાર થઈ જાય છે. વાહ રે વાહ આત્મસન્મુખી માર્ગ !
૧૧. સર્વજ્ઞ થવાની શક્તિ મારામાં છે, -એમ પોતાના પૂરા ગુણોને જે નથી સ્વીકારતો, તે સર્વજ્ઞ ભગવાનના પૂરા ગુણોને પણ ક્યાંથી ઓળખશે ? -ને ઓળખ્યા વગર સાચા નમસ્કાર ક્યાંથી થાય ?
૧૨. અહા, આચાર્યદીવે આત્માની સ્વાધીન શક્તિઓ ઓળખાવીને અદ્ભુત પ્રભુતા બતાવી છે....જેને ઓળખતાં પોતાની સ્વતંત્ર પ્રભુતાથી આત્મા એવો શોભી ઊઠે કે તેના અખંડપ્રતાપને કોઈ હણી શકે નહીં.

### \* રત્નત્રયવંત મુનિભગવંત...એને ઓળખતા આવ્યા ભવના અંત \*

૧૬. છએ કારકોરૂપે થવાની શક્તિ આત્મામાં છે. સ્વસન્મુખ થઈને આત્માએ પોતામાંથી જે સમ્યજ્ઞનાદિ નિર્ભળભાવ પ્રાપ્ત કર્યો, તે ભાવમય આત્મા થાય-એવી તેની 'કર્મશક્તિ' છે. દરેક આત્મામાં ત્રિકાળ આવી શક્તિ રહેલી છે.
૧૭. 'મારે સમ્યજ્ઞન-શાન-ચારિત્રરૂપી કાર્ય કરવું છે,-પણ તે કાર્ય ક્યાંથી આવતું હશે ? ' -તો આચાર્યદિવ કહે છે કે ભાઈ, ક્યાંય બહારથી તે કાર્ય નથી આવતું, -પણ તારા આત્મામાં જ એવી તાકાત છે કે પોતે સ્વયં તે કાર્યરૂપ પરિણામી જાય. પણ કયારે ? -કે સ્વસન્મુખ થાય ત્યારે.
૧૮. ધર્મરૂપી જે નિર્ભળ કર્મ-તે રૂપે આત્મા સ્વયં થાય છે; શરીર કે રાગ તે કોઈ ધર્મરૂપે થતા નથી. નિજશક્તિમાંથી નિર્ભળભાવ પ્રાપ્ત કરીને આત્મા સ્વયં તે રૂપે થાય છે,-એવી તેની કર્મશક્તિ છે.
૧૯. દ્રવ્યકર્મ તે પર છે; ભાવકર્મ તે વિભાવ છે; સમ્યજ્ઞનાદિ નિર્ભળપર્યાયરૂપ કર્મ તે સ્વભાવનું કાર્ય છે. અને એવી 'કર્મશક્તિ' તે ત્રિકાળ શુદ્ધસ્વભાવે છે. તે શુદ્ધસ્વભાવને ઓળખતાં વર્તમાન નિર્ભળપર્યાયરૂપ કર્મ પ્રગટે છે, ને રાગાદિ ભાવકર્મ તથા દ્રવ્યકર્મનો સંબંધ છૂટી જાય છે.  
-એનું નામ ધર્મ ! ને એ જ આત્માનું કર્મ !-એ સિવાય કોઈ બીજું કર્મ (-કાર્ય) તે ખરેખર આત્માનું નથી.
૨૦. જેમાં જે તન્મય હોય તે તેનું કાર્ય કહેવાય.  
 \* શરીર-કર્મ-ભાષા વગેરે જડનું કર્મ છે, કેમકે તેમાં તે તન્મય છે.  
 \* રાગાદિ વિકારીભાવ તે મિથ્યાદિનું કર્મ છે, કેમકે તેમાં તે તન્મય છે.  
 \* સમકિતીધર્મત્વાનું કર્મ તો નિર્ભળ શ્રદ્ધા-શાન-આનંદરૂપ છે, કેમકે તે તેમાં તન્મય છે.
૨૧. શું રાગ તે ધર્મનું કાર્ય છે ? -ના; કેમકે તેમાં તે તન્મય નથી. શું આઠકર્મ તે જીવનું કાર્ય છે ? -ના; કેમકે તેમાં તે તન્મય નથી. કર્તા જેમાં તન્મયપણે વર્તે તે તેનું કાર્ય કહેવાય.

અહો ઉત્તમ ક્ષમાના આરાધક સંતો ! તમને નમસ્કાર છે...નમસ્કાર છે.

૨૨. ‘કર્તાનું ઈષ તે કર્મ’ -ધર્મજીવ રાગને ઈષ બનાવતો નથી, તેથી તે તેનું કર્મ નથી. તે તો સ્વભાવને જ ઈષ બનાવીને તેના આશ્રયે નિર્ભળ કાર્યરૂપે સ્વયં પરિણામે છે, તે જ તેનું કર્મ છે.
૨૩. અહીં તો સ્વભાવશક્તિ-સન્મુખ થયેલો આત્મા પોતાના છાએ કારકોની સ્વાધીનતાથી નિર્ભળભાવોરૂપે જ પરિણામે છે, તેની વાત છે. કેમકે આ તો ‘શક્તિ’ ની વાત છે, શક્તિમાં વળી ‘અશક્તિ’ (-વિભાવ) કેમ હોય ? સ્વભાવમાં વિભાવ કેમ હોય ?
૨૪. જડકર્મ અને વિકારરૂપ ભાવકર્મ એ બંનેથી પાર એવી આ ‘કર્મશક્તિ’ છે, -કે જે શક્તિને લીધે આત્મા પોતે પોતાના સમ્યજ્ઞશર્ણાદિ કાર્યરૂપે પરિણામે છે.
૨૫. પ્રભુતારૂપે, આનંદરૂપે, સર્વજ્ઞતારૂપે, સ્વચ્છતારૂપે-એમ સર્વ શક્તિના નિર્ભળ કાર્યરૂપે સ્વયં પરિણામવાની આત્માની શક્તિ છે. કોઈ બીજામાં ( રાગાદિમાં કે દેહની કિયામાં ) એવી તાકાત નથી કે પ્રભુતારૂપે કે આનંદ વગેરે કાર્યરૂપે પરિણામે.
૨૬. વાહ રે વાહ વીરપ્રભુ ! આપનું શાસન પરાધીનવૃત્તિ છોડાવે છે, બહારમાં ભટકતી વ્યાચ્બુદ્ધિ છોડાવે છે, ને સ્વાધીન-ચૈતન્યવૃત્તિથી પરમ સુખ પમાડે છે. આપનું શાસન જ પરમ ઈષ છે.
૨૭. જે આવી શક્તિવાળા આત્માને પ્રતીતમાં લઈને તેની સન્મુખ થાય તેને પોતાના સ્વભાવમાંથી જ બધા ગુણોનું નિર્ભળકાર્ય પ્રગટે; સમ્યજ્ઞશર્ણ પ્રગટે, સમ્યજ્ઞાન પ્રગટે, સમ્યક્ચારિત્ર પ્રગટે, સુખ પ્રગટે, પ્રભુતા પ્રગટે, સ્વચ્છતા પ્રગટે. -એમ અનંતાગુણોના નિર્ભળ કાર્યરૂપે આત્મા સ્વયં પરિણામે, એટલે પરમ ઈષપદની પ્રાપ્તિ થાય.
૨૮. અહો ! આવો મહિમાવંત જે સ્વભાવ, તેને ન માનતાં ઊંઘી રીતે માને તો તે ઉત્તમ સ્વભાવનો અનાદર કરે છે, તેથી તે સ્વભાવની ઉધ્દૃતારૂપ સિદ્ધપદમાં કેમ જાય ? સ્વભાવનો આદર કરીને તેનો આશ્રય કરે તો જીવને ઊધ્ર્વ પરિણામન થઈને સિદ્ધદશારૂપ કાર્ય થાય.

( અનુસંધાન પાનું ૪૮ )

\* ચેતનભાવ જ સાચું જીવન છે...હેણનો સંયોગ એ જીવન નથી.

## મહાવીરના માર્ગને સેવો ને મહાનસુખને પામો.

અત્યારે ભગવાનના મોક્ષના અઢીહજાર વર્ષનો મંગલ ઉત્સવ ચાલે છે. જેમ વડીલો મંગલ પ્રસંગે આશીર્વાદ આપે છે કે તમે સુખી થાઓ! તેમ આનંદરસને પીનારા વીતરાળી-વડીલો મોક્ષને સાધવાના મંગલ પ્રસંગે આશીર્વાદ આપે છે કે હે ભવ્ય! તું શાનચેતનારૂપ થઈને સાહિબનંતકાળ તારા ચૈતન્યસુખને ભોગવ! તારા સુખસ્વભાવને ઓળખીને તું સુખી થા-એવો સુખી થા કે ફરીને અનંતકાળમાં કદી દુઃખ આવે નહિં.

આત્માનું અતીન્દ્રિયજ્ઞાન તે એકાંતસુખ છે. શાનસ્વભાવ જ્યાં છે ત્યાં સુખસ્વભાવ પણ છે જ; એટલે ગુણભેદ ન પાડો તો જે શાન છે તે જ સુખ છે. જે અતીન્દ્રિયજ્ઞાનરૂપે પરિણમેલો આત્મા તે પોતે જ અતીન્દ્રિયસુખરૂપ છે. આત્મામાં શાનપરિણમનની સાથે સુખપરિણમન પણ ભેગું જ છે. સુખ વગરનું શાન, કે શાન વગરનું સુખ હોતું નથી.

કોઈ કહે કે અમને આત્માનું શાન નથી પણ અમે સુખી છીએ, -તો અતીન્દ્રિયજ્ઞાન વગરનું તેનું સુખ તે સાચું સુખ નથી, તેણે માત્ર બાધ્યવિષયોમાં સુખની કલ્પના કરી છે, ને તે કલ્પના ખોટી છે. -વિષયોની આકૃણતામાં સુખ કેવું? સુખ તો અતીન્દ્રિયજ્ઞાનમાં છે; શાન વગર સુખ હોય નહિં.

તેમજ કોઈ કહે છે કે અમને શાન ઘણું છે પણ સુખ નથી, -તો તેણે પણ માત્ર ઈન્દ્રિયજ્ઞાનને જ શાન માન્યું છે તે સાચું શાન નથી. શાન તો આકૃણતા વગરનું સુખસ્વરૂપ હોય. સુખના વેદન વગરનું શાન કેવું? -એ શાન નથી પણ અશાન છે.

આ રીતે શાન ને સુખ-એ બંને આત્માનો સ્વભાવ છે પ્રભો! તારું શાન ને તારું સુખ બંને અચિંત્ય, ઈન્દ્રિયાતીત, અદ્ભુત છે; તેને ઓળખનારું શાન ઈન્દ્રિયોથી પાર થઈને અતીન્દ્રિય-મહાન શાનસામાન્યમાં ઝડીને તન્મય થાય છે, અને ત્યારે પોતામાં જ તેને મહાન સુખનો અનુભવ થાય છે. અહો, આવું અતીન્દ્રિયજ્ઞાન ને સુખ તો મારો સ્વભાવ જ છે; હું મારા સ્વભાવથી જ આવા મહાન શાન ને સુખરૂપે થાઉં છું; તેમાં જગતના બીજા કોઈની અપેક્ષા મને નથી. અરે, સુખમાં તન્મય

સ્વાનુભૂતિ સહિત અવતરેલા ભગવાન મહાવીરે જગતને સ્વાનુભૂતિનો માર્ગ બતાવ્યો

થયેલી મારી જ્ઞાનચેતનાને જ્યાં રાગ સાથેય સંબંધ નથી ત્યાં બહારમાં બીજા કોઈ સાથે સંબંધ કેવો ? -આ રીતે ધર્મજીવ પોતાની જ્ઞાનચેતનામાં કોઈપણ પરભાવને ભેળવતો નથી; શુદ્ધજ્ઞાનઉપયોગરૂપે પરિણમતો-પરિણમતો તે મોક્ષના મહાન આનંદને સાથે છે.

-આ છે મોક્ષનો મંગલ ઉત્સવ. -આ જ છે વીરપ્રભુનો મુક્તિમાર્ગ.



### પરમાત્મા તેડાવે છે....ને સંતો આનંદિત થાય છે


જાણો કે સાક્ષાત્ પરમાત્માએ બોલાવ્યા હોય ને તેમને મળવા માટે જતા હોય-તેમાં કેટલો આડ્લાદ હોય !! તેમ સ્વભાવની ભાવનામાં સાધકને પરમ આડ્લાદ છે. એક સાધારણ રાજ મળવા માટે તેડાવે તોય લોકો કેવા ખુશી થાય છે ? ત્યારે અહીં તો અંદરમાં ભગવાન ભેટવા બોલાપે છે કે: આવો આવો ! આ આનંદમય ચૈતન્યધારીમાં આવો ! આવા ચૈતન્યના અનુભવમાં એકલો આનંદનો આડ્લાદ જ ભર્યો છે. વાડ ! ભગવાનના તેડાની આ વાત સાંભળતાં પણ શ્રોતાઓ કોઈ અનેરો ઉદ્ઘાસ અનુભવે છે.

શુદ્ધ આનંદસ્વભાવનો જે ખરેખરો ઉદ્ઘાસ ને ઉમંગ આવવો જોઈએ, તે ઉદ્ઘાસ અણાનીને નથી આવતો તેથી તે બીજે અટકી જાય છે; જો ખરો ઉદ્ઘાસ અને ઉમંગ આવે તો અનુભવ થયા વિના રહે નહિ. ચૈતન્યભગવાન આનંદામૃતનો વેલો છે. આવી અદ્ભુત પોતાની સ્વવસ્તુ પ્રત્યે અસંખ્યપ્રદેશો ઉલ્લસે ત્યાં પરિણિતિ વિભાવથી પાછી ફરી જાય છે, સ્વાનુભવ થાય છે; તે સ્વાનુભવમાં તેને પરમાત્માની પ્રાપ્તિ છે.-આવા સ્વાનુભવનું નામ પરમાત્માની સ્તુતિ છે. ચૈતન્યના અનુભવના મહા સામર્થ્યવડે મોહનો ક્ષય કરી નાંખે છે, તે પરમાત્માની ઉત્કૃષ્ટ સ્તુતિ છે; અલ્પકાળમાં તે સ્વયં પરમાત્મા થાય છે. તે સાધકને પરમાત્માના તેડા આવી ગયા છે. નિર્વિકલ્પધ્યાનવડે સાક્ષાત્ પરમાત્મા સાથે તેનું મિલન થાય છે. અહા, ભગવાનના મિલનના આનંદની શી વાત !

( ગુરુરૂદેવના પ્રવચનમાંથી )

અહો સર્વજ્ઞ મહાવીર ! આપ મોક્ષમાર્ગના નેતા છો....વિશ્વના શાતા છો.

## ત્રિશલામાતા અને વર્દ્ધમાન કુંવર વચ્ચે ચર્ચા



- ✿ માતાજી બેટા છે, ત્યાં પારણામાંથી મંગલવાજાં જેવો મધુર અવાજ સંભળાય છે-મા...ઓ...મા !
- ✿ માતા આશ્રયથી જવાબ આપે છે: હાં, બેટા વર્દ્ધમાન ! બોલિયે.
- ✿ મા, શુદ્ધાત્મતત્ત્વનો મહિમા કેવો અગાધ છે ! તેની તને ખબર છે ?
- ✿ હા, બેટા ! જ્યારથી તું મારા ઉદ્રમાં આવ્યો ત્યારથી શુદ્ધાત્મતત્ત્વનો અગાધ મહિમા મેં જાણી લીધો.
- ✿ આત્માનો કેવો મહિમા જાણ્યો ! મા, મને કહો.
- ✿ બેટા, જ્યારથી અહીં આકાશમાંથી રત્નવૃદ્ધિ થવા માંડી, જ્યારથી મેં દિવ્ય ૧૯ સ્વર્ણો દેખ્યા, ને તે સ્વર્ણના અદ્ભુત ફળ જાણ્યા ત્યારથી મને થયું કે અહા, જેનાં પુષ્યનો આવો આશ્રયકારી પ્રભાવ....તે આત્માની પવિત્રતાની શી વાત ! એવો આરાધક આત્મા મારા ઉદ્રમાં બિરાજ રહ્યો છે. -એમ અદ્ભુત મહિમાથી આત્માના આરાધકભાવનો વિચાર કરતાં કોઈ અચિત્ય આનંદસહિત શુદ્ધાત્મતત્ત્વ મને ભાસ્યું. બેટા મહાવીર ! એ બધો તારો જ પ્રતાપ છે.
- ✿ અહો માતા ! તીર્થકરની માતા થવાનું મહાભાગ્ય તને મળ્યું; તું જગતની માતા કહેવાણી. ચૈતન્યના અદ્ભુત મહિમાને જાણારી હો માતા ! તું પણ જરૂર મોક્ષગામી છો.

## ભગવાન મહાવીરનો ઈષ્ટ ઉપદેશ ભેદજ્ઞાનવડે સર્વત્ર વીતરાગતા જ કરાવે છે.

- ૱ બેટા વર્દ્ધમાન ! તારી વાત સત્ય છે. સ્વર્ગથી તારું આગમન થયું ત્યારથી અંતર અને બાબુ વૈભવ વૃદ્ધિગત થવા લાગ્યો છે....મારા અંતરમાં આનંદની અપૂર્વ સ્ફૂર્તા થવા લાગ્યી છે....મને તારા આત્માનો સ્પર્શ થયો ત્યારથી આરાધકભાવ શરૂ થઈ ગયો છે, ને એક ભવે હું પણ તારી જેમ મોક્ષને સાધીશ.
- ૱ અહો, ધન્ય માતા ! મારી માતા તો આવી જ શોભે. માતા, તારી વાત સાંભળીને મને આનંદ થાય છે. હું આ ભવમાં જ મોક્ષને સાધવા અવતર્યો છું, તો મારી માતા પણ મોક્ષને સાધનારી જ હોય ને !
- બેટા, તું તો આખા જગતને મોક્ષમાર્ગ દેખાડનાર છો; તારા પ્રતાપે તો જગતના ભવ્ય જીવો આત્માને જાણશે, ને મોક્ષમાર્ગને પામશે. -તો હું તારી માતા કેમ બાકી રહું ? હું પણ જરૂર મોક્ષમાર્ગ આવીશ. બેટા, તું ભલે આખા જગતનો નાથ.....પણ મારો તો પુત્ર ! તને આશીર્વાદ આપવાનો તો મારો ફક્ક છે.
- વાહ માતા ! તારું હેત અપાર છે...માતા તરીકે તું પૂજ્ય છો....તારું વાતસભ્ય જગતમાં અજોડ છે.-

**માતા મારી મોક્ષસાધિકા ધન્ય ધન્ય છે તુજને.....**

**તુજ હૈયાની મીઠી આશીર્ણ વહાલી લાગે મુજને....**

**માતા ! દરશન તારા રે...જગતને આનંદ કરનારા....**

**બેટા, તારો અદ્ભુત મહિમા સમ્યક ઝીરલે શોભે...**

**તારા દર્શન કરતાં ભવ્યો, મોહનાં બંધન તોડે....**

**બેટા ! જન્મ તુમારો રે જગતને આનંદ દેનારો....**


**માતા ! તારી વાણી મીઠી, જાણે ફૂલડાં ખરતાં....**

**તારા ફર્જી હેત-ફૂવારા ઝરમર-ઝરમર ઝરતાં....**

**માતા ! દરશન તારા રે...જગતને આનંદ કરનારા....**

**( વાહ બેટા ! તારી વાણી તો અદ્ભુત છે**

**ને ભવ્ય જીવોને મોક્ષનો માર્ગ દેખાડનાર છે.)**



તારી વાણી સુષાતાં ભવ્યો, મુક્તિપંથે દોડે...  
 ચેતનરસનો સ્વાદ ચાખે ત્યાં રાજપાટ સબ છોડે...  
 બેટા ! જન્મ તુમારો રે, જગતને મંગલકારી રે...  
 જાગે ભાવના માતા મુજને ક્યારે બનું વીરાળી...  
 બંધન તોડી રાગતણાં સૌ બનું પરિચહ્ય ત્યાળી...  
 માતા ! દરશન તારા રે જગતને આનંદ કરનારા...  
 બેટા, તું તો બે જ વરસનો, પણ ગંભીરતા ભારી,  
 ગૃહવાસી પણ તું તો ઉદાસી, દશા મોહથી ન્યારી...  
 બેટા ! જન્મ તુમારો રે...જગતને આનંદ દેનારો...  
 માતા ! તું તો છેલ્લી માતા, માત બીજી નહિ થાશે,  
 રત્નત્રયથી કેવળ લેતાં જન્મ-મરણ દૂર જાશે...  
 માતા ! દરશન તારા રે જગતને આનંદ કરનારા...  
 બેટા, તું તો જગમાં ઉત્તમ આત્મ-જીવન જીવનારો..  
 દિવ્યધ્યનિનો સંદેશ દઈને મુક્તિમાર્ગ ખોલનારો..  
 બેટા...ધર્મ તુમારો રે જગતનું મંગલ કરનારો...

માતા ! મુક્તિ મારગ ખુલ્લો ભવ્યો ચાલ્યા આવે....  
 ભરતક્ષેત્રમાં જ્યવંત શાસન આનંદમંગલ આપે....  
 માતા ! દરશન તારા રે જગતને આનંદ કરનારા.  
 બેટા, તું છો વર્દ્ધમાન સાચો, ધર્મવૃદ્ધિ કરનારો,  
 મહાવીર પણ સાચો તું છો, મોહમ્મલ જીતનારો...  
 બેટા, ધર્મ તુમ્હારો રે...જગતનું મંગલ કરનારો...  
 માતા, કરું વીતરાગી વૃદ્ધિ નિજ પરમ પદ પામું,  
 જીવ બધા જિનધર્મને પામો..એવી ભાવના ભાવું...  
 માતા ! દરશન તારા રે....જગતને આનંદ હેનારા....  
 બેટા, જગમાં ધર્મની વૃદ્ધિ થાશે તારા પ્રતાપે,  
 જે ચાલે તુજ પગલે પગલે મોક્ષપુરીમાં આવે....  
 બેટા, ધર્મ તમારો રે જગતને આનંદ હેનારો....  
 માતા ! અનુભૂતિ ચેતનની અતિશય મુજને વહાતી,  
 અનુભૂતિમાં આનંદ ઉલ્લસે એની જત જ ન્યારી....  
 માતા..દરશન તારા રે જગતને આનંદ હેનારા...  
 બેટા, તું તો સ્વાનુભૂતિની મસ્તીમાં નિત મહાલે....  
 હીંચોળું હીરલાની હોરે, ઉરનાં વહાલે-વહાલે...  
 બેટા, જન્મ તમારો રે જગતને આનંદ હેનારો....

[ અહો, ત્રિશલામાતા અને બાતતીર્થીકર વર્દ્ધમાન-કુંવરની આ ચર્ચા અદૃષ્ટ આનંદકારી છે. આજે ઉજવાઈ રહેલ વીરનાથ ભગવાનના અઢીઙ્ઝારમા નિવીણમહોત્સવનું આ મહાન વર્ષ જગતના જીવોને મંગલરૂપ હો. વીરશાસનના પ્રતાપે ધરેઘરે આવા ઉત્તમ સંસ્કારવાળા માતા અને બાળકો જાગો ને આત્મકલ્યાણવડે જૈનશાસનને શોભાવો. ]

-જ્ય મહાવીર ]

[ ભ. હરિભાઈ રચિત માતા-પુત્રનો આ સંવાદ અત્યંત મધુર સંગીત સહિત ઘાટકોપરની ભજનમંડળીએ ટેપ-રેકર્ડ કરી આપેલ છે, જે સાંભળતાં અત્યંત પ્રસંજતા થાય છે. ]



હે વીરનાથ ભગવાન ! અંતરના આનંદમયમાર્ગ આપ શિવપુરીમાં પડોંચ્યા.



### [ લેખાંક: ચોથો ]

અહો, ભગવાન મહાવીરે જે વીતરાગી ઈષ્ટઉપદેશ અઠીડાર વર્ષ પહેલાં આપણાને આપ્યો, તે જ ઉપદેશનો વીતરાગી પ્રવાહ શ્રુતધર-સંતોષે ચાલુ રાખ્યો છે, ને મહાભાગ્યે આજે પણ તે ઉપદેશ પામીને આપણો આપણણું આત્મહિત કરી શકીએ છીએ. શ્રુતનો અપાર મહિમા આપ આ પ્રવચનમાં વાંચશો. દેહમાં આત્મબુદ્ધિથી દુઃખી થઈ રહેલા જગતને અત્યંત કરુણાપૂર્વક દેહથી જુદું ચૈતન્યતત્ત્વ દેખાડીને સંતોષે મહાન ઉપકાર કર્યો છે...

- ‘અરે ખેદ છે કે પોતાની ચૈતન્યસમૃદ્ધિને ભૂલેલું આ જગત બાબ્ય સંપત્તિમાં મૂર્ખાઈ પડ્યું છે !’ પોતે બધિરાત્મબુદ્ધિના અનંત દુઃખથી છૂટીને ચિદાનંદતત્ત્વને જાણ્યું છે, અને જગતના જીવો પણ આવા આત્માને જાણીને બધિરાત્મબુદ્ધિના અનંત દુઃખથી છૂટે એવી કરુણાબુદ્ધિથી પૂજ્યપાદસ્વામી કહે છે કે ‘હા હતં જગત !’ અરેરે ! જગત બિચારું ભમણાથી ઠગાઈ રહ્યું છે. ખેદ છે કે ચૈતન્યની આનંદસંપદાને ભૂલીને જગતના બધિરાત્મજીવો બહારની સંપત્તિને જ પોતાની માનીને છણાઈ રહ્યા છે; આત્માની સુધ-બુધ ભૂલીને આ જગત અચેત જેવું થઈ ગયું છે, તેને દેખીને સંતોને કરુણા આવે છે.

અરે જીવો ! તમે સમજો કે દેખાદિ બાબ્દાર્થો આત્માના નથી, આત્મા તો

## અહો સર્વજ્ઞ મહાવીર ! આપ મોક્ષમાર્ગના નેતા છો....વિશ્વના શાતા છો.

- તેમનાથી જુદો જ્ઞાન ને આનંદસ્વરૂપ છે; આવા આત્માને જાણ્યે-માન્યે  
—અનુભવ્યે જ દુઃખ ટળીને શાંતિ-સમાધિ થાય છે.
- મુનિવરો અને આચાર્યભગવંતો મુમુક્ષુ જીવોના ધર્મપિતા છે;  
બહિરાત્મ જીવોને અજ્ઞાનથી ભાવમરણમાં મરતા હેખીને તેઓને કરુણા  
આવે છે કે અરેરે ! ચૈતન્યને ચૂકીને મોહથી જગત્ મૂર્ખીએ ગયું છે ! તેને  
પોતાના આત્માની સુધ-બુધ રહી નથી. અરે ! ચૈતન્યભગવાનને આ શું  
થયું કે જડ-કલેવરમાં મૂર્ખીએ ગયો ? અરે જીવો ! અંતરમાં પ્રવેશ કરીને  
જુઓ...તમે તો ચિદાનંદસ્વરૂપ અમર છો.
- જેમ રાજા પોતાને ભૂલીને એમ માને કે હું ભીખારી છું, તેમ આ  
ચૈતન્યરાજા પોતાના સ્વરૂપને ભૂલીને, દેખ તે જ હું છું—એમ માનીને  
વિષયોનો ભીખારી થઈ રહ્યો છે; તેનું નામ ભાવમરણ છે. તેના ઉપર  
કરુણા કરીને કહે છે કે અરે જીવો ?
- “ક્ષણક્ષણ ભયંકર ભાવમરણો કાં અહો ! રાચી રહો.”**
- એ દેહાદિમાં આત્મબુદ્ધિ છોડો, ને ભિન્ન ચૈતન્યસ્વરૂપને  
ઓળખીને તેની શ્રદ્ધા કરો...કે જેથી આ ઘોર દુઃખોથી છૂટકારો થાય ને  
આત્માનું નિરાકૃત સુખ પ્રગટે.
- આત્માનું સ્વરૂપ ઓળખીને પછી તેને સાધતાં આત્મા પોતે  
સ્વયમેવ પરમાત્મા બની જાય છે. સાધ્ય અને સાધન બંને પોતામાં છે,  
પોતાથી બહાર કોઈ સાધ્ય કે સાધન નથી, માટે તમારી ચૈતન્યસંપદાને  
સંભાળો....ને બાબુદુદ્ધિ છોડો—એવો સંતોનો ઉપદેશ છે.
- [ હવે આજે ( જેઠ સુદ પાંચમે ) શુતપંચમીનો મહાન દિવસ  
હોવાથી તેના મહિમા સંબંધી થોડુંક કહેવાય છે. ]
- શુતપંચમીનો ઇતિહાસ આ પ્રમાણે છે:-
- વીતરાગ સર્વજ્ઞ અંતિમ તીર્થકર દેવાધિદેવ મહાવીર પરમાત્માના  
શ્રીમુખથી દિવ્યધ્વનિદ્વારા જે હિતોપદેશ નીકળ્યો તે જીલીને  
ગૌતમગણધરદેવે એક મુહૂર્તમાં બાર અંગની રચના કરી. બાર અંગમાં તો  
અપાર શુતજ્ઞાનનો દરિયો ભર્યો છે. મહાવીર ભગવાનના મોક્ષ પદ્ધાર્યા  
બાદ ગૌતમસ્વામી, સુધર્મસ્વામી અને જંબુસ્વામી એ ત્રણ કેવળી, તથા  
આચાર્ય વિષ્ણુ, નંદિ, અપરાજિત, ગોવર્ઝન અને

## \* હે પ્રભો ! આપનું અનેકાન્તશાસન સર્વેજીવોને માટે ભદ્રકારી છે. \*

ભદ્રબાહુ એ પાંચ શ્રુતકેવલી ભગવંતો ૧૬૨ વર્ષમાં અનુક્રમે થયા. ત્યારપણી બાર અંગનું જ્ઞાન પરંપરા ઘટતું-ઘટતું ચાલ્યું આવતું હતું. અને તેનો કેટલોક ભાગ ધરસેનાચાર્યદિવને ગુરુપરંપરાથી મળ્યો હતો. મહાવીર ભગવાન મોક્ષ પદ્ધાર્ય બાદ હટ્ટ વર્ષ ધરસેનાચાર્યદિવ થયા. તેઓ સૌરાષ્ટ્રના ગીરનારપર્વતની ચંદ્રગૂઝમાં બિરાજતા હતા, તેઓ અસ્તાંગ મહાનિમિત્તના જાણનાર અને ભારે શ્રુતવત્સલ હતા. ભગવાનની પરંપરાથી ચાલ્યા આવેલા શ્રુતના વિચ્છેદનો ભય થતાં તેમણે મહિમા-નગરીમાં ધર્મોત્સવ નિમિત્તે ભેગા થયેલા દક્ષિણા આચાર્યો ઉપર એક લેખ મોકલ્યો; તે લેખદ્વારા ધરસેનાચાર્યદિવના આશયને સમજીને તે આચાર્યોએ શાસ્ત્રના અર્થને ગૃહણ-ધારણ કરવામાં સમર્થ, મહા વિનયવંત, શીલવંત એવા બે મુનિઓને ધરસેનાચાર્યદિવ પાસે મોકલ્યા; ગુરુઓ દ્વારા મોકલવાથી જેમને ધણી તૃપ્તિ થઈ છે, જેઓ ઉત્તમ દેશ, ઉત્તમ કુળ અને ઉત્તમ જાતિમાં ઉત્પજ્ઞ થયેલા છે, સમસ્ત કળાઓમાં પારંગત છે, એવા તે બંને મુનિવરો ત્રણવાર આચાર્યભગવંતોની આજ્ઞા લઈને ધરસેનાચાર્યદિવ પાસે આવવા નીકળ્યા.

જ્યારે તે બંને મુનિવરો આવી રહ્યા હતા ત્યારે, અણી ધરસેનાચાર્યદિવે રાતના પાછલા ભાગમાં એવું શુભ સ્વર્ણ જોયું કે બે મહા સુંદર સંક્રાંતિ બળદ ભક્તિપૂર્વક ત્રણ પ્રદક્ષિણા દઈને નમ્રપણે ચરણોમાં નમી રહ્યા છે. —આ પ્રકારનું મંગલ સ્વર્ણ દેખવાથી સંતુષ્ટ થઈને આચાર્યદિવે ‘જયવંત હો શ્રુતદેવતા’ એવા આશીર્વાદનું ઉચ્ચારણ કર્યું.

તે જ દિવસે પૂર્વોક્ત બંને મુનિવરો આવી પહોંચ્યા, ને ભક્તિપૂર્વક આચાર્યદિવના ચરણોમાં વંદનાદિ કર્યા. મહાધીર ગંભીર અને વિનયની મૂર્તિ એવા તે બંને મુનિઓએ ત્રીજે દિવસે ધરસેનાચાર્યદિવ પાસે વિનયપૂર્વક નિવેદન કર્યું કે પ્રભો ! આ કાર્યને માટે અમે બંને આપના ચરણકમળમાં આવ્યા છીએ. તેઓએ આવું નિવેદન કર્યું ત્યારે ‘બહુ સારું, કલ્યાણ હો’ એમ આચાર્યદિવે આશિષ્યવચ્ચન કહ્યા.

ત્યારબાદ, જો કે શુભસ્વર્ણ ઉપરથી જ તે બંને મુનિઓની વિશેષતા જાણી લીધી હતી છતાં ફરીને પરીક્ષા કરવા માટે, ધરસેનાચાર્યદિવે તે બંને સાધુઓને

## \* ઉપયોગ-લક્ષણ જીવ છે ને એ જ સાચું જીવન છે. \*

બે મંત્રવિદ્યા આપીને કહું કે, બે દિવસના ઉપવાસપૂર્વક આ વિદ્યાને સિદ્ધ કરો. પરીક્ષા કરવા માટે આચાર્યદિવે એક વિદ્યાના મંત્રમાં વધારે અક્ષરો આપ્યા હતા ને બીજામાં ઓછા અક્ષરો આપ્યા હતા. બંને મુનિઓને વિદ્યા સિદ્ધ થતાં બે દેવીઓ દેખાણી, પણ તેમાં એકના દાંત બહાર નીકળેલા હતા, ને બીજા કાણી હતી. તેને જોઈને મુનિઓએ વિચાર્યુ કે ‘દેવતાઓ કદી વિકૃતાંગ હોતાં નથી.’ માટે જરૂર વિદ્યાના મંત્રમાં કંઈક ફેર છે. મહાસમર્થ એવા તે મુનિવરોએ મંત્રાક્ષરો સરખા કર્યા, જેમાં વધારે અક્ષરો હતા તે કાઢી નાંખ્યા, ને જેમાં ઓછા અક્ષરો હતા તે પૂરા કર્યા. પછી તે મંત્ર પઢતાં બંને દેવીઓ સરખા રૂપમાં દેખાણી. ભગવાન ધરસેનાચાર્યદિવ પાસે જઈને તેઓએ વિનયપૂર્વક સમસ્ત વૃત્તાંત કહેતાં આચાર્યદિવે સંતુષ્ટ થઈને તેમને ભગવાનની સીધી પરંપરાથી ચાલ્યું આવેલું અગાધ શુત્રજ્ઞાન ભણાવવું શરૂ કર્યું, ને અખાડ સુદ અગીયારસે સવારે ચંથ સમાપ્ત થતાં ભૂત જીતના વ્યંતરદેવોએ આવીને વાળ્ઝિંત્રનાદપૂર્વક તે બંનેની પૂજા કરી. ભૂત નામના દેવોએ પૂજા કરી તેથી ધરસેનાચાર્યદિવે એકનું નામ ‘ભૂતબલિ’ રાખ્યું, અને બીજા મુનિના દાંત દેવોએ સરખા કરી દીધા તેથી તેનું નામ ‘પુષ્પદંત’ રાખ્યું. અને એ રીતે ધરસેનાચાર્યદિવે શુત્રજ્ઞાન ભણાવીને તરત તે પુષ્પદંત અને ભૂતબલિ મુનિવરોને ત્યાંથી વિદાય આપી.

ત્યારબાદ તે બંને મુનિવરોએ તે શુત્રજ્ઞાનને ષટ્ખંડાગમ રૂપે ગંધ્યું...ને અંકલેશરમાં (લગભગ બે હજાર વર્ષ પહેલાં) જેઠ સુદ પાંચમે ચતુર્વિધ સંધે તે શુત્રજ્ઞાનના મહિમાનો ભારે મોટો ઉત્સવ કર્યો; એ રીતે વીતરાગી સંતોષે શુત્રજ્ઞાનનો પ્રવાહ વહેતો રાખ્યો. તેનો આજે દિવસ છે.

મહાવીર ભગવાને જે કહું અને અત્યારે મહાવિદેહમાં સીમંધર ભગવાન જે કહી રહ્યા છે તેનો અંશ આ શાસ્ત્રોમાં છે. રાગ-દ્રેષ્ટ - મોહરહિત વીતરાગી પુરુષોએ રચેલી આ વાણી છે. સર્વજ્ઞ ભગવાનની પરંપરાથી ચાલ્યું આવેલું આવું શુત્રજ્ઞાન ટકી રહ્યું તેથી ચતુર્વિધ સંધે ભેગા થઈને અંકલેશરમાં ઘણા જ મોટા મહોત્સવપૂર્વક જેઠ સુદ પાંચમે શુત્રજ્ઞાનનું બહુમાન કર્યું, ત્યારથી આ દિવસ ‘શુત્રપંચમી’ તરીકે પ્રસિદ્ધ થયો, અને દર વર્ષે તે ઉજવાય છે. અત્યારે તો

## \* એ જીવજો, જીવડાવજો પ્રભુ વીરનો ઉપદેશ છે. \*

તેનો વિશેષ પ્રચાર થતો જાય છે, ને ઘણો ઠેકાણો તો આઈ દિવસ સુધી ઉત્સવ કરીને શ્રુતજ્ઞાનની પ્રભાવના થાય છે. આ શ્રુતપંચમીનો દિવસ ઘણો મહાન છે. અહો, સર્વજ્ઞ ભગવાનની વાણી દિગંબર સતોએ ટકાવી રાખી છે.

પુષ્પદંત અને ભૂતબલિ આચાર્યભગવંતોએ જે ખટ્ટંડાગમ રચ્યા તેના ઉપર વીરસેનાચાર્યદ્વારે ધવલા નામની મહાન ટીકા રચી છે. તે વીરસેનાચાર્ય પણ એવા સમર્થ હતા કે સર્વર્થગમિની (-સકલઅર્થમાં પારંગત) એવી તેમની નૈસર્ગિક પ્રજ્ઞાને દેખીને બુદ્ધિમાન લોકોને સર્વજ્ઞની સત્તામાં સંદેહ ન રહેતો, અર્થાત્ તેમની અગાધ જ્ઞાનશક્તિને જોતાં જ બુદ્ધિમાનોને સર્વજ્ઞની પ્રતીત થઈ જતી. આવી અગાધ શક્તિવાળા આચાર્યદ્વારે ખટ્ટંડાગમની ટીકા રચી. આ પરમાગમ સિદ્ધાંતશાસ્ત્રો સેંકડો વર્ણથી તાડપત્ર ઉપર લખેલા મૂડબિક્રીના શાસ્ત્રબંડારોમાં વિદ્યમાન છે. થોડાંક વર્ણ પહેલાં તો તેના દર્શન પણ દુર્લભ હતા...પણ પાત્ર જીવોના મહાભાગ્યે આજે તે બધાર પ્રસિદ્ધ થઈ ગયા છે. (ગુસ્ટેવ સાથે દક્ષિણ દેશના તીર્થોની યાત્રા વખતે આપણે રત્નપ્રતિમા સહિત આ તાડપત્ર-લિખિત ધવલ સિદ્ધાંતના પણ દર્શન કર્યા હતા.) અને હવે તો તે મૂળશાસ્ત્રો હિન્દી અનુવાદ સહિત પ્રસિદ્ધિમાં આવ્યા હોવાથી મુમુક્ષુજીવો ઉલ્લાસથી તેનો અભ્યાસ કરી શકે છે.

આચાર્યભગવંતોએ સર્વજ્ઞભગવાનની વાણીનો સીધો નમૂનો આ શાસ્ત્રોમાં ભર્યો છે. એ ઉપરાંત બીજા અનેક મહાસમર્થ આભના થોભ જેવા કુંદકુંદાચાર્યદ્વારા વર્ગેરે સંતો જૈનજ્ઞાસનમાં પાક્યા, ને તેમણે સમયસારાદિ અલૌકિક મહાશાસ્ત્રો રચ્યાં.....તેનો એકેક અક્ષર આત્માના અનુભવમાં કલમ બોળીબોળીને લખાયો છે. એ સંતોની વાણીના ઊડાં રહ્યા ગુરુગમે સમજતાં અપૂર્વ આત્મતાત્ત્વનો અપાર વૈભવ દેખાય છે. મહાવીરભગવાનની પરંપરાથી કેટલુંક જ્ઞાન મળ્યું તથા પોતે સીમંધર ભગવાનના ઉપદેશનું સાક્ષાત શ્રવણ કર્યું, તે બંનેને આત્માના અનુભવ સાથે મેળવીને આચાર્યભગવાને શ્રી સમયસારમાં ભરી દીધું છે. ને એ રીતે આત્માના સમસ્ત વૈભવથી એકત્વ-વિભક્ત આત્મસ્વરૂપ દેખાડ્યું છે.

આ સમાધિશતકનાં બીજાં પણ સમયસારમાં જ ભર્યા છે. પૂજ્યપાદસ્વામી પણ મહાસમર્થ સંત હતા, તેમણે આ સમાધિશતકમાં ટૂકામાં અધ્યાત્મભાવના ભરી દીધી છે. તે આપ આ લેખમાળામાં વાંચી રહ્યા છો.



\* ચૈતનભાવ જ સાચું જીવન છે....દેહનો સંયોગ એ જીવન નથી. \*

## જિનવચનનો સાર; તેનું ફળ સિદ્ધાલયસુખની પ્રાપ્તિ

**( શીલપ્રાભૂતના પ્રવચનોમાંથી )**

શુદ્ધરત્નત્રયરૂપ આત્મસ્વભાવ તે શીલ છે. એવા શીલની આરાધનાવડે સિદ્ધાલયની પ્રાપ્તિ થાય છે. જે મહાત્માઓ આવા શીલના ધારક છે તેમનો જન્મ ધન્ય છે. આવા શીલધર્મની પ્રાપ્તિ જિનવચનથી થાય છે.

જિનવચનવડે જેણે સારને ગ્રહણ કર્યો છે,-સાર શું ? કે શુદ્ધઆત્મા તે જ જિનવચનનો સાર છે, -એવો સાર જેણે ગ્રહણ કર્યો છે, અને શુદ્ધાત્માનું ગ્રહણ કરીને જેઓ વિષયોથી વિરક્ત થયા છે, વળી જેઓ તપોધન છે, ધીર છે, અને શીલરૂપી પવિત્ર જળવડે સ્નાન કરીને વિશુદ્ધ થયા છે, તેઓ સિદ્ધાલયના સુખને પામે છે.

જુઓ, આ જિનવચનના ગ્રહણનું ફળ ! જિનવચન શુદ્ધઆત્માનું ગ્રહણ કરાવે છે ને વિષયોનું વિરેચન કરાવે છે. સ્વસન્મુખ થઈને જેણે શ્રદ્ધામાં-જ્ઞાનમાં ને ચારિત્રમાં શુદ્ધઆત્માનું ગ્રહણ કર્યું તેણે જિનવચનના સારનું ગ્રહણ કર્યું. જિનવચનના જ્ઞાન વગર સત્યસાર હૃથમાં આવે નાહિ. પોતાના જિનસ્વરૂપની પ્રાપ્તિ તે જિનવચનનો સાર છે. શુદ્ધાત્માના ગ્રહણ અને અનુભવ વગર બધુંય નિસ્સાર છે.

શુદ્ધાત્માના ગ્રહણ વગર વિષયોથી સાચી વિરક્તિ થાય જ નહીં. જિનવચનનો સાર જાણીને શુદ્ધાત્માનું ગ્રહણ કરી મુનિવરો વિષયોથી વિરક્ત થાય છે, ચૈતન્યમાં ઉપયોગને જોઈને પરમ ઉજ્જવળતા પ્રગટ કરે છે; તેઓ એવા ધીરપણે બુદ્ધિને સ્વરૂપમાં જોડે છે કે ગમે તેવા પરિષહ આવે તોપણ ડગતા નથી. આવા મુનિવરો પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ વડે ૮૪ લાખ ઉત્તરગુણો સહિત સંપૂર્ણ શીલ પ્રગટ કરીને, તે શીલરૂપી જળવડે કર્મમળને ધોઈ નાખે છે ને મોક્ષમંદિરમાં બિરાજતા થક પરમ અતીન્દ્રિય આનંદને બાધારહિત ભોગવે છે. શીલની એટલે કે શુદ્ધરત્નત્રયની આરાધનાનું આ ફળ છે, ને તેની પ્રાપ્તિ જિનવચનદ્વારા થાય છે. માટે જિનાગમનો

## \* :સમ્યકૃત્વાદિ ભાવવડે ચૈતન્યજીવન જીવવાનો ભગવાનનો ઉપદેશ છે \*

નિરંતર અભ્યાસ કર્તવ્ય છે, એટલે જિનાગમે કહ્યું છે તે પ્રમાણે સ્વસન્મુખ પરિણામનો નિરંતર પ્રયત્ન કર્તવ્ય છે.

સૌથી પણેલાં તો જિનવચન અનુસાર શુદ્ધાત્માને જાણીને સ્વસન્મુખ સ્વાનુભવ સહિત તેની સમ્યક્ પ્રતીતિ કરે તે સમ્યજ્ઞર્શનની આરાધના છે; ત્યાંથી કર્માની નિર્જરા થવા માંડે છે. પછી સ્વરૂપમાં સ્થિર થઈને અત્યંત વિશુદ્ધભાવથી ઉત્કૃષ્ટ આરાધના કરતાં જીવ મુક્તિ પામે છે. અને જેને કાંઈક આરાધના અધૂરી રહી જાય તે ધર્માત્મા મુનિરાજ કે શ્રાવક આરાધના સહિત સલ્લેખના કરીને સ્વર્ગમાં જાય છે ને પછી મનુષ્ય થઈ આરાધના ઉત્કૃષ્ટપણે પૂર્ણ કરીને મોક્ષને પામે છે. આ રીતે શીલ કહો, આરાધના કહો, કે મોક્ષમાર્ગ કહો—તે જિનવચનનો સાર છે, ને તેનું ફળ સિદ્ધાલયસુખની પ્રાપ્તિ છે.

### સમ્યજ્ઞાન સર્વ પ્રયોજનની સિદ્ધિનું કારણ હોવાથી મંગળરૂપ છે.

લોકમાં સર્વજનપ્રસિદ્ધ છે કે યથાર્થજ્ઞાનથી સર્વ સિદ્ધિ છે. પ્રથમ તો દર્શનની વિશુદ્ધિપૂર્વક ભગવાન અર્હતદેવ પ્રત્યે પરમભક્તિ હોય; આવા સમ્યકૃત્વસહિત હોય ને જિનભક્તિ સહિત હોય તેવા જ્ઞાનને જ ખરેખર જ્ઞાન કહેવાય છે. અહા, જેમના વચનથી સમ્યકૃત્વની પ્રાપ્તિ થાય છે તેમના પ્રત્યે જો પરમભક્તિ ન ઉત્લસે તો ત્યાં સમ્યકૃત્વની આરાધના ક્યાંથી હોય? જેના વચનથી સમ્યકૃત્વ થાય છે એવા દેવ-ગુરુ પ્રત્યે પરમભક્તિ હોય છે, એવી ભક્તિ વગરનું જ્ઞાન તે જ્ઞાન નથી પણ અજ્ઞાન જ છે. વળી ચૈતન્યનું ભાન થતાં અતીન્દ્રિય આનંદના સ્વાદ પાસે જગતના વિષયોનો સ્વાદ તૂચ્છ લાગે છે, એટલે સહેજે વિષયોથી વિરક્તિ થઈ જાય છે. જો ચૈતન્યરસની પરમપ્રીતિ અને વિષયોથી વિરક્તિ ન થાય તો તેણે જાણ્યું શું? તેણે સંસાર અને મોક્ષના કારણને કઈ રીતે જાણ્યા? વિષયો તો સંસારનું કારણ છે અને વિષયોથી વિરક્તિ કરીને ચૈતન્યસન્મુખ પ્રવૃત્તિ તે મોક્ષનું કારણ છે. જે જીવ સંસાર-મોક્ષના કારણને ઓળખે છે તેને ચૈતન્યના આનંદના અનુભવની પ્રીતિ છે, ને વિષયોમાં આકુળતાનું વેદન છે તેનાથી તે વિરક્ત થાય છે. અહા, ચૈતન્યનો પરમ શાંતરસ જેણે ચાખ્યો તેને આકુળતાજનક વિષયોનો રસ કેમ રહે?

## અમે પણ આનંદપૂર્વક આપના જ માર્ગ શીવપુરીમાં આવી રહ્યા છીએ.

આ રીતે સમ્યગ્દર્શન થતાં જ ચૈતન્યનો રસીલો થઈને જગતના વિષયોથી વિરક્ત થાય છે, તેથી સમ્યકૃત્વ પણ મહાન શીલ છે. આવા સમ્યકૃત્વરૂપી શીલસહિત હોય તે શાન જ સમ્યગ્જ્ઞાન છે; શાનની ને શાસ્ત્રને જાણવાની મહત્ત્વા તો સમ્યકૃત્વથી જ છે. સમ્યગ્દર્શન વગરના શાનની કે શાસ્ત્રના જાણપણાની કાંઈ બડાઈ નથી. અહા, સમ્યકૃત્વસહિત અને વિષયોથી વિરક્ત એવું જે સમ્યગ્જ્ઞાન તે સર્વપ્રયોજનની સિદ્ધિનું કારણ છે. તેથી તે મહાન મહિમાવંત છે. આ રીતે સમ્યકૃત્વસહિતના શાનનો જે મહિમા કર્યો તે જ મંગળ છે. તેનું ફળ મોક્ષસુખની પ્રાપ્તિ છે.

## ઉત્સવ આનંદથી ડળીમળીને ઉજવીએ

( વીરપ્રભુના ઉપકાર બાબતમાં સૌ એકમત છીએ )

મહાવીર ભગવાનના અઢીઙજારવર્ણીય નિર્વિશ-મહોત્સવમાં વારંવાર પ્રમોદપૂર્વક ગુરુદેવ કહે છે કે-અહો, આવો અવસર ક્યારે આવે! આવા ઉત્સવમાં પરસ્પર કલેશ કે વિરોધ થાય એવું કોઈએ કરવું ન જોઈએ. ભગવાનમહાવીર પ્રત્યે ભક્તિભાવથી, શાસનની શોભા વધે, ને સર્વત્ર શાંતિ જળવાય એવાત મુખ્ય રાખીને સૌએ પોત પોતાને યોગ્ય લાગે તે રીતે મહોત્સવ ઉજવવો યોગ્ય છે. ઉજવાણીનો વિરોધ કરવો યોગ્ય નથી; સૌ એકબીજાના સાધર્મી છીએ-એમ સમજી ક્યાંય વેરવિરોધ ન થાય તેમ સૌએ કરવું યોગ્ય છે. કોઈએ એકબીજા માટે કટુભાષા વાપરવી ન જોઈએ, સૌએ પ્રેમથી અને જેટલા બને તેટલા સહકારથી કામ કરવું જોઈએ. મહાવીરભગવાનના આપણા ઉપર મહાન ઉપકાર બાબતમાં તો ક્યાંયે મતભેદ નથી, સૌ એકમત છીએ. મહાવીર એક છે-મહાવીરના અનુયાયીઓ પણ એકમત થઈને પ્રભુના મોક્ષગમનનો મહાન ઉત્સવ આનંદથી ઉજવીએ, અને એ પાવન પંથે જઈએ. “જ્ય મહાવીર” \* \*

**\* પ્રણમન કરું કું ધર્મકર્તા તીર્થ શ્રી વર્દ્ધમાનને \***

## જિજ્ઞાસુનું પ્રથમ કર્તવ્ય-આત્મતત્ત્વનો નિર્ણય

[ સભ્યકૃત્વ-જીવન લેખમાળા: લેખાંક - ૧૧ ]

સુખ કહો કે સભ્યકૃત્વ કહો-તે જીવને વહાલું છે.  
જેમાં સુખ ભર્યું છે. એવા પોતાના જ્ઞાનસ્વરૂપનો સાચો  
નિર્ણય જ્ઞાનવડે કરવો તે જ સભ્યકૃત્વની રીત છે. જેણે  
એવો નિર્ણય કર્યો તેને પાત્રતા થઈ ને તેને અંતરમાં  
અનુભવ થશે જ.

સભ્યગ્રદ્ધન થતાં પહેલાં સંસાર-હુંખોથી ગ્રાસીને આત્માનો આનંદ પ્રગટ કરવા  
માટેની ભાવના જાગે છે.

હે ભાઈ ! તારે સુખી થવું છે ને ?-તો તું તારા સાચા સ્વરૂપને ઓળખ, -કે જેમાં  
ખરેખર સુખ ભર્યું છે. આત્માના સ્વરૂપનો પહેલાં સાચો નિર્ણય કરવાની વાત છે. અરે,  
તું છો કોણ ? શું ક્ષણિક પુણ્ય-પાપનો કરનાર તે જ તું છો ? ના, ના, તું તો જ્ઞાન કરનાર  
જ્ઞાનસ્વભાવી છો. પરને ગ્રહનાર કે છોડનાર તું નથી, ચેતકભાવ જ તું છો. આત્માનો  
આવો નિર્ણય તે જ ધર્મની પહેલી શરૂઆતનો ( સભ્યગ્રદ્ધનનો ) ઉપાય છે. આવો  
નિર્ણય ન કરે ત્યાંસુધી સભ્યગ્રદ્ધની પાત્રતામાં પણ નથી. મારો સહજ સ્વભાવ  
જાણવાનો છે-આવો જ્ઞાનસ્વભાવનો નિર્ણય શ્રુતજ્ઞાનના બળથી થાય છે, ને તે જ  
સભ્યકૃત્વની રીત છે. જેણે જ્ઞાનમાં સાચો નિર્ણય કર્યો તેને પાત્રતા થઈ, ને તેને અંતરમાં  
અનુભવ થવાનો જ છે. માટે તત્ત્વનિર્ણય તે જિજ્ઞાસુ જીવનું પ્રથમ કર્તવ્ય છે.

હું જ્ઞાનસ્વભાવી જાણનાર છું, જ્ઞેયમાં કયાંય રાગ-દેષ કરીને અટકવું તેવો મારો  
જ્ઞાનસ્વભાવ નથી. પર ગમે તેમ હો, હું તો તેનો માત્ર જાણનાર છું, મારો જાણનાર  
સ્વભાવ પરનું કાંઈ કરનાર નથી; પણ જ્ઞાનસ્વભાવ સાથે મારામાં શ્રદ્ધા-શાંતિ-આનંદ  
વગેરે અનંત સ્વભાવો છે. હું જેમ જ્ઞાનસ્વભાવી છું તેમ જગતના બધા આત્માઓ  
જ્ઞાનસ્વભાવી છે; તેમાં તેઓ પોતાના જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરીને જ્ઞાનભાવરૂપે

## \* અસીમ શાનાદિ ગુણધારી જિતભવ મહાવીર-જિનને વંદન \*

પરિણામે-તો જ તેમનું દુઃખ ટળે ને તેઓ સુખી થાય. પરજીવોનું દુઃખ કોઈ મટાડી શકે નહિ; કેમકે દુઃખ તેઓએ પોતાની ભૂલથી ઉભું કર્યું છે, અને તેઓ પોતે પોતાની ભૂલ ટાળે તો તેમનું દુઃખ ટળે. કોઈ પરના લક્ષે અટકવાનો શાનનો સ્વભાવ નથી.

અરે જીવ! અત્યારસુધી પોતાના સુખને ભૂલીને તેં પરમાં સુખ માન્યું....તું બ્રમજાથી ભૂલ્યો ને દુઃખી થયો. અરે, સ્વપદને દુર્ગમ ને પરપદને સુગમ માનીને તેં સ્વપદની અરુચિ કરી, ને પરપદને સારું માનીને તેને પોતાનું કરવાની વ્યર્થ ચેષ્ટા કરી-કરીને તું દુઃખી થયો, પર ચીજ તો કદી આત્માની થતી નથી. ચૈતન્યમય સ્વપદ છે, તે સ્વપદનો વારંવાર પરિચય કરતાં તે સહજ-સુગમ ને સુંદર લાગે છે; વારંવાર તેની ભાવના કરતાં આનંદ થાય છે. ચૈતન્યપદ પોતે આનંદરૂપ છે એમ જાણીને વારંવાર તેની ભાવના કર. શુદ્ધચૈતન્યમય મારું સ્વપદ છે-એવી ભાવનામાં વર્તતો મુમુક્ષુ જીવ જગતની કોઈપણ પ્રતિકૂળતાથી ભય પામતો નથી; બધાયથી આત્માને છૂટો પાડીને શાનસ્વભાવનો નિર્ણય કરે છે. અહા, અનંતસુખનું ધામ મારું ચૈતન્યતત્ત્વ છે-એને હું કેમ કરીને વેદનમાં લઉં!-એવી તેને ધૂન જાગે છે. ચૈતન્યપદને જ ચાહતો થકો દિનરાત તેના અનુભવની ભાવના ભાવે છે, જગતમાં સુખનું ધામ કોઈ છોય તો મારું આ ચૈતન્યપદ જ છે-એમ પોતાનો વિશ્વાસ કરતો થકો સ્વસન્મુખ ઝુકતો જાય છે. વિશ્વાસના જોરે જેમ જેમ અંતરમાં લગની વધતી જાય છે તેમ તેમ આનંદનું ધામ તેને પોતાની અંદર નજીક ને નજીક દેખાતું જાય છે.

તે પાત્ર જીવે શુતજ્ઞાનના અવલંબનથી આત્માના શાનસ્વભાવને અવ્યક્તપણે લક્ષમાં લીધો છે, એટલે સ્વભાવસન્મુખ ઝુક્યો છે,-સમ્યક્ત્વસન્મુખ થયો છે; પરિણામના પ્રવાહની દિક્ષા ફરી છે; તે અંતરમાં આગળ વધીને અનુભવ કરે છે એટલે આત્મસાક્ષાત્કાર અથીત સમ્યજ્ઞશન થાય છે. તે માટે તે જીવ શું કરે છે? આત્માની પ્રગટ પ્રસિદ્ધિને માટે ઇન્દ્રિય અને મનદ્વારા પર તરફ પ્રવર્તતી બુદ્ધિઓને પાછી વાળીને શાનને આત્મામાં લઈ જાય છે, એટલે ઉપયોગને આત્મસન્મુખ કરે છે, ત્યાં સાક્ષાત્ નિર્વિકલ્પ અનુભૂતિમાં ભગવાન આત્મા પ્રસિદ્ધ થાય છે. શાન વડે જે અપ્રગટરૂપ નિર્ણય કર્યો હતો તેનું આ ફળ આવ્યું એટલે કે પ્રગટરૂપ સ્વાનુભવ થયો. શાનસ્વભાવનો નિર્ણય કરે ત્યાં આવું ફળ આવે જ.

## \* લહરાયેગા લહરાયેગા જંડા શ્રી મહાવીરકા \*

આ જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય કરવો તે અપૂર્વ ભાવ છે, તે દરેક મુમુક્ષુનું જરૂરી કર્તવ્ય છે. જુઓ, અમુક શુભરાગ કરવો તેને કર્તવ્ય ન કહ્યું, પણ જ્ઞાનમાં આત્માનો નિર્ણય કરવો તેને કર્તવ્ય કહ્યું, એટલે જ્ઞાનભાવ જ સાધન છે, વચ્ચેનો રાગ તે કાંઈ સાધન નથી. આ સાધનથી જે પોતાના આત્માનું હિંત કરવા માંગે તે કરી શકે છે. પરંતુ જીવે અનાદિથી પોતાની દરકાર કરી નથી. ભાઈ રે! તું પોતે કોણ વસ્તુ છો? તે જાણ્યા વિના તું સુખ ક્યાંથી લાવીશ? ને સમ્યક્-દર્શન કોનું કરીશ? પહેલાં નક્કી કર કે જ્ઞાનસ્વભાવી જ હું છું; દેહ કે રાગસ્વરૂપ હું નથી.—આમ નક્કી કરતાં તારું લક્ષ તારા આત્મામાં વળશે, ને તારા નિધાન તને તારામાં દેખાશે. ભગવાન મહાવીરના સન્દેશરૂપ જે સમ્યગ્દર્શન—તે તને પ્રગટ થશે.

ઇન્દ્રિય અને મન સાથે જોડાયેલો ઉપયોગ આત્માને પ્રસિદ્ધ કરી શકતો નથી, તે તો પરને જ પ્રસિદ્ધ કરે છે. મન અને ઇન્દ્રિયોથી દૂર થયેલો ને અંતરમાં વળેલો ઉપયોગ જ ભગવાન આત્માને પ્રસિદ્ધ કરે છે...તેનું સાચા સ્વરૂપે દર્શન ( સમ્યક્-દર્શન ) કરી લ્યે છે, એ જ આત્મઅનુભૂતિ છે, એ જ ભગવાન મહાવીરનો સન્દેશ છે, તેના વડે ભવનો અંત આવે છે, ને મોક્ષસુખની પ્રાપ્તિ થાય છે. કોઈપણ શુભરાગવડે તે થઈ શકતું નથી. સમ્યગ્દર્શન તો પોતાનો સ્વભાવ છે; તેમાં અન્ય કોઈનું અવલંબન નથી. તારા આત્મામાં ભગવાન મહાવીરનો ધર્મધ્વજ ફરકાવવો હોય તો તું આવું સમ્યગ્દર્શન કર.

શુભ-અશુભભાવો તો અજ્ઞાની જીવ પણ અનાદિકાળથી કરતો આવે છે, તે કાંઈ ધર્મનો ઉપાય નથી, કે તેનાથી ભવનો અંત આવતો નથી. પણ તે શુભ-અશુભભાવોથી રહિત જ્ઞાનસ્વભાવી આત્માની ઓળખાણ કરવી તે જ ધર્મનો ઉપાય છે, ને તેનાથી જ ભવનો છેડો આવે છે.

- \* સમ્યગ્દર્શન થતાં શું થાય છે?
- \* સમ્યગ્દર્શન થતાં જ આત્માના સ્વરસની અપૂર્વ શાંતિ અનુભવાય છે, કખાય વગરની શાંતિમાં ઉપયોગ ઠરતાં આત્માનો સહજ આનંદ પ્રગટ થાય છે; અનાદિના ભવદૃઢની જે ભયંકર અશાંતિ તે વિરામ પામે છે, ને અપૂર્વ શાંતિમય

### \* અહો ધર્મચક્રવર્તક વીરનાથદેવ ! પધારો....પધારો...પધારો.... \*

ચૈતન્યજીવન શરૂ થાય છે. અંતરમાં આત્મા પોતાના સ્વરૂપની કોઈ પરમ તૃપ્તિનું સુખ વેદે છે, મારું સુખ મારા અંતરમાં ભર્યું છે એમ તેને સુખના અનુભવ સહિત પ્રતીત થઇ જાય છે; સમ્યગ્દટણજીવના પરિણામમાં કોઈ અચિંત્ય અપૂર્વ ગંભીરતા થઇ જાય છે. તે ગંભીરતાનું માપ ઉપલક્ષણિએ થઇ શકતું નથી. આવું સમ્યગ્દર્શન તે અભેદપણે આત્મા જ છે.

સમ્યગ્દર્શન અને આત્મા બંને અભેદ છે, આત્મા પોતે સમ્યગ્દર્શન સ્વરૂપ છે. આવા સમ્યગ્દર્શન વડે જ્ઞાનસ્વભાવી આત્માને અનુભવમાં લીધા પછી પણ અશુભ કે શુભ કષાયભાવો આવે ખરા, પરંતુ આત્મશાંતિ તો જ્ઞાનભાવમાં જ છે—એવો નિશ્ચય ચાલુ જ રહે છે. પછી જેમ જેમ જ્ઞાનભાવના વધતી જાય તેમ તેમ શુભાશુભ કષાયભાવો પણ ટળતા જાય છે ને શાંતિનું વેદન વધતું જાય છે. અંદરમાં શાંતરસની જ મૂર્તિ આત્મા છે તેના લક્ષે જે વેદન થાય તે જ સુખ છે અને એવા સુખનું વેદન સમ્યગ્દર્શનમાં છે. એક અંદર પ્રતિભાસમય આત્માનો અનુભવ તે જ સમ્યગ્દર્શન છે.

### \* મહાવીર-સંદેશ....મહાવીર-અંજલિ \*

અહો, આત્મઅનુભૂતિરૂપ અપૂર્વદશાની શાંતિની શી વાત ! વહાલા સાધમી ભાઈ—બહેનો ! વિચારો તો ખરા, કે જૈનશાસનના સર્વે સંતોષે જેની ખૂબખૂબ પ્રશંસા કરી છે તે અનુભૂતિ કેવી હશે ! એ વસ્તુનો મહિમા લક્ષમાં લઈને તેનો નિર્ણય કરો. એના નિર્ણયથી તમને અપાર આત્મબળ મળશે ને શીંગ તમારું કાર્ય સિદ્ધ થશે. બસ, બંધુઓ—



-આ ભગવાન મહાવીરનો સંદેશ છે, ને આ જ નિર્ણયમહોત્સવમાં પ્રભુ પ્રત્યેની સાચી અંજલિ છે.

**\* જય મહાવીર \***

# અધ્યાત્મ ભાવનાનું ઘોલન

( નવીન સ્વાધ્યાય )

(૪)

અધ્યાત્મભાવનાનું ઘોલન થાય ને સ્વાધ્યાયમાં વિશેષ રસ જાગે, તે માટે આ વર્ષથી કોઈ ને કોઈ નવીન શાસ્ત્રનો અનુવાદ રજુ કરવાનું આપણે શરૂ કરેલ છે. તે અનુસાર ‘પાહુડ દોહા’ ના અનુવાદનો આ ચોથો લેખ છે. જિજ્ઞાસુઓને આ લેખમાળા ગમી છે.

૧૦૧. આ પૃથ્વી પર જેનું ચિત્ત સર્વે રાગમાં, છએ રસોમાં કે પાંચ રૂપમાં રંજિત નથી, એવા યોગીને જ હે જીવ ! તારો મિત્ર કર.
૧૦૨. જેનું તપ જરાક પણ શરીરના સંગમાં સ્થિત છે ( અર્થાત् તપ કરવા છતાં જેને શરીરની જરાક પણ મમતા છે ) તે મનુષ્યને મરણનો હુસ્સણ દાવાનળ સહન કરવો પડે છે.
૧૦૩. દેહ ગળવા ટાણે મતિ-શુતની ધારણા-ધ્યેય વગેરે બધું ગળવા માંડે છે; હે વત્સ ! ત્યારે એવા અવસરમાં દેવને તો કોઈક વિરલા જ યાદ કરે છે.
૧૦૪. જેનું પવિત્ર મન સંસારના સુંદર પદાર્થોથી ભાગીને, મનથી પાર એવા ચૈતન્ય-સ્વરૂપમાં થંભી ગયું-પછી તે ગમે ત્યાં સંચરે તોપણ તેને નથી ભય કે નથી સંસાર.
૧૦૫. જીવોનો વધ કરવાથી નરક ગતિમાં જવાય છે, અને અભયપ્રદાનથી સ્વર્ગમાં જવાય છે. —આ બે પંથ અમે તને દેખાડ્યા, તેમાંથી તને જે ગમે તેમાં તું લાગ.
૧૦૬. આ સંસારમાં સુખ તો બે દિવસનું છે, પછી તો દુઃખોની પરિપાટી છે; તેથી હે હૃદય ! હું તને શિખામણ આપું છું કે તારા ચિત્તને તું વાડ કર, અર્થાત્ મર્યાદામાં રાખ, ને સાચા માર્ગમાં જોડ.
૧૦૭. હે મૂઢ ! તું દેહમાં રંજાયમાન ન થા; દેહ તે આત્મા નથી. દેહથી ભિન્ન જ્ઞાનમય આત્મા છે—તેને તું દેખ. હે યોગી ! દેહથી ભિન્ન જ્ઞાનમય એવો આત્મા તું છો.

## \* મહાવીરનો માર્ગ એટલે વીતરાગભાવની આરાધના \*

૧૦૮. અરે, ઘાસના જૂંપડા જેવી આ મૂર્ત કાયા છે; હે યોગી ! તેમાં જે પ્રાણવંતચેતન નિવાસ કરે છે તેને તું ભાવ.
૧૦૯. મૂળને છોડીને જે ડાળ પર ચડવા માંગે છે તેને યોગઅભ્યાસ કેવો ? જેમ પીજ્યા વગરના કપાસમાંથી વસ્ત્ર વણાતું નથી, તેમ મૂળગુણ વગર ઉત્તરગુણ હોતાં નથી.
૧૧૦. જેના સર્વે વિકલ્પો તૂટી ગયા છે અને જે ચેતનભાવને પામ્યો છે તે આત્મા નિર્મલ ધ્યાનમાં સ્થિત થઈને પરમાત્મા સાથે કેલિ કરે છે.
૧૧૧. હે ભવ્ય ! પરમ દેવને લક્ષ્માં લઈને, શીંગ આજે જ તું મસ્ત હાથીને જીતી લે-કે જેના પર ચડીને પરમ મુનિઓ સર્વ ગમનાગમનરહિત એવા મોક્ષમાં પહોંચી જાય છે.
૧૧૨. હે મસ્ત હાથી ! હે કરબા ! આ વિષમ ભવસંસારની ગતિને જ્યાંસુધી તું ઉખેડી ન નાંખ ત્યાંસુધી નિજગુણના બાગમાં તું મુક્તપણે તપ-વેલડીને ચર. તારા બંધન છોડી દેવામાં આવ્યા છે.
૧૧૩. જેને તપરૂપી દામન-લગામ છે, વ્રત રૂપી ચોકું છે, અને શમ-દમરૂપી પલાણ છે, -એવા ઊંટ પર બેસીને સંયમધરો નિર્વાણમાં ગયા.
૧૧૪. એક તો પોતે માર્ગને જાણતા નથી, ને વળી બીજા કોઈને પૂછતા પણ નથી, -એવા મનુષ્યો વન-જંગલ ને પહાડોમાં ભટકી રહ્યા છે-એને તું દેખ !
૧૧૫. જે તરુવર રસ્તાને છોડીને દૂર ફળ્યું-કૂલ્યું છે તે નકામું છે, નથી તો કોઈ પથિકો ત્યાં વિશ્રાબ લેતા, કે નથી તેના ફળને કોઈ હાથ લગાડતું. (તેમ માર્ગભષ જીવોનો વૈભવ નકામો છે.)
૧૧૬. છ દર્શનના ધંધામાં પડેલા અજ્ઞાનીઓના મનની ભ્રાંતિ ન મટી; અરેરે ! એક દેવના છ ભેદ કર્યા તેથી તેઓ મોક્ષને ન પામ્યા.
૧૧૭. એક પોતાના આત્મા સિવાય અન્ય કોઈ વેરી નથી. માટે હે યોગી ! જે ભાવથી તે કર્માનું નિર્માણ કર્યું તે પરભાવને તું મટાડ.
૧૧૮. જો કે હું રોકું છું તોપણ મન પરમાં જાય છે ને આત્મામાં ઠરતું નથી; મન વિષયોમાં ભમવાના કારણે જીવ નરકનાં દુઃખોને સહે છે.
૧૧૯. હે જીવ ! તું એમ ન જાણતો કે વિષયો મારાં છે ને મારાં રહેશો; અરે, એ તો કિંપાકફળની જેમ તને દુઃખ જ દેશે.
૧૨૦. હે જીવ ! તું વિષયોનું સેવન કરે છે-પણ એ તો દુઃખને જ દેનારાં છે;-જેમ

## \* ભગવાન મહાવીર જન્મકલ્યાણક-વિશેષંક \* .

- ધી વડે અજી પ્રજ્વલિત થાય છે તેમ વિષયો વડે તું ઘણો બળી રહ્યો છે.
૧૨૧. જેણે અશરીરીનું સંધાન કર્યું તે સાચો ધનુધારી છે; અને ચિત્તને એકાગ્ર કરીને જેણે શિવતત્ત્વને સાધ્યું તે ખરેખર નિશ્ચિંત છે.
૧૨૨. અલી સખી ! એવા દર્પણને તે શું કરવું ? -કે જેમાં આત્માનું પ્રતિબિંબ ન દેખાય. મને તો આ જગત બદ્ધાવરું પ્રતિભાસે છે, -કે જેને ગૃહપતિ ઘરમાં હોવા છતાં તેનું દર્શન નથી થતું.
૧૨૩. જીવતાં જ જેને પાંચ ઇન્દ્રિયસહિત મન મરી ગયું તેને મોકળો-છૂટો જ જાણો; નિર્વાણપંથ તેણે પ્રાપ્ત કરી લીધો.
૧૨૪. હે વત્સ ! થોડાકાળમાં જેનો ક્ષય થઈ જાય છે—એવા ઘણા અક્ષરોને તારે શું કરવા છે ? મુનિ તો જ્યારે અનક્ષર ( શબ્દાતીત-ઇન્દ્રિયાતીત ) થાય છે ત્યારે મોક્ષને પામે છે.
૧૨૫. છ દર્શનના ગ્રંથો એકબીજાથી વિરુદ્ધ ઘણા ગરજે છે, તે બધાથી પર, મોક્ષનું જે એક કારણ છે તેને તો વિરલા જ જાણે છે.
૧૨૬. હે વત્સ ! તું સિદ્ધાંત અને પુરાણને જાણ; તેને જાણતાં બ્રાંતિ રહેતી નથી. હે વત્સ ! આનંદસ્વરૂપમાં જે જામી ગયા તેને સિદ્ધ કરેવાય છે.
૧૨૭. આ લોકમાં શિવ અને શક્તિનો મેળાવડો તો પશુઓમાંચ હોય છે; પણ શિવથી ભિન્ન શક્તિવાળા શિવને તો કોઈ વિરલા જ ઓળખે છે. ( લોકો તો પશુ વગેરેમાંચ વ્યાપક એવા સર્વવ્યાપી શિવને માને છે, પણ એનાથી જુદા પોતાના આત્માને જ શિવસ્વરૂપે તો વિરલા-જ્ઞાની જ ઓળખે છે. )
૧૨૮. જેણે દેહથી ભિન્ન નિજ પરમાર્થતત્ત્વને જાણ્યું નથી, તે આંધળો બીજા આંધળાને મુક્તિ-પંથ કરી રીતે દેખાડશે ?
૧૨૯. હે યોગી ! તું દેહથી ભિન્ન આત્માને ધ્યાવ. જો દેહને તું પોતાનો માનીશ તો તું નિર્વાણ નહીં પામ.
૧૩૦. સુગુરુની મહાન છત્રધાયા પામીને પણ હે જીવ ! તું સકળ કાળ સંતાપને જ પામ્યો. પરમાત્મા નિજદેહમાં વસતા હોવા છતાં તેં પત્થર પર પાણી ઢોળ્યું.
૧૩૧. હે વત્સ ! સુગુરુનો સંગ છોડીને તું સદાકાળ ઝંખના-વ્યગ્રતા ન કર. પરમાત્મા નિજદેહમાં વસતા હોવા છતાં તું શૂન્ય મઠને કેમ સેવે છે ?



\* ભગવાન મહાવીરનું ધર્મચક સમ્યકૃત્વની ધરી ઉપર ફરે છે \*

## \* સમ્યકૃત્વ-જીવન \*

[ સમ્યકૃત્વ-લેખમાળા: લેખાંક-૧૨ ]

સમ્યકૃત્વ માટે મુમુક્ષુજીવનું જીવન કેવું હોય ! સમ્યકૃત્વની ભાવના વખતે અંદર કેવા ભાવો હોય ? ને સમ્યકૃત્વ પછી કેવું સુંદર જીવન હોય ? તે સંબંધી આ લેખમાળામાં રજુ થતું સ્વાનુભવરસરસરતું વર્ણન કોઈપણ જિજ્ઞાસુઓને ખુબ જ ગમી જાય તેવું છે.

અહો ! વીતરાગી સંતોએ બતાવેલા આત્મહિતનો વીતરાગી સત્ત્વ માર્ગ ! અને તે માર્ગ જનારા સંતોની વિચારધારા તથા રહેણી-કરણી તે તો કોઈ અદ્ભુત ને અલૌકિક છે ! પરંતુ તે માર્ગ પામવાની જ્યાં ખરી જિજ્ઞાસા જાગે છે ત્યાં પણ જીવના ભાવોમાં કોઈ આશ્ર્યકારી પલટો થવા માંડે છે; ને મુમુક્ષુજીવનમાં નવા જ ભાવો વેદાય છે.

સમ્યગ્દર્શનને લગતા પ્રયત્નની શરૂઆત કરતાં પહેલાં જિજ્ઞાસુને એ પ્રશ્ન ઊઠે છે કે-સમ્યગ્દર્શન એટલે શું ?

પોતાના શુદ્ધઆત્મસ્વરૂપની અનુભૂતિસહિત પ્રતીતિ તે સમ્યગ્દર્શન છે.

વળી તરત એવો પ્રશ્ન ઊઠે છે કે આવું સમ્યગ્દર્શન કેમ પ્રાપ્ત થાય ?

પ્રથમ તો જે જીવના અંતરમાં સાચી મુમુક્ષુતા જાગે છે તે જીવ, જ્ઞાનાનંદસ્વરૂપ આત્માનો અગાધ મહિમા જ્ઞાની પાસેથી જાણીને લક્ષગત કરે છે, ને પછી વારંવાર અભ્યાસ વડે પરિણામને તેમાં જોડીને, અંતર્મુખ ઉપયોગ વડે તેના અનુભવ સહિત તેનું સાચું દર્શન કરે છે,—તે સમ્યગ્દર્શન છે.

આ સમ્યગ્દર્શન મોક્ષનગરીમાં જવા માટેનું ઝડપી વાહન છે; કર્મરજના

### હે વીરનાથ ભગવાન ! અંતરના આનંદમયમાર્ગે આપ શિવપુરીમાં પડોંચ્યા.

- ગંજને ઊડાડી દેવા માટે તે મહા વાયરો છે, અને ભવના વનને બાળી નાખવા માટે તે અજિસમાન છે; મુમુક્ષુનો તે એક મનોરથ છે.
- અણા, સર્વજ્ઞ તીર્થકરોએ જેનો મહિમા દિવ્યધ્વનિ વડે પ્રસિદ્ધ કર્યો છે, તે ભગવાન આત્મા શુદ્ધચિદ્રૂપ, સર્વ તીર્થોમાં ઉત્કૃષ્ટ તીર્થ, સુખનો ઉત્તમ ખજાનો અને સૌથી સુંદર તત્ત્વ છે.
- આવા આચિંત્ય અદ્ભુત આત્મતત્ત્વનું જ્ઞાન થતાં જ પરિણામ જડપથી તે તરફ વળી જાય છે, -ક્ષણબેદ પણ રહેતો નથી. જ્યાં જ્ઞાન અંતરમાં વળ્યું ત્યાં શ્રદ્ધા વગેરે અનંતગુણો પણ પોતે પોતાના નિર્મજ ભાવરૂપે ખીલી ઊઈયા ! વાણ, આત્મબાગ ખીલી ઊઈયો.....અને અનંતગુણોના શાંતરસનો એકીસાથે કોઈ અતીન્દ્રિય નિર્વિકલ્પ અત્યંત મધુર સ્વાદ અનુભૂતિમાં આવ્યો....તેનું નામ સમ્યગ્દર્શન !
- આ રીતે પૂર્ણ સ્વરૂપના લક્ષે સમ્યગ્દર્શન થયું ત્યાં મોક્ષમાર્ગની શરૂઆત થઈ. “પૂર્ણતાને લક્ષે થયેલી શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત છે.” મોક્ષમહેલનું પ્રથમ પગથિયું આ સમ્યગ્દર્શન છે.
- અણા, પરમાત્મપદ સાથે જેની સંધિ છે એવી જ્ઞાનદશા ને એવું સમ્યગ્દર્શન તે પ્રગટ થતાં પહેલાં મુમુક્ષુને આત્મા તરફની અદ્ભુત ધારા ઊપડે છે. અને આત્મા તરફની વિચારધારાના બળે તેની રહેણી-કરણી પણ તેને અનુકૂળ જ હોય છે, -તેની બધી રહેણી-કરણીમાં આત્મધૂનની ધારા સતત વહેતી હોય છે. તે ધારાનો પ્રવાહ આત્મા તરફ ઢણતો હોય છે. પરિસ્થિતિ-અનુસાર શુભ-અશુભ પરિણામો હોય તેની વર્ચ્યે પણ આત્માની ધૂન તૂટતી નથી. તેને આત્માની ખરેખરી જરૂર લાગી છે, એટલે વર્ચ્યે બીજા કોઈ ભાવોનો રસ મુખ્ય થવા દેતો નથી. બીજા બધા રસને ગૌણ કરીને આત્મરસને મુખ્ય કરતો જાય છે.
- અનુભવદશા પહેલાં જીવને ઘણા પ્રકારથી આત્મસ્વરૂપનું જોર અને તેના મહિમા સંબંધી વિચારો આવતા હોય છે. તેમાં વિકલ્પની મુખ્યતા નથી હોતી; વિકલ્પથી તે આધો ખસતો જાય છે ને આત્મામાં ઊડો ઊતરતો જાય છે. જેમ જેમ જ્ઞાન ઊંઠું ઊતરતું જાય છે તેમ તેમ ચૈતન્યભાવનો વધુ ને વધુ મહિમા.

: ૨૬ :

આત્મધર્મ

: ચૈત્ર : ૨૫૦૧

### \* અહો સર્વજ્ઞ મહાવીર ! આપ મોક્ષમાર્ગના નેતા છો....વિશ્વના જ્ઞાતા છો.\*

દેખાતો જાય છે ને તે પ્રકારની શાંતિ વેદાતી જાય છે. શાંતિ દેખાતી હોવાથી  
તેમાં તેને વધુ ને વધુ ગમતું જાય છે ને આ ગમવાની પરાકાણ તે જ  
નિર્વિકલ્પ અનુભૂતિરૂપ પરિણમે છે. તેથી જ્ઞાનીઓ આત્મસ્પર્શી ભાવથી  
કહે છે કે-

## ‘હે જીવ ! તું આત્મામાં ગમાડ ! ’

હું બધાને દેખનારો છતાં બધાથી જુદો, વિકલ્પને જાણનાર છતાં  
પોતે નિર્વિકલ્પ-એવા ભાવ ઘૂંટાય છે.-

**જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણો છે રૂપ,  
અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવસ્વરૂપ.**

આંખવડે વસ્તુ જાણી, પછી આંખ ન હોય-તોપણ તે શાન તો ટકી  
રહે છે, કેમકે જાણનારો આંખથી જુદો છે. વિકલ્પો બાદ કરતાં-કરતાં પણ  
આત્માને બાધા નથી આવતી. વિકલ્પો છૂટી જવા છતાં આત્મા અબાધપણે  
ટકી રહે છે; આ રીતે વિકલ્પથી પાર ચૈતન્યસ્વરૂપ જીવ હું છું-એમ તે  
પોતાના નિજરૂપને લક્ષમાં લ્યે છે.

આ રીતે પોતાનું શુદ્ધસ્વરૂપ જેવું છે તેવું દૃષ્ટિમાં લીધું છે; તે  
પોતાના શુદ્ધસ્વરૂપને જાણતાં પોતામાં જ એકત્વરૂપ પરિણમન  
( અનુભૂતિ ) કરે છે, તેને પર સાથે જરાય સંબંધ નથી; તે પરને જાણતો  
હોવા છતાં તેમાં એકત્વપણે નથી પરિણમતો; પોતાના આત્માને જાણતાં  
તેમાં એકત્વપણે પરિણમે છે. આ રીતે પરથી વિભક્ત અને સ્વમાં એકત્વ  
એવું તેનું ‘જ્ઞાયક-જીવન’ છે.

જ્ઞાની થવા માટે પહેલાં મુમુક્ષુ જીવને આત્માના આદર્શરૂપ  
સિદ્ધભગવાન તથા અરિહંતભગવાન લક્ષમાં આવે છે; તેમના જેવો હું છું  
- એમ તે આત્માનેશુદ્ધપણે ભાવે છે ને તેમના જેવી દશા પ્રાપ્ત કરવાની  
ભાવના તેને આવ્યા કરતી હોય છે. પૂર્ણતાને લક્ષે તે શરૂઆત કરે છે.  
સંપૂર્ણપણે પોતાની શુદ્ધ મોક્ષદશાની ભાવના, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવે સર્વ  
રીતે પોતાને શુદ્ધરૂપ બનવાની ભાવના જ્ઞાની જીવને હોય છે. દ્રવ્ય-ગુણ  
જેવા શુદ્ધ છે તેવી શુદ્ધતાનો અંશ પર્યાયમાં તેણે ચાખ્યો છે, ને તે કયારે  
પૂર્ણ પ્રગટે એવી ભાવના હોય છે. ભલે પર્યાયના ભેદવિકલ્પોને હેય  
કહીએ, પણ પર્યાયમાં શુદ્ધતા થવી, આનંદ થવો તે તો ઉપાદેય

: ચૈત્ર : ૨૫૦૧

આત્મધર્મ

: ૨૭ :

## \* હે પ્રભો ! આપનું અનેકાન્તશાસન સર્વેજીવોને માટે ભદ્રકારી છે.\*

છે. મુમુક્ષુને આત્માની ભાવનામાં, તેના મહિમામાં, તેની શુદ્ધિની ભાવનામાં જ્ઞાન અને રાગની બિજ્ઞતાનો અભ્યાસ થતો જાય છે. ચારે પડખેથી તે જ્ઞાન અને રાગની બિજ્ઞતા દેખતો જાય છે. રાગ અને જ્ઞાનની બિજ્ઞતા તેના વેદનમાં આવતી જાય છે ને અંદર એવી ચોટ તેને લાગી જાય છે કે રાગાદિભાવો જ્ઞાનથી વિરુદ્ધ ભાસે છે, તે રાગાદિમાં ક્યાંય તેને જરાય શાંતિ લાગતી નથી... રાગની અશાંતિમાંથી કોઈપણ પ્રકારે બહાર નીકળવા મથે છે... ને ચૈતન્યની શાંતિને ખૂબ ખૂબ ઝંપે છે. હજુ વિકલ્પ રહેતા હોવા છીતાં, વિકલ્પમાં તે નથી જુલતો, તે તો જ્ઞાનરસના જુલે જુલે છે; ને સ્વવસ્તુને પકડીને, જ્ઞાનને નિર્વિકલ્પ કરી નાંખે છે; ત્યારે આખા જગતનો સંબંધ છૂટીને આત્મા વિશ્વની ઉપર તરે છે. જગતથી જુદ્ધો પોતે પોતામાં રહી જાય છે. -આનું નામ અનુભૂતિ; આનું નામ સમ્યગ્રદ્ધન !

પહેલેથી મુમુક્ષુજીવને વિચારધારામાં પણ રાગથી જુદ્ધા આત્માનો એવો નિર્ણય હોય છે કે પરના લક્ષે થતા રાગાદિભાવો તે મારું સ્વરૂપ નથી; તેનાથી જુદ્ધી જાતનો જ્ઞાનસ્વભાવી હું છું.

જ્ઞાની જ્ઞાનભાવમાં રાગને વેદતા જ નથી, રાગથી જુદ્ધા જ્ઞાનભાવને જ વેદે છે. રાગ પોતે દુઃખ છે, તેમાંથી સુખ ક્યાંથી મળે? ને તેમાં એકત્વબુદ્ધિ જ્ઞાનીને કેમ હોય? જ્ઞાનીની રાગથી બિજ્ઞતા વેદતા હોવાથી જ્ઞાની રાગને કરતા નથી. -જ્ઞાનીની આવી ઓળખાણ દ્વારા જિજ્ઞાસુ પોતે પોતાના ભાવોમાં પણ જ્ઞાન અને રાગને જુદ્ધા પાડીને બેદજ્ઞાન કરતો જાય છે, અને તેને આત્માનું સ્વરૂપ કેવળ (એકલું) જ્ઞાન અને આનંદમય જ ભાસે છે. ચૈતન્યવસ્તુના વેદનમાં રાગ ક્યાંથી હોય? આવો વાસ્તવિક નિર્ણય કર્યો ત્યાં હવે રાગ અને જ્ઞાનને બિજ્ઞ થતાં વાર કેટલી? અંદરમાં નિર્વિકલ્પ થઈને ચૈતન્યવસ્તુમાં ઉપયોગ જોડતાં, રાગ વગરનું અતીન્દ્રિય આનંદમય પરિણમન થઈ જાય છે... અહા ! આત્મા અપૂર્વભાવરૂપ થઈ જાય છે.

ચૈતન્યભાવ સાથે અનંતશક્તિના મંથનદ્વારા અગાધતામાં ઉડે ઉત્તરીને મુમુક્ષુ ચૈતન્યતત્ત્વને પકડી લ્યે છે, ને પરભાવોથી છૂટો પડી જાય છે. જ્ઞાન-દર્શન-આનંદ-પ્રભુતા વગેરે અનંત શક્તિના પિંડરૂપ મારું શુદ્ધતત્ત્વ છે. મારા જ્ઞાન-દર્શન

## \* ઉપયોગ-લક્ષણ જીવ છે ને એ જ સાચું જીવન છે. \*

- આદિ કોઈપણ ગુણમાં રાગ સાથે તન્મયતા નથી. એવી અનંતી શક્તિના અભેદ એક પિંડરૂપ ચૈતન્યમાત્ર સ્વતત્ત્વ હું છું-એમ ધર્મી શ્રદ્ધામાં લઈને અનુભૂતિ કરે છે.
- અરે, શાન ને આત્મા એવા ગુણ-ગુણી બેદનું દેત પણ જે અનુભૂતિમાં નથી રહેતું, તે નિર્વિકલ્પ-અનુભૂતિની શાંતિની શી વાત ! અનંતગુણની નિર્મળતા સહિત એકરૂપ વસ્તુ અનુભૂતિમાં પ્રકાશે છે.
- આમ સર્વ પ્રકારે પોતાના સ્વરૂપની સન્મુખતાના પરિણામો મુમુક્ષુને હોય છે; અગાધ મહિમાથી ભરેલા આત્મસ્વરૂપની સન્મુખતા તરફના જુકાવ સિવાય, બાહીરૂખ બીજો કોઈ ઉપાય સમ્યગ્દર્શન માટે નથી -નથી-નથી.
- જ્ઞાની થતા પહેલાં અભ્યાસની શરૂઆતમાં જિજ્ઞાસુ જીવને એમ લાગે છે કે અરે, આવા વિકલ્પો શા માટે ! પણ પછી વિચારને અંદર લંબાવીને શોધતાં તેને ખ્યાલ આવે છે કે અહીં, આ વિકલ્પ વખતે પણ વિકલ્પને જાણનારું મારું ‘જ્ઞાન’ વિકલ્પથી જુદું કામ કરી જ રહ્યું છે; તે જ્ઞાન, ‘વિકલ્પ હું નથી, જ્ઞાન હું છું’ એમ વહેંચણી કરે છે. એટલે તેને વિકલ્પો પણ જ્ઞાનસ્વભાવના રસના જોરે ધીમે ધીમે ઘસાતા જાય છે, અને છેવટે જ્ઞાનનો ઝણઝણાટ કરતી એવી ઘડી આવી જાય છે કે ( સમય માત્રમાં ) એક જ ધડકે વિકલ્પને ઓળંગી જઈને ઉપયોગનારું પોતાના શુદ્ધસ્વરૂપમાં મિલન થઈ જાય છે. બસ ! આ છે અનુભવ-દર્શન ! આ છે સમ્યક્ત્વની અપૂર્વ ઘડી ! આ છે મોક્ષસુખનો પ્રારંભ !
- આવો અનુભવ કોણા કરે ?
- આત્મા પોતે જ કર્તાપણે પોતાની સમ્યક્ત્વાદિ પર્યાયને કરે છે, એવો તેનો કર્તાસ્વભાવ છે. અનુભવમાં વિકલ્પ વગરની નિર્મળ પર્યાય પણ સફળપણે પ્રગટી જાય છે-તેવો આત્માનો પર્યાયસ્વભાવ છે, એટલે તેનો કર્તા તો આત્મા પોતે જ છે. -હા, અનુભૂતિ કરવા ટાણો જીવને “હું નિર્મળ પર્યાય કરું ને નિર્મળપર્યાય મારું કાર્ય ” -એવો કર્તા-કર્મભેદનો કોઈ વિકલ્પ કે વિચાર હોતો નથી; ત્યારે તો કર્તા-કર્મ-કિયાના ભેદ છૂટીને આત્મા પોતાના એકત્વમાં જ જૂમે છે...સત્તમાત્ર અનુભૂતિ હોવા છતાં તેમાં અનંતગુણની ગંભીરતા ભરી છે; અનંતગુણનો સ્વાદ એકી સાથે તેમાં વેદાય છે. આહા ! કેવો કલ્પનાતીત સ્વાદ હશે તે !! વાહ ! એ

: ચૈત્ર : ૨૫૦૧

આત્મધર્મ

: ૨૬ :

## \* એ જીવજો, જીવડાવજો પ્રભુ વીરનો ઉપદેશ છે \*

તો સ્વાનુભવી સંતો જ જાણો છે, -વાણીમાં આવી શકતો નથી. વેદનમાં સ્પષ્ટ આવે છે, પણ વાણીગમ્ય થતો નથી.-

“જે સ્વરૂપ સર્વજો દીહું જ્ઞાનમાં,  
કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન જો;  
તેણું સ્વરૂપને અન્ય વાણી તો શું કહે ?  
અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો...”

આવું આત્મસ્વરૂપ ધર્મજીવને ચોથા ગુણસ્થાને જ્ઞાનમાં અનુભવગોચર ( સ્વસંવેદન-પ્રત્યક્ષ ) થઈ ગયું છે; વાણીમાં જે ન આવી શક્યું તે તેના વેદનમાં આવી ગયું છે. વાણ રે વાણ ! ધન્ય એ દશા ! ધન્ય એ જીવ !!! ચૈતન્યના અગાધ ચમત્કારનો તેણે સાક્ષાત્કાર કરી લીધો છે..... એણે પોતાના અંતરમાં પરમાત્માનું દર્શન કરી લીધું છે.

“આત્મા કેવો હશે !-કે આવો હશે ! ” તેમ નહીં, પરંતુ “હું આવો જ છું” એમ પ્રત્યક્ષ અનુભૂતિપૂર્વક તેનું જ્ઞાન નિઃશંક થઈ જાય છે. તેનું સ્વાનુભવપ્રમાણ એવું બળવાન છે કે બીજા કોઈ પ્રમાણને શોધવા જવું પડતું નથી. સાધારણ જીવો જગતના કોઈ દેખે કે ન દેખે,-પોતે તો પોતાની અનુભૂતિને સાક્ષાત્ જાણો છે; માટે-

**સભ્યકૃત્વવંત જીવો નિઃશંકિત, તેથી છે નિર્ભય અહો !**

જેણે અનુભવજ્ઞાનવડે પોતાના શુદ્ધસ્વરૂપનો અપરંપાર મહિમા જાણ્યો તેનું ચિત્ત ફરે જગતના કોઈ પદાર્થ પ્રત્યે લલચાતું નથી, અરે, આરાધકભાવમાં વચ્ચે કદાચિત્ સર્વોત્કૃષ્ટ પુણ્યના સંયોગો આવે તોપણ તેમાં તેને કાંઈ સુંદરતા લાગતી નથી કે તેને લીધે આત્માની ડિંચિત્ મહત્ત્તા લાગતી નથી. તેને પોતાના સ્વતત્ત્વનું જોર જ એવા પ્રકારનું હોય છે કે બીજે બધેથી તેને નિરંતર ઉદાસીનતા જ વર્તે છે. અણા, ચૈતન્યસ્વરૂપને ચેતનારી મારી જ્ઞાનચેતના રાગને કરવા કેમ જાય ! અને જુદી પરવસ્તુને કરવાની તો વાત જ શી ? પર પદાર્થ મારી નજીક હો યા દૂર હો, પણ મારું આ સ્વતત્ત્વ તો તેનાથી હંમેશા નિરાળું જ છે; તે પોતે

## \* ચેતનભાવ જ સાચું જીવન છે...દેહનો સંયોગ એ જીવન નથી. \*

- પોતાથી જ શોભી રહ્યું છે. મારા સ્વતત્ત્વની અદ્ભુત સુંદરતા અન્ય કોઈ પદાર્થની અપેક્ષા નથી રાખતી. -આમ સ્વતત્ત્વની સુંદરતાને દેખતો સમ્યજદિષ્ટ પોતે પોતામાં તૃપ્ત વર્તે છે.
- \* કોઈ અજ્ઞાની જીવને જરૂર પ્રશ્ન ઊઠશે કે, -તો શું તે જ્ઞાની જીવો રાજકારભાર નથી ચલાવતા? ગૃહસંસાર કે વેપાર-ધંધામાં નથી જોડાતા? શું ભરતચક્વર્તી વગેરે તે બધું નહોતા કરતા?
- \* અરેરે, બાપુ! 'જ્ઞાનીની જ્ઞાનદશાને' તેં ન ઓળખી, તને જે કાર્યો દેખાયા તે બધા રાગપરિણાતિનાં કાર્યો છે, જ્ઞાનપરિણાતિનાં નહીં. જ્ઞાનપરિણાતિ અને રાગપરિણાતિ-બંનેનાં કામ સાવ નોખાં છે, જ્ઞાનપરિણાતિમાં તન્મય જ્ઞાની સ્વદ્રવ્યની ચેતના સિવાય બીજા શેમાંય તન્મયપણે વર્તતા નથી તેથી તેના તે અકર્તા જ છે. બાકી અસ્થિરતા અપેક્ષાએ તેનેય જે રાગ-દેખના પરિણામો છે તેટલો દોષ છે; -પણ જ્ઞાનચેતના તેનાથી જુદી છે, -એ ચેતનાને તું ઓળખ તો જ તને જ્ઞાનીની અંતરંગદશા ઓળખાય, ને તારામાંય એવી દશા પ્રગટે.
- એ જ રીતે, જ્ઞાની મંદિરમાં હોય, જિનદેવની પૂજા કરે, તે વખતેય જ્ઞાનચેતના તે શુભરાગથી જુદું જ વીતરાગી કામ કરતી થકી મોક્ષને સાધી રહી છે, એટલે રાગ વખતેય તેને મોક્ષમાર્ગ ચાલુ છે; રાગ પોતે ભલે મોક્ષમાર્ગ નથી, પણ તે વખતની જ્ઞાનચેતના અને સમ્યકૃત્વાદિ ભાવો જીવંત છે-તે મોક્ષમાર્ગ છે.-વાણ, ધન્ય મોક્ષનો પથિક! ધન્ય તેના અતીન્દ્રિયભાવો!
- અહો, જ્ઞાનીની આવી દશાનો વિચાર કરતાં મુમુક્ષુની વિચારધારા રાગથી જુદી પડીને ચૈતન્ય તરફ જૂકવા માંડે છે...પછી શું થાય છે? કે તેનેય રાગ અને જ્ઞાનની લિઙ્ગતાનું વેદન થઈને, જ્ઞાનની અનુભૂતિ થાય છે; ને પછી તે જ અનુભૂતિ કરતાં કરતાં સંસારથી છૂટીને તે મુક્ત થાય છે. તત્પત્ત શ્રીમદ્ રાજચંદ્રજી આ વાતની સાક્ષી આપે છે કે-
- જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન;  
તે જ્ઞાને કય મોહ થઈ, પામે પદ નિર્વાણ.



**\* સમ્યકૃત્વાદિ ભાવવડે ચૈતન્યજીવન જીવવાનો ભગવાનનો ઉપદેશ છે. \***

**\* અધ્યાત્મરસ ઘોલન. \***

[ પાહુડ દોષ ] પાનું રત થી ચાલુ

૧૩૨. હે જીવ ! ભુવનતળમાં તું એવા યોગીને તારા મિત્ર કર, -કે જેનું ચિત્ત રાગના કલકલાટથી, છ રસથી ને પાંચ રૂપથી રંજિત ન હોય.
૧૩૩. સધણા વિકલ્પોને તોડીને મનને આત્મામાં સ્થિર કર; ત્યાં તને નિરંતર સુખ મળશે, અને તું સંસારને શીધ્ર તરી જઈશ.
૧૩૪. અરે જીવ ! જિનવરને તારા મનમાં સ્થાપ, વિષય-કષાયને છોડ; સિદ્ધિમણ્ણપુરીમાં પ્રવેશ કર, અને દુઃખોને પાણીમાં દુબાડીને તિલાંજલિ દે.
૧૩૫. મુંડ મુંડાવવાવાળાઓમાં હે શ્રેષ્ઠ મુંડક ! તેં શિર તો મૂંડયું, પણ ચિત્તને ન મૂંડયું. જેણે ચિત્તનું મુંડન કર્યું તેણે સંસારનું ખંડન કર્યું.
૧૩૬. સર્વાગમાં જે સુસ્થિત છે તે ધર્માત્માને પાપ શું કરશે ? તેમજ જે પરમાર્થના ઇચ્છુક છે તે સજ્જનને પુણ્યનું પણ શું કામ છે ?
૧૩૭. જેઓ ગમનાગમનથી રહિત છે ને ત્રણલોકમાં પ્રધાન છે તે દેવની ગરવી ગંગા સૂક્ષ્મ પુરુષોને સમ્યજ્ઞાન પ્રગટ કરનારી છે.
૧૩૮. પુણ્યથી વિભવ મળે છે, વિભવથી મદ મળે છે, મદથી મતિમોહથાય છે, અને મતિમોહથી નરક થાય છે. -એવા પુણ્ય અમને ન હો ( અહીં અજ્ઞાનીના પુણ્યની વાત છે. )
૧૩૯. હું જ્યાં-જ્યાં જોઉં ત્યાં સર્વત્ર આત્મા જ દેખાય છે, -તો પછી હું કોણી સમાધિ કરું ને કોણે પૂજું ? ધૂત-અધૂત કહીને કોણે તરછોડું ? હરખ કે કલેશ કોણી સાથે કરું ? ને સન્માન કોનું કરું ?
૧૪૦. જો કોધાર્જિ વડે મન કલુષિત થઈ જાય તો, નિરંજન તત્ત્વની આવી ભાવનારૂપ નિર્મળ જળ વડે આત્માનો અભિષેક કરવો; -કે જ્યાં જ્યાં જોઉં ત્યાં કંઈ પણ મારું નથી; હું કોઈનો નથી, ને કોઈ મારું નથી. ( આવી તત્ત્વભાવના વડે કોધ શાંત થઈ જાય છે. )

: તૃતીય :

આત્મધર્મ

: ચૈત્ર : ૨૫૦૧

### \* અમે પણ આનંદપૂર્વક આપના જ માર્ગ શીવપુરીમાં આવી રહ્યા છીએ. \*

૧૪૧. હે જિનવર ! જ્યાં સુધી દેહમાં રહેલા જિનને ન જાણ્યા ત્યાં સુધી તને નમસ્કાર કર્યા; પણ જો દેહમાં જ રહેલા જિનને જાણી લીધા તો પછી કોણ કોને નમે ?
૧૪૨. શુભાશુભજનક કર્મનો અકર્તા થઈને જીવના અંતરમાં આત્મસ્વરૂપની સિદ્ધિ જ્યાંસુધી પ્રગટતી નથી ત્યાંસુધી તેને સંકલ્પ -વિકલ્પ રહે છે.
- ૧૪૩ ( ૧ ) હે જીવ ! લોકો તને હૃદીલો-હૃદીલો કહે છે તો ભલે કહો, પણ હે હૃદી ! તું ક્ષોભ કરીશ મા. ( અર્થાત् લોકો હૃદીલો કહે તેથી તું તારા માર્ગને છોડીશ મા. ) તું મોહને ઉખેડીને સિદ્ધિ-મહાપુરીમાં ચાલ્યો જાજે.  
 ( ૨ ) ઘેલા લોકો તને ઘેલો-ગાંડો કહે તો તેથી તું ક્ષુબ્ધ થઈશ મા. લોકો ગમે તેમ બોલે, તું તો મોહને ઉખેડીને મહાન સિદ્ધિનગરીમાં પ્રવેશ કરજે.
૧૪૪. જીવોની અહિંસા કરો અને અન્યને જરા પણ અન્યાય ન કરો, -આટલું ચિત્તમાં લખી લ્યો ને મનમાં ધારણ કરી લ્યો-બસ, પછી તમે નિશ્ચિંતપણે પગ લંબાવીને સૂઈ જાઓ.
૧૪૫. આડા-અવળા બહુ બડબડાટનું શું કામ છે ? -દેહ તે આત્મા નથી; દેહથી બિજી જ્ઞાનમય તે જ તું આત્મા છો; તેને હે જીવ ! તું દેખ !
૧૪૬. ભલે શાસ્ત્રના પોથા પઢે, પણ મન જ જેનું અશુદ્ધ છે તેને મોક્ષ કેવો ? -એમ તો ફરણનો શિકાર કરનારો પારધી પણ ફરણની સામે નમે છે. ( જેમ ભાવશુદ્ધ વગરનું તે નમન, સાચું નમન નથી, તેમ ભાવશુદ્ધ વગરનું શાસ્ત્રભણીતર મોક્ષનું કારણ થતું નથી. માટે હે જીવ ! તું ભાવશુદ્ધ કર. )
૧૪૭. જેમ ધાણું પાણી વલોવવાથી કાંઈ હાથ ચીકણા થતા નથી, તેમ દયા ( વીતરાગભાવ ) વગરનો ધર્મ જ્ઞાનીઓએ ક્યાંય દેખ્યો નથી.
૧૪૮. જેમ લોદાનો સંગ કરવાથી અજીનિ પણ મોટામોટા ઘણ વડે પિટાય છે, તેમ દુષ્ટ જનોના સંગથી ભલાપુરુષોનાં ગુણો પણ નાણ થઈ જાય છે.
૧૪૯. અજીનિ પણ શંખના ધવલતવને નાણ કરી શકતો નથી; પણ જો તે પોતે ધારી કે લીલકૂગ સાથે મળી જાય તો તેનું ધવલપણું મટી જાય છે, એમાં સંદેહ ન કરો. ( માટે કુસંગતિ ન કરવી. )

૧૫૦. શંખના પેટમાં રહેલા મુક્તાફળ-મોતીના કારણે તેની એવી હાલત થાય છે કે માધીમાર ધીવર તેનું ગળું ફાડીને તે મોતી બહાર કાઢે છે. ( પરીગ્રહથી જીવ દુઃખી થાય છે. )
૧૫૧. ગુણરત્નનિધિ ( અર્થાત् સમુદ્ર ) નો સંગ છોડવાથી શંખના કેવા હાલ થાય છે? -તે બજારમાં વેચાય છે ને પછી કોઈના મોટેથી કુંશાય છે; તેમાં સંદેહ નથી. ( ગુણીજનનો સંગ છોડવાથી આવા બેહાલ થાય છે. )
૧૫૨. હે હતાશ મધુકર! તેં કલ્પવૃક્ષની મંજરીનો સુગંધી રસ ચાખ્યો, ને હવે ગંધ વગરના ઘાસ પલાશ ઉપર તું ભમતો ફરે છે! -અરે, આમ કરતાં તારું હૈયું ફાઠી કેમ ન ગયું? ને તું મરી કેમ ન ગયો? ( અયંતે મધુર ચૈતન્યરસ ચાખ્યા પછી, બીજા નીરસ વિષયોમાં ઉપયોગ ભમે તેમાં જ્ઞાનીને મરણ જેવું દુઃખ લાગે છે. )
- ૧૫૩-૧૫૪. મૂડ મુંડાવી, ઉપદેશ લીધો, ધર્મની આશા વધી, તેમજ કુટુંબ છોડયું ને પરની આશા પણ છોડી, -આટલું કરવા છતાં જે નજનત્વથી ગર્વિત છે અને ત્રિગુપ્તિને ગણકારતો નથી ( -અથવા વસ્ત્રધારક ધર્મત્ત્વાઓનો તિરસ્કાર કરે છે ), તેણે તો બહારનો કે અંતરનો એક્કેય ગ્રંથ-પરિગ્રહ છોડ્યો નથી.
૧૫૫. અરે, આ મનરૂપી હાથીને વિંધ્ય તરફ જતાં રોકો, નહિતર તે શીલવનને તોડી નાંખશે ને જીવને સંસારમાં પાડશે.
૧૫૬. જે ભણેલા છે, જે પંડિત છે અને જે માનમર્યાદાવાળા છે તે પણ મહિલાઓના પગે પડીને ઘંટીના પડની જેમ ભમે છે.
૧૫૭. રે વિષયાંધ! ત્યાંસુધી જ તું વિષયોને મુશ્કીથી સ્પર્શી લે ( બાચકા ભરી લે ) કે જ્યાંસુધી જીવાલોલુપી શંખની જેમ તારું શરીર સડી ન જાય! ( હે મૂર્ખ! ક્ષણબંગુર વિષયોમાં કાં રાચ? -એ તો ક્ષણમાં સડી જશે. )
૧૫૮. વનમાં ઊંટના પ્રવેશની જેમ તું તડાતડ પાંડા તોડે છે, પણ મોહિત થયેલો તું એ નથી જાણતો કે કોણ તોડે છે, ને કોણ તૂટે છે? ( વનસ્પતિમાં પણ તારા જેવો જીવ છે-એમ તું જાણ ને તેની હિંસા ન કર. )
૧૫૯. પાંદહું પાણી, દર્ભ અને તલ એ બધાને તું સવર્ણ ( વર્ણસહિત - અચેતન ) જાણ; અને જો મોક્ષમાં જવું હોય તો તેનું કારણ કંઈક બીજું જ છે,-તેને જાણ. ( પાંદાં વગેરે વડે દેવને પૂજવાથી મુક્તિ નથી મળતી, મુક્તિનું કારણ બીજું જ છે. )

# સિદ્ધત્વના હેતુભૂત ભાવના

ભગવાનશ્રી યત્તિવૃષભ આચાર્યરચિત 'ત્રિલોકપ્રજાપ્તિ' નામના પ્રાચીન મહાન ગ્રંથમાં 'સિદ્ધલોકપ્રજાપ્તિ' નામના અધિકારમાં 'સિદ્ધત્વના હેતુભૂત ભાવના' નું આનંદકારી વર્ણન ગાથા ૧૮ થી હ્યુ સુંધી ૪૮ ગાથા દ્વારા કર્યું છે. સિદ્ધત્વના હેતુભૂત આ ઉત્તમ ભાવના વાંચીને ગુરુદેવને ઘણો પ્રમોદ થયો હતો, ને પ્રવચનમાં શ્રોતાજનો સમક્ષ પણ તેનું વર્ણન કર્યું હતું, -જે સાંભળીને સૌને ફર્ખોલ્લાસ થયો હતો. અહા,-સિદ્ધત્વના હેતુભૂત ભાવનાથી કોને આનંદ ન થાય!-તેથી તે આનંદકારી ભાવના અહીં આપીએ છીએ.

આ શાસ્ત્રકર્તા શ્રી યત્તિવૃષભ આચાર્ય ધવલા-જ્યધવલાના ટીકાકારથી પર પ્રાચીન છે, અને ભાવના-અધિકારમાં આવેલી ઘણી ખરી ગાથાઓ ભગવાનશ્રી કુંદંકુંદાચાર્યદિવના સમયસાર-પ્રવચનસાર વગેરે શાસ્ત્રોની ગાથાઓને લગભગ મળતી આવે છે,-જીણો કે તેમના શાસ્ત્રોનું દોહન કરીને જ આ ભાવના-અધિકાર રચાયો હોય! એવું જ લાગે છે. સ્વ. પ્રો. હીરાલાલજી જૈન આ સંબંધમાં લખે છે કે-'આ અંતિમ અધિકારમાં વર્ણવેલ સિદ્ધોનું વર્ણન અને આત્મચિન્તનનો ઉપાય (-શુદ્ધાત્મભાવના) તે જૈનવિચારધારાની પ્રાચીન સંપત્તિ છે.' ચાલો, આપણે પણ આપણા આત્માને સિદ્ધત્વના હેતુભૂત આ ભાવનામાં જોડીએ:-

- ✿ જેમ ચિરસંચિત ઇંધનને પવનથી પ્રજવલિત અજ્ઞિ શીંગ જ જલાવી દે છે, તેમ ઘણા કર્મરૂપી ઇંધનને શુદ્ધાત્માના ધ્યાનરૂપી અજ્ઞિ ક્ષણમાત્રમાં જલાવી દે છે.
- ✿ જે જીવ દર્શનમોહ અને ચારિત્રમોહને નાણ કરીને, વિષયોથી વિરક્ત થયો થકો, મનને રોકીને આત્મસ્વભાવમાં સ્થિર થાય છે તે મોક્ષસુખને પ્રાપ્ત કરે છે.
- ✿ જેને રાગ-દ્રોષ-મોહ તથા યોગપરિકર્મ નથી તેને શુભાશુભને ભર્સમ કરુનાર ધ્યાનમય અજ્ઞિ ઉત્પન્ન થાય છે.

: ચૈત્ર : ૨૫૦૧

આત્મધર્મ

: ૩૫ :

- ૩ શુદ્ધસ્વભાવથી સહિત સાધુને દર્શન-જ્ઞાનથી પરિપૂર્ણ ધ્યાન છે તે નિર્જરાનું કારણ થાય છે; અન્ય દ્રવ્યોથી સંસક્ત ધ્યાન નિર્જરાનું કારણ થતું નથી.
- ૪ અંતરંગ અને બહિરંગ સર્વસંગથી રહિત, તથા અનન્યમન ( અર્થાત् - એકાગ્રચિત ) થઈને જે પોતાના ચૈતન્યસ્વભાવથી આત્માને જાણે-દેખે છે તે જીવ આત્મિકચારિત્રનું આચરણ કરનાર છે.
- ૫ જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં ભાવના કરવી જોઈએ; અને તે ( જ્ઞાન-દર્શન -ચારિત્ર ) ત્રણે આત્મસ્વરૂપ છે, તેથી હે ભવ્ય ! તું આત્મામાં ભાવના કર.
- ૬ હું નિશ્ચયથી સદા એક, શુદ્ધ, દર્શન-જ્ઞાનાત્મક અને અરૂપી છું; અન્ય કંઈ પરમાણુ માત્ર પણ મારું નથી.
- ૭ મોહ મારો જરા પણ નથી; હું એક જ્ઞાનદર્શન-ઉપયોગરૂપ જ છું-એમ જાણું છું; -આવી ભાવનાથી યુક્ત જીવ અસ્થુષ્ટ કર્માને નાચ કરે છે.
- ૮ હું પરપદાર્થોનો નથી અને પરપદાર્થો મારાં નથી, હું તો એકલો જ્ઞાનસ્વરૂપ જ છું; -આ પ્રમાણે જે ધ્યાનમાં ચિન્તાવે છે તે આઠકર્માથી મુક્ત થાય છે.
- ૯ ચિત્ત શાંત થતાં ઇન્દ્રિયો શાંત થાય છે, અને ઇન્દ્રિયો શાંત થતાં આત્મસ્વભાવમાં રતિ થાય છે; અને તેથી તે જીવ સ્પષ્ટપણે-ચોક્કસપણે નિર્વાણને પામે છે.
- ૧૦ હું દેહ નથી, મન નથી, વાણી નથી, અને તેમનું કારણ પણ હું નથી, -આ પ્રકારનો જે ભાવ છે તે શાશ્વતસ્થાનને પ્રાપ્ત કરે છે ( અર્થાત् આવી ભાવના જે ભાવે છે તે મોક્ષને પામે છે ).
- ૧૧ દેહની જેમ મન અને વાણી પુદ્ગલદ્રવ્યાત્મક પરવસ્તુ છે, એમ ઉપદેશવામાં આવ્યું છે; અને પુદ્ગલદ્રવ્ય તે પણ પરમાણુદ્રવ્યોનો પિંડ છે.
- ૧૨ હું, નથી પુદ્ગલમય કે નથી મેં તે પુદ્ગલોને પિંડરૂપ કર્યા; તેથી હું દેહ નથી, કે તે દેહનો કર્તા નથી.
- ૧૩ આ પ્રમાણે જ્ઞાનાત્મક, દર્શનભૂત, અતીન્દ્રિય, મહાઅર્થ, નિત્ય, નિર્મળ અને નીરાલંબ શુદ્ધઆત્માનું ચિંતન કરવું જોઈએ.
- ૧૪ હું પરપદાર્થોનો નથી અને પરપદાર્થો મારાં નથી; હું તો જ્ઞાનમય એકલો છું; -આ પ્રમાણે જે ધ્યાનમાં ધ્યાવે છે તે જીવ આત્માનો ધ્યાતા છે.

**[ જુઓ, આ સિદ્ધપદના હેતુભૂત ભાવના ચાલે છે:**

**આ ભાવનાથી મોક્ષસુખ પમાય છે.]**

- ૱ આ પ્રમાણે જાળીને જે વિશુદ્ધઆત્મા ઉત્કૃષ્ટ આત્માને ધ્યાવે છે તે અનુપમ અપાર અતીન્દ્રિય ( અનંત ચતુષ્યાત્મક ) સુખને પામે છે.
- ૱ હું પરપદાર્થોનો નથી અને પરપદાર્થો મારાં નથી, આ જગતમાં મારું કોઈ પણ નથી, -આ પ્રમાણે જે ભાવના ભાવે છે તે સંપૂર્ણ કલ્યાણને પામે છે.
- ૱ આ ઊર્ધ્વ-અધો કે મધ્ય ત્રણલોકમાં કોઈપણ પરપદાર્થ મારો નથી, આ જગતમાં કંઈપણ મારું નથી-આવી ભાવનાથી યુક્ત જીવ અક્ષય સુખને પામે છે.
- ૱ જે જીવ મદ-માન-માયાથી રહિત તેમ જ લોભથી રહિત, અને નિર્મળ-સ્વભાવથી યુક્ત થાય છે તે અક્ષયસ્થાનને પામે છે.
- ૱ દેહાદિકમાં જેને પરમાણુમાત્ર પણ મૂર્ખ છે તે જીવ, ભલે સર્વઆગમનો ધારી હોય તોપણ સ્વકીય-સમયને તે જાણતો નથી.
- ૱ માટે મોક્ષના અભિલાષી જીવોએ દેહમાં જરાપણ રાગ ન કરવો; દેહથી ભિજ્ઞ ઇન્દ્રિયાતીત આત્માનું ધ્યાન કરવું.
- ૱ દેહમાં સ્થિત, દેહથી જરાક ન્યૂન, દેહથી રહિત, શુદ્ધ, દેહકાર અને ઇન્દ્રિયાતીત આત્મા ધ્યાતવ્ય છે.
- ૱ જેના ધ્યાનમાં શાનવડે નિજાત્મા જો નથી ભાસતો તો તેને ધ્યાન નથી, પરંતુ પ્રમાદ અથવા મોહમૂર્ખ જ છે-એમ જાણવું.
- ૱ મીણથી રહિત બીબાના અંદરના આકાશ જેવા આકારવાળા, રત્નત્રયાદિ ગુણોથી યુક્ત, અવિનશ્શાર અને જીવઘનદેશરૂપ એવા નિજાત્માનું ધ્યાન કરવું જોઈએ.
- ૱ જે સાધુ નિત્ય ઉધોગશીલ ( ઉપયુક્ત ) થઈને આ આત્મભાવનાનું આચરણ કરે છે તે અલ્પકાળમાં જ સર્વ દુઃખથી મુક્ત થાય છે.
- ૱ કર્મ-નોકર્મમાં ‘આ હું છું, અને હું-આત્મા કર્મ-નોકર્મરૂપ છું’ -આ પ્રકારની બુદ્ધિવડે પ્રાણી ઘોર સંસારમાં ઘૂમે છે.
- ૱ જે મોહકર્મનો ક્ષય કરીને, તથા વિષયોથી વિરક્ત થઈને અને મનને રોકીને સ્વભાવમાં સમવસ્થિત થાય છે તે જીવ કર્મબંધનરૂપ સાંકળથી છૂટી જાય છે.

- ૩ જે પ્રકૃતિ-સ્થિતિ-અનુભાગ અને પ્રદેશબંધથી રહિત આત્મા છે તે જ હું છું-એમ ચિન્તન કરવું જોઈએ તથા તેમાં જ સ્થિરભાવ કરવો જોઈએ.
- ૪ જે કેવળજ્ઞાનસ્વભાવી છે, કેવળદર્શનસ્વભાવી છે, સુખમય છે અને કેવળવીર્ય-સ્વભાવી છે-તે હું છું-એમ જ્ઞાની ચિન્તાવે છે.
- ૫ જે જીવ સર્વસંગથી રહિત થઈને પોતાના આત્માને આત્માદ્વારા ધ્યાવે છે તે અલ્પકાળમાં સર્વદૃષ્ટિ છૂટકારો પામે છે.
- ૬ જે ભયાનક સંસારરૂપી મહાસમુદ્રમાંથી નીકળવા હચે છે તે આ પ્રમાણે જાણીને શુદ્ધઆત્માનું ધ્યાન કરે છે.
- ૭ પ્રતિકમણ, પ્રતિસરણ, પ્રતિહરણ, ધારણા, નિવૃત્તિ, નિનંન ગર્હણ અને શુદ્ધ-એ બધાયની પ્રાપ્તિ નિજાત્મભાવના વડે થાય છે.
- ૮ દર્શનમોહંગંથિને નાટ કરીને જે શ્રમણ રાગ-દ્રેષ્ણનો ક્ષય કરતો થકો સુખ-દૃષ્ટિ સમભાવી થાય છે તે અક્ષય સુખને પ્રાપ્ત કરે છે.
- ૯ દેહ અને ધનમાં આ ‘હું’ અને ‘આ મારું’ એવા મમત્વને જે છોડતો નથી તે મૂર્ખ-અજ્ઞાની જીવ દુષ્ટ-અષ્ટકર્મોથી બંધાય છે.
- ૧૦ પુષ્યથી વિભવ, વિભવથી મદ, મદથી મતિમોહ અને મતિમોહથી પાપ થાય છે, માટે પુષ્યને પણ છોડવા જોઈએ.
- ૧૧ જે પરમાર્થથી બાધ છે તે જીવ સંસારગમનના અને મોક્ષના હેતુને નહિ જાણતો થકો અજ્ઞાનથી પુષ્યની હચ્છા કરે છે.
- ૧૨ પુષ્ય અને પાપમાં કોઈ ભેદ નથી-આમ જે નથી માનતો તે મોહથી યુક્ત થયો થકો ધોર અને અપાર સંસારમાં ભાગે છે.
- ૧૩ મિથ્યાત્વ, અજ્ઞાન, પાપ અને પુષ્ય-તેમનો ત્રણે પ્રકારે ત્યાગ કરીને યોગીઓએ નિશ્ચયથી શુદ્ધઆત્માનું ધ્યાન કરવું જોઈએ.
- ૧૪ જીવ પરિણામસ્વભાવરૂપ છે, તે જ્યારે શુભ અથવા અશુભ પરિણામરૂપે પરિણામે છે ત્યારે શુભ અથવા અશુભ થાય છે, અને જ્યારે શુદ્ધપરિણામરૂપે પરિણામે છે. ત્યારે શુદ્ધ થાય છે.
- ૧૫ ધર્મરૂપે પરિણામેલો આત્મા જો શુદ્ધઉપયોગયુક્ત હોય તો નિર્વાણસુખને પામે છે, અને જો શુભોપયોગથી યુક્ત હોય તો સ્વર્ગસુખને પામે છે.

: ૩૮ :

આત્મધર્મ

: ચૈત્ર : ૨૫૦૧

- ૱ અશુભોદ્યથી આત્મા કુમનુષ્ય, તિર્યંચ અથવા નારકી થઈને સદા હજારો દુઃખોથી પીડિત થયો થકો સંસારમાં અત્યંત ભમે છે.
- ૱ શુદ્ધોપયોગથી પ્રસિદ્ધ એવા અરિહંતો તથા સિદ્ધોને અતિશય, આત્માથી જ સમુત્પન્ન, વિષયાતીત, અનુપમ, અનંત અને વિચ્છેદ રહિત સુખ હોય છે.
- ૱ રાગાદિ સંગથી મુક્ત એવા મુનિ, અનેક ભવોમાં સંચિત કરેલા કર્મરૂપી દંધન સમૂહને શુકલધ્યાન નામના ધ્યાન વડે શીત્ર ભસ્મ કરે છે.
- ૱ હૃદયમાં જ્યાં સુધી આત્મસ્વભાવલબ્ધિ પ્રકાશમાન નથી થતી ત્યાં સુધી જ જીવ શુભ-અશુભજનક એવા સંકલ્પ-વિકલ્પરૂપ કર્મને કરે છે.
- ૱ બંધોના સ્વભાવને તેમ જ આત્માના સ્વભાવને જાણીને, જે બંધોમાં અનુરક્ત નથી થતો તે જીવ કર્મોથી ધૂટકારો કરે છે.
- ૱ જ્યાં સુધી આત્મા અને આસ્રવ એ બંનેના વિશેષ-અંતરને નથી જાણતો ત્યાંસુધી તે અજ્ઞાની જીવ વિષયાદિમાં પ્રવૃત્ત રહે છે.
- ૱ જ્ઞાની જીવ અનેક પ્રકારના પુદ્ગલદ્રવ્યને જાણતો હોવા છતાં, પરદ્રવ્યપર્યાયપણે તે પરિણામતો નથી, તેને ગ્રહણ કરતો નથી, અને તે-રૂપે ઊપજતો નથી.
- ૱ જે વિમૂઢ્યમાં પરદ્રવ્યને શુભ અથવા અશુભ માને છે તે મૂઢ અજ્ઞાની જીવ દુષ્ટ-અષ્ટકર્મોથી બંધાય છે.

**તેથી ન કરવો રાગ જરીયે ક્યાંય પણ મોકેચ્છુએ;  
વીતરાગ થઈને એ રીતે તે ભવ્ય ભવસાગર તરે.**

[ આ પ્રમાણે ભાવના સમાપ્ત થઈ. ]

### ૱ શ્રી સોનગઢ જૈન વિદ્યાર્થીગૃહ તરફથી સૂચના આપવામાં આવે છે

કે ધોરણ પાંચથી ( અગિયાર ( એસ. એસ. સી. ) સુધીના જે જૈનવિદ્યાર્થીને આ બોર્ડિંગમાં દાખલ થવું હોય તેમણે પચાસ પૈસાની ટિકિટ મોકલીને પ્રવેશપત્રો મંગાવી લેવા, અને તા. ૩૦-૫-૭૫ સુધીમાં ભરીને સોનગઢ મોકલી દેવા. બોર્ડિંગમાં માસિક ભોજન-લવાજમ રૂ. ૬૦ ) સાઈઠ છે; મધ્યસ્થિતિના વિદ્યાર્થી માટે ઓછી ફી રૂ. ૩૫ પાંત્રીસ છે. વિદ્યાર્થીઓને ધાર્મિક શિક્ષણ પણ અપાય છે.

-મંત્રી, જૈન વિદ્યાર્થીગૃહ, સોનગઢ ( સૌરાષ્ટ્ર ઉદ્ઘાટન )

## બીજા હાથીની વાર્તા ( જે હાથીમાંથી ભગવાન બન્યો )

એક હાથીની વાર્તા અંક ૭૭૪ માં વાંચી....તમને બહુ ગમી...હવે આ બીજા હાથીની વાર્તા છે, તે તો એનાથીયે વધુ ગમશે.....કેમકે પેલા ત્રિલોકમંડન હાથીનો જીવ તો સ્વર્ગમાં ગયો છે, જ્યારે આ બીજા હાથીનો જીવ તો તીર્થકર થઈને મોક્ષ પામ્યો છે. વાહ ભઈ વાહ ! હાથીનો જીવ કેવી રીતે મોક્ષ પામ્યો ! -તે જ્ઞાનવાની મજા આવશે...ને અમે પણ તે હાથીભાઈની જેમ મોક્ષનો માર્ગ પ્રગટ કરશું. માટે જટ તે વાર્તા કહો !

સાંભળો ! એક હતો બીજો હાથી. એનું નામ વજઘોષ. તે હાથીનો જીવ પૂર્વ ભવમાં પોદનપુરના રાજાનો મંત્રી હતો. તેનું નામ મરુભૂતિ, અને તેના મોટાભાઈનું નામ કમઠ. તે કમઠ બહુ કોધી હતો. એક વખત કોધિવશ પાપી કમઠે તેના નાનાભાઈને એક મોટા પત્થરવડે મારી નાંખ્યો, -તે નાનો ભાઈ મરુભૂતિ, દુઃખથી મરીને હાથી થયો; ને તેનો મોટોભાઈ કોધી કમઠ મરીને કુક્કટ નામનો જરીએ સર્પ થયો. તે હાથી સમ્મેદશિખરની નજીકના એક સરસ મજાના વનમાં રહે છે. અહા, થોડાક ભવ પણી જે સમ્મેદશિખરથી પોતે મોક્ષ પામવાનો છે તેની નજીકના વનમાં અત્યારે તે હાથી પશુ તરીકે બટકી રહ્યો છે. હજુ તે આત્મજ્ઞાન નથી પામ્યો, પણ હવે તેની તૈયારી છે. હાથી ઘણો મોટો છે, ને વનમાં સરોવર કિનારે રહીને જંગલનું રાજ ભોગવે છે. અરેરે, મોક્ષનો રાજ અત્યારે પોતાને ભૂલીને જંગલનો રાજ થઈને બેઠો છે. હવે આ બાજુ પોદનપુરમાં પોતાના મંત્રીને તેના મોટાભાઈએ મારી નાંખ્યો-એ જાણીને રાજ અરવિંદને વૈરાગ્ય થયો; એકવાર આકાશના વાદળામાં સુંદર જિનમંદિરની રચના થઈ, રાજ તે અદ્ભુત મંદિર દેખીને ઘણો રાજુ થયો ને તેવું મંદિર બનાવવાનો વિચાર કરે છે ત્યાં તો તે વાદળાં તરત વીખરાઈ ગયા, ને મંદિર અલોપ થઈ ગયું. સંસારની આવી ક્ષણભંગુરતા દેખીને રાજાએ રાજપાટ છોડીને દીક્ષા લીધી, ને મુનિ થઈને વન જંગલમાં વિચરવા લાગ્યા.

એકવાર તે અરવિંદ-મુનિરાજ મોટા સંધ સહિત સમ્મેદશિખરજી તીર્થની યાત્રા કરવા માટે જતા હતા, ને વનમાં સંધનો પડાવ કર્યો હતો; -એવામાં એક અદ્ભુત ઘટના બની. -શું બન્યું ? તે સાંભળો.

મુનિરાજ જે વનમાં સંવસહિત બિરાજ્યા છે, હાથી પણ તે જ વનમાં રહે છે. આ નિર્જન વનમાં આટલા બધા માણસો ને આટલો બધો કોલાહલ હાથીએ પહેલી જ વાર દેખ્યો....તેને ભય લાગ્યો કે આ બધા મને પકડવા આવ્યા હશે! એટલે તે હાથી ગભરાયો, તે એકદમ ખીજાયો, ને ઉશ્કેરાટથી ચારેકોર દોડવા લાગ્યો. સંવમાં એકદમ ધમાચકડી મર્યાદા ગઈ. બધા લોકો ભયભીત થઈને આમતેમ ભાગવા લાગ્યા. હાથી તો મોટીમોટી ગર્જના કરતો, તેમની પાછળ દોડવા લાગ્યો; ને જે હાથમાં આવ્યું તેને સૂંઠમાં પકડી પકડીને દૂર ફેંકવા લાગ્યો!

અરેરે! ભવિષ્યનો ભગવાન અત્યારે ગાંડો થયો છે! અત્યારે તિર્યંગપણે ભટકી રહેલો જીવ થોડાવખત પછી તીર્થકર થવાનો છે! જુઓ તો ખરા, જીવના પરિણામની વિચિત્રતા!

ગાંડા હાથીથી ભયભીત થયેલા લોકો મુનિના શરણમાં ગયા. અરવિંદમુનિરાજ ધ્યાનમાં બિરાજતા હતા. હાથી કિકિયારી કરતો-કરતો તે મુનિરાજ તરફ દોડયો લોકોને બીક લાગી કે, અરે, આ હાથી મુનિરાજને શું કરી નાંખશે?

મુનિરાજ તો શાંત થઈને બેઢા છે. એમને જોતાં જ સૂંઠ ઊંચી કરીને હાથી તેમના તરફ દોડયો. મુનિને બચાવવા લોકો દોડયા...પણ-

પણ શું થયું? તે ધીરજથી સાંભળો. તે અરવિંદ મુનિરાજની છાતીમાં એક ઉત્તમચિક્ષ હતું, તે ચિક્ષ જોતાં જ હાથી એકદમ વિચારમાં પડી ગયો...તેને થયું કે અરે! આમને તો મેં ક્યાંક જોયા છે! આ મારા ઓળખીતા ને હિતસ્વી હોય એમ મને લાગે છે. —આવા વિચારમાં હાથી તો એકદમ શાંત થઈને ઊભો રહ્યો; એનું ગાંડપણ મટી ગયું ને મુનિરાજ સામે સૂંઠ નમાવીને બેસી ગયો.

લોકો તો આશ્ર્ય પામી ગયા કે અરે! મુનિરાજ પાસે આવતાં જ આ ગાંડો હાથી એકાએક શાંત કેમ થઈ ગયો! આ બનાવ દેખીને ચારેકોરથી માણસો ત્યાં મુનિરાજ પાસે દોડી આવ્યા.

મુનિરાજે અવધિજ્ઞાન વડે હાથીના પૂર્વભવને જાણી લીધો; અને શાંત થયેલા હાથીને સબોધીને કહ્યું: અરે બુદ્ધિમાન! અરે મરુભૂતિ! આ પાગલપણું તને નથી શોભતું. આ પશુતા, અને આ હિંસા તું છોડ! હું અરવિંદરાજ છું ને મુનિ થયો છું; તું તારા પૂર્વભવમાં મારો મંત્રી હતો; ને તારા ભાઈએ તને મારી નાંખ્યો. તું આત્માનું ભાન ભૂલીને આર્તધ્યાનથી આ પશુપર્યાય પામ્યો. હવે તો તું ચેત...અને આત્માને

: ચૈત્ર : ૨૫૦૧

આત્મધર્મ

: ૪૧ :

ઓળખ. આત્માના અજ્ઞાનથી ચારે ગતિમાં ઘણાં દુઃખો તે ભોગવ્યા...હવે તો શાંત થઈને આત્માને ઓળખ.

મુનિરાજનાં મીઠાં વચન સાંભળીને હાથીને ઘણો વૈરાગ્ય થયો; તેને પોતાના પૂર્વભવનું જાતિસ્મરણજ્ઞાન થયું. પોતાના દુઃક્રમ માટે તેને ઘણો પસ્તાવો થયો; તેને આંખોમાંથી આંસુની ધાર પડવા લાગી, વિનયથી મુનિરાજનાં ચરણોમાં માથું નમાવીને તેમની સામે જોઈ રહ્યો....કુદરતી તેનું જ્ઞાન એટલું ઉધરી ગયું કે તે મનુષ્યની ભાષા સમજવા લાગ્યો...અને મુનિરાજની વાણી સાંભળવા તેને જિજ્ઞાસા જાગી.

મુનિરાજે જોયું કે આ હાથીના જીવના પરિણામ અત્યારે વિશુદ્ધ થયા છે, તેને આત્મા સમજવાની તીવ્ર જિજ્ઞાસા જાગી છે....અને તે એક હોનહાર તીર્થકર છે....એટલે અત્યંત પ્રેમથી ( વાત્સલ્યથી ) તે હાથીને ઉપદેશ દેવા લાગ્યા.

મુનિરાજ કહે છે: અરે હાથી ! તું શાંત થા. આ પશુપર્યાય એ કાંઈ તારું સ્વરૂપ નથી, તું તો દેહથી બિન્ન ચૈતન્યમય આત્મા છો. તું હાથી નથી, તું તો આત્મા છો. આત્માના જ્ઞાન વગર ઘણાં ભવમાં તે ઘણા દુઃખ ભોગવ્યાં, હવે તો આત્માનું સ્વરૂપ જાણ અને સમ્યગદર્શનને ધારણ કર. સમ્યગદર્શન જ જીવને મહાન સુખકર છે. કોધ અને જ્ઞાનને એકમેક અનુભવવાનો અવિવેક તું છોડ....છોડ ! તું પ્રસન્ન થા...સાવધાન થા.... અને સદાય ઉપયોગરૂપ સ્વદ્રવ્ય જ મારું છે એમ તું અનુભવ કર. તેથી તેને ઘણો આનંદ થશે. તું નિકટભવ્ય છો, થોડા ભવ પછી ભગવાન થવાનો છો, ને આ ભરતક્ષેત્રમાં જે તેવીસમા પારસનાથ તીર્થકર થશે-તે તું પોતે જ છો. માટે આજે જ આવો અનુભવ કર.

હાથી ખૂબ ભક્તિથી સાંભળે છે. ભગવાન થવાની વાત સાંભળતાં તેનો આત્મા નાચી ઉઠે છે. તેની આંખમાંથી આંસુની ધાર વહે છે. મુનિરાજના શ્રીમુખથી આત્માના સ્વરૂપની અને સમ્યગદર્શનની વાત સાંભળતાં તેને ઘણો હર્ષોલ્લાસ થાય છે, તેના પરિણામ વધુને વધુ નિર્મણ થતાં જાય છે....તેના અંતરમાં સમ્યગદર્શનની તૈયારી ચાલી રહી છે.

મુનિરાજ તેને આત્માનું પરમ શુદ્ધસ્વરૂપ દેખાડે છે: રે જીવ ! તારો આત્મા અનંત ગુણરત્નોનો ખજાનો છે...આ હાથીનું જાંદું શરીર તે તો પુદ્ગાલ છે, તે કાંઈ તું નથી. તું તો જ્ઞાનસ્વરૂપ છો. તારા જ્ઞાનસ્વરૂપમાં પાપ તો નથી ને પુણ્યનો શુભરાગ પણ નથી; તું તો વીતરાગ આનંદમય છો-આવા તારા સ્વરૂપને અનુભવમાં લઈને સમ્યગદર્શન ધારણ કર.

જગતમાં સમ્યજ્ઞર્ણન જ જીવને સારરૂપ છે; તે જ મોક્ષનું પગથિયું છે, તે જ ધર્મનો પાયો છે. સમ્યજ્ઞર્ણન વગર કોઈ પણ ધર્મકિયા હોતી નથી; સમ્યજ્ઞર્ણન વગરની બધી કિયાઓ નકામી છે. મિથ્યાત્વના દાવાનળમાં આખો સંસાર સળગી રહ્યો છે, તેમાંથી આ સમ્યજ્ઞર્ણન જ જીવને ઉગારનાર છે. વીતરાગ-સર્વજ્ઞ અરિહંત-દેવ, રત્નત્રયધારક દિગંબર મુનિરાજ-ગુરુ અને હિંસા વગરનો વીતરાગભાવરૂપ ધર્મ-આવા દેવ-ગુરુ-ધર્મને ઓળખીને તું શ્રદ્ધા કર, અત્યંત ભક્તિથી તેનો આદર કર, અને તેમણે આત્માનું શુદ્ધ સ્વરૂપ જેવું કહું છે તેવું તું જાણ....તેની શ્રદ્ધા કર....આવા સમ્યજ્ઞર્ણનથી તારું પરમ કલ્યાણ થશે.

-આમ ઘણા પ્રકારે મુનિરાજે સમ્યજ્ઞર્ણનો ઉપદેશ આપ્યો....તે સાંભળીને હાથી આત્માના વિચારમાં પડી ગયો કે અરે, હું તો જ્ઞાનસ્વરૂપ આત્મા છું, ને ભગવાન થવાનો છું, આમ કોધથી બિન્ન પોતાનું અત્યંત શાંત ચૈતન્યસ્વરૂપ વિચારમાં લેતાં તે હાથીના પરિણામ અંતર્ભૂખ થયા...અને અંતરમાં પોતાના આત્માનું સાચું સ્વરૂપ દેખીને તેને સમ્યજ્ઞર્ણન થયું...મહાન અતીન્દ્રિય આનંદનો અનુભવ થયો...તેને એમ થયું કે -‘અહા, અમૃતના દરિયા મારા આત્મામાં ડેલી રહ્યા છે...પરભાવોથી બિન્ન સાચું સુખ મારા આત્મામાં અનુભવાય છે. ક્ષણમાત્ર આવા આનંદના અનુભવથી અનંત ભવનો થાક ઉતરી જાય છે.’

આવા આત્માનો વારંવાર અનુભવ કરવાનું તેને મન થયું...ઉપયોગ ફરીને અંતરમાં એકાગ્ર થવા લાગ્યો. આ અનુભવના અચિંત્ય અપાર મહિમાનો કોઈ પાર ન હતો. વારંવાર તેને એમ થતું કે ‘અહો ! આ મુનિરાજે અદ્ભુત ઉપકાર કરી આત્માનું મૂળ સ્વરૂપ મને સમજાવ્યું. આત્મઉપયોગ સહજપણે જડપથી પોતાના સ્વસ્વરૂપ તરફ વળતાં સહજ નિર્વિકલ્પ સ્વરૂપ અનુભવાયું...ચૈતન્યપ્રભુ પોતાના ‘એકત્વ’ માં આવીને નિજાનંદમાં ડેલવા લાગ્યા...વાહ ! આત્માનું સ્વરૂપ કોઈ અદ્ભુત છે. પરમતત્ત્વને પામીને, મારા ચૈતન્યપ્રભુને મેં મારામાં જ હેખ્યા.’

‘અહા, આવી અનુભૂતિ મને પહેલી જ વાર થઈ; મેં મને ‘શાંતિનો પિંડ’ દેખ્યો. કોઈ પરમ અચિંત્ય-અદ્ભુત એ દર્શન અને એ વેદન હતું. વાહ, આત્મપરિણામની કોઈ અદ્ભુત આશ્રયકારી આનંદધારા ઉલ્લસી. શાંતિના પિંડનો સ્પર્શ થયો-વેદન થયું. થોડીક સેકંડનું એ વેદન હતું-પણ જાણો કેટલાય દીર્ઘકાળ સુધી સંસારથી દૂર દૂર નિજસ્વરૂપમાં જઈને આવ્યા હોઈએ-એવું પછી તેને લાગતું હતું.

: ચૈત્ર : ૨૫૦૧

આત્મધર્મ

: ૪૩ :

શાંતિનો પિંડ એવો પોતે-તે સિવાય બીજું કોઈ તે વખતે ન હતું.”

-આમ સમ્યગ્દર્શન થતાં હાથીના આનંદનો કોઈ પાર નથી. તેની આનંદમય ચેષ્ટાઓ, તથા તેની આત્મશાંતિ દેખીને મુનિરાજને પણ જ્યાલ આવી ગયો કે આ હાથીનો જીવ આત્મજ્ઞાન પામ્યો છે. ભવનો છેદ કરીને તે મોક્ષના માર્ગમાં આવ્યો છે. મુનિરાજે પ્રસન્ન થઈને હાથ ઊચો કરીને હાથીને આશીર્વાદ આપ્યા.

સંઘના હજારો લોકો આ દશ્ય દેખીને બહુ ખુશી થયા. એક ક્ષણમાં આ બધું શું બની રહ્યું છે તે સૌ આશ્રયથી જોવા લાગ્યા.

આત્માનું શાન થતાં હાથી તો ઘણા જ ભક્તિભાવથી મુનિરાજનો ઉપકાર માનવા લાગ્યો...અરે, પૂર્વે આત્માના ભાન વિના આર્તધ્યાન કરવાથી હું પશુદશાને પામ્યો, પણ હવે આ મુનિરાજના પ્રતાપે મને આત્મભાન થયું છે, ને તે આત્માના ધ્યાન વડે હવે હું પરમાત્મા થઈશ.-એમ વિચારીને તે હાથી સુંઠ નમાવીને મુનિરાજને નમસ્કાર કરતો હતો.

( જુઓ તો ખરા, બંધુઓ ! આપણો જૈનધર્મ કેવો મહાન છે કે તેના સેવન વડે એક પશુ પણ આત્મજ્ઞાન કરીને પરમાત્મા બની શકે છે ! દરેક આત્મામાં પરમાત્મા થવાની તાકાત છે—એમ આપણો જૈનધર્મ બતાવે છે. વાહ....જૈનધર્મ...વાહ ! )

મુનિરાજ પાસેથી સમ્યગ્દર્શનનું સ્વરૂપ સમજીને, હાથીની સાથેસાથે બીજા પણ ઘણાય જીવો સમ્યગ્દર્શન પામ્યા. જેમ તીર્થકર એકલા મોક્ષમાં ન જાય, બીજા ઘણાય જીવો પણ તેમની સાથે મોક્ષ પામે, તેમ અહીં તીર્થકરનો આત્મા સમ્યગ્દર્શન પામતાં, બીજા ઘણાય જીવો પણ તેમની સાથે સમ્યગ્દર્શન પામ્યા; અને ચારેકોર ધર્મનો જ્યયજ્યકાર થઈ ગયો. થોડીવાર પહેલાં જે હાથી ગાંડો થઈને હિંસા કરતો હતો, તે જ હાથી હવે આત્મજ્ઞાની થઈને શાંત અહિંસક બની ગયો, અને મુનિરાજ પાસેથી ફરી ફરી ધર્મ સાંભળવા માટે આતુરતાથી તેમની સામે જોઈ રહ્યો. ઘણા શ્રાવકો પણ ઉપદેશ સાંભળવા બેઠા હતા.

શ્રી મુનિરાજે મુનિધર્મનો તથા શ્રાવકધર્મનો ઉપદેશ આપ્યો: સમ્યગ્દર્શન અને આત્મજ્ઞાન ઉપરાંત જ્યારે ચારિત્રદશા થાય એટલે કે આત્માનો ઘણો અનુભવ થાય ત્યારે જીવને મુનિદશા થાય છે. તે મુનિઓ ઉત્તમ ક્ષમા વગેરે દશ ધર્મોને પાણે છે. અને હિંસાદિક પાંચ પાપો તેમને જરાય હોતાં નથી એટલે અહિંસા વગેરે પાંચ મહાવ્રત તેમને હોય છે.

—અને સમ્યગુર્દર્શન થવા છતાં જે જીવો મુનિ ન થઈ શકે તેઓ શ્રાવકધર્મ પાળે છે; તેમને આત્માના જ્ઞાનસહિત અહિંસા વગેરે પાંચ અણુવ્રત હોય છે. તિર્યંચગતિમાં પણ શ્રાવકધર્મનું પાલન થઈ શકે છે. માટે હે ગજરાજ ! તમે શ્રાવકધર્મને અંગીકાર કરો.

મુનિરાજ પાસેથી ધર્મનો ઉપદેશ સાંભળીને ઘણા જીવોએ વ્રત ધારણ કર્યા. હાથીને પણ મુનિ થવાની ભાવના જાગી કે જો હું મનુષ્ય હોત તો હું પણ ઉત્તમ મુનિધર્મને અંગીકાર કરત; આમ મુનિધર્મની ભાવના સહિત તેણે શ્રાવકધર્મ અંગીકાર કર્યો; એટલે મુનિરાજના ચરણોમાં નમસ્કાર કરીને તેણે પાંચ અણુવ્રત ધારણ કર્યા....તે શ્રાવક બન્યો.


સમ્યગુર્દર્શન પામીને વ્રતધારી થયેલો તે વજઘોષ હાથી વારંવાર મસ્તક નમાવીને અરવિંદ-મુનિરાજને નમસ્કાર કરવા લાગ્યો, સૂંઠ ઊંચી-નીચી કરીને ઉપકાર માનવા લાગ્યો. હાથીની આવી ધર્મચેષ્ટા દેખીને શ્રાવકો બહુ રાજુ થયા; અને જ્યારે મુનિરાજે પ્રસિદ્ધ કર્યું કે—આ હાથીનો જીવ આત્માની ઉજ્ઞતિ કરતો-કરતો ભરત ક્ષેત્રમાં રડ માં તીર્થકર થશે, —ત્યારે તો સૌના હર્ષનો પાર ન રહ્યો; હાથીને ધર્માત્મા જાણીને ઘણા પ્રેમથી શ્રાવકો તેને નિર્દોષ આણાર દેવા લાગ્યા.

યાત્રાસંધ થોડો વખત તે વનમાં રોકાઈને પછી સમ્મેદશિખર તરફ ચાલ્યો; હાથીનો જીવ થોડા ભવ પછી આ જ સમ્મેદશિખર ઉપરથી મોક્ષ પામવાનો છે; તેની યાત્રા કરવા સંધ જાય છે. અરવિંદ મુનિરાજ પણ સાથે વિહાર કરવા લાગ્યા. ત્યારે હાથી પણ અત્યંત વિનયપૂર્વક પોતાના ગુરુને વોળાવવા માટે દૂર-દૂર સુધી પાછળ ગયો.... અંતે ફરીફરીને મુનિરાજને નમસ્કાર કરીને ગદગદભાવે પોતાના વનમાં પાછો આવ્યો.

હાથી હવે પ્રાંચ્યવ્રત સહિત નિર્દોષ જીવન જીવે છે; પોતે જે શુદ્ધ આત્મા અનુભવ્યો છે તેની ફરીફરીને ભાવના કરે છે. કોઈ પણ જીવને તે હેરાન કરતો નથી, ત્રસહિંસા થાય તેવો ખોરાક ખાતો નથી; શાંતભાવથી રહે છે, ને સુકાઈ ગયેલા ઘાસપાન ખાય છે; કોઈવાર ઉપવાસ પણ કરે છે. ચાલતી વખતે પગ જોઈ જોઈને મૂકે છે. હાથિણીનો સંગ તેણે છોડી દીધો છે. મોટા શરીરને લીધે બીજા જીવોને દુઃખ ન થાય —તે માટે શરીરને બહુ હલાવતો નથી, વનના પ્રાણીઓ સાથે શાંતિથી રહે છે ને ગુરુના ઉપકારને વારંવાર યાદ કરે છે. હાથીની આવી શાંત ચેષ્ટા દેખીને બીજા હાથીઓ તેની સેવા કરે છે; વનના વાંદરા અને બીજા પશુઓ પણ તેના ઉપર પ્રેમ રાખે છે ને સુકાં ઘાસપાન લાવીને તેને ખવડાવે છે.

પૂર્વભવનો તેનો ભાઈ કમઠ, -કે જે કોધથી મરીને ઝેરી સર્પ થયો છે તે આ વનમાં જ રહે છે, જીવજંતુઓને મારી ખાય છે ને નવાં પાપ બાંધે છે.

એક દિવસ હાથીને તરસ લાગી એટલે પાણી પીવા માટે તે સરોવર પાસે આવ્યો; તળાવના કિનારે ઝાડ ઉપર ઘણા વાંદરા રહેતા હતા, તે આ હાથીને જોઈને ખુશી થયા. તળાવમાં ચોખ્યું પાણી જોઈને તે પીવા માટે હાથી સરોવરમાં ઊતર્યો; પણ તેનો પગ ઊંડા કાદવમાં ખૂંચી ગયો. તે કાઢવાની ઘણી મહેનત કરવા છતાં નીકળી ન શક્યો. આથી તે હાથીએ આહાર-પાણીનો ત્યાગ કરીને સમાધિમરણની તૈયારી કરી; તે પંચપરમેષ્ઠીને યાદ કરીને આત્માનું ચિંતન કરવા લાગ્યો. વૈરાગ્યપૂર્વક તે એમ વિચારવા લાગ્યો કે અરે, અજ્ઞાનથી કુમરણ તો મેં અનંતવાર કર્યા, પણ હવે આ અવતાર સફળ છે કે જેમાં મને આત્માનું ભાન થયું ને સમાધિમરણનો સુઅવસર મળ્યો. શ્રી મુનિરાજે મારા ઉપર મહાન કૃપા કરીને દેહથી બિન્ન મારું સ્વરૂપ મને સમજાવ્યું, મારા નિધાન મને દેખાડ્યા; તેમની કૃપાથી મારો નિજવૈભવ મેં મારા આત્મામાં દેખ્યો. બસ, હવે આ દેહથી બિન્ન આત્માની ભાવના વડે હું સમાધિમરણ કરીશ.



હાથીને કાદવમાં ખૂંચી ગયેલો જોઈને તેને બચાવવા વનના વાંદરા ઘણી કિકિયારી કરવા લાગ્યા. પણ એ નાનકડા વાંદરા મોટા હાથીને કઇ રીતે બહાર કાઢી શકે? એવામાં સર્પ થયેલો કમઠનો જીવ ઝૂંફડા મારતો ત્યાં આવ્યો; હાથીને દેખતાં જ પૂર્વભવના વેરના સંસ્કારને લીધે તેને ઘણો કોધ ચડયો ને દોડીને હાથીને કરડયો. કાળકૂટ ઝેરવાળો સર્પ કરડવાથી હાથીને ઝેર ચડયું અને થોડા વખતમાં તેનું મરણ થયું. પરંતુ આ

વખતે તેણે પહેલાંની કેમ આર્તધ્યાન ન કર્યું, આ વખતે તો આત્માના જ્ઞાનસહિત ધર્મની ઉત્તમ ભાવના ભાવતાં-ભાવતાં તેણે સમાધિમરણ કર્યું....અને દેહ છોડીને તે બારમા સ્વર્ગમાં દેવ થયો.

સર્પ હાથીને કરડયો તે દેખીને એક વાંદરાને ઘણી ખીજ ચડી અને તેણે તે સર્પને મારી નાંખ્યો; પાપી સર્પ આર્તધ્યાનથી મરીને પાંચમી નરકમાં ગયો. એક

: ૪૬ :

આત્મધર્મ

: ચૈત્ર : ૨૫૦૧

વખતના બે સગા ભાઈ, તેમાં પુણ્ય-પાપના ફળ અનુસાર એક તો સ્વર્ગમાં ગયો ને બીજો નરકમાં ગયો.

❖ ત્યારપછી તે હાથીનો જીવ મનુષ્ય થઈને અજીવેગ નામનો મુનિ થયો, ને સર્પનો જીવ અજગર થઈને તે મુનિને ખાઈ ગયો. એક સ્વર્ગમાં ગયો, બીજો નરકમાં થયો.

❖ પછી તે હાથીનો જીવ વિદેહક્ષેત્રમાં વજનાભી ચકવતી થયો ને મુનિ થઈને ધ્યાનમાં બેઠો હતો; ત્યાં સર્પનો જીવ ભીલ થયેલો, તેણે બાણવડે તે મુનિને મારી નાંખ્યા; પાછા એક સ્વર્ગમાં ગયા ને બીજો નરકમાં ગયો.

❖ પછી તે હાથીનો જીવ આનંદકુમાર નામનો રાજી થયો, ને સર્પ ( કમઠ ) નો જીવ સિંહ થયો. આનંદકુમારે મુનિ થઈને તીર્થકર નામકર્મ બાંધ્યું; એકવાર તે ધ્યાનમાં બેઠા હતા ત્યાં સિંહ આવીને તેમને ખાઈ ગયો. એક સ્વર્ગમાં ગયા, બીજો નરકમાં ગયો.

સ્વર્ગમાંથી નીકળીને તે હાથીનો જીવ વારાણસી ( કાશી ) નગરીના રાજકુમાર તરીકે અવતર્યો. એનું નામ પારસનાથ. એ જ આપણા તેવીસમા તીર્થકર. હાથીના ભવમાં આત્માની ઓળખાણ કરેલી, તેના પ્રતાપે આગળ વધીને તેઓ કેવળજ્ઞાન પામ્યા, ને સમેદશિખરની સુવર્ણભદ્ર નામની ટૂંક ઉપરથી શ્રાવણ સુદ સાતમે મોક્ષ પામ્યા.

વાહ, જુઓ, જૈનધર્મનો પ્રતાપ ! તેમાં એક હાથીનો જીવ પણ આત્માને ઓળખીને આગળ વધતાં પરમાત્મા બની ગયો. બંધુઓ ! આપણે પણ આવો જૈનધર્મ પામ્યા છીએ; તો તમે પણ હાથીની જેમ આત્માને ઓળખજો ને પરમાત્મા બનજો.

ભેગાભેગી એક બીજી વાત પણ જાણી લ્યો : જે કમઠ અને સર્પના જીવે અનેક વાર તે હાથીના જીવને માર્યો, તે જ સર્પનો જીવ, જ્યારે તે હાથીનો જીવ ભગવાન થયો ત્યારે તેમની પાસેથી ધર્મ પામ્યો ને પોતાના આત્માને ઓળખીને તે સ્વર્ગમાં ગયો. થોડા વખતમાં તે પણ મોક્ષપદને પામશે.

સમૃગ્દર્શનના પ્રતાપે હાથીમાંથી ભગવાન બનેલા તે પરમાત્માને નમસ્કાર હો

( બીજી હાથીની વાર્તા પૂરી. )

બંધુઓ, હવે થોડા વખત પછી તમને સિંહની વાર્તા કહેશું. “અરર ! સિંહની વાર્તા ! -સિંહની તો બીક લાગે ! ” ડરો મા ! બંધુઓ ! આ તો ધર્માત્મા -સિંહની વાત છે, એ તમને કરડશે નહિં, -ઊલ્ટું એને હેખીને તો તમનેય આત્માને ઓળખવાની પ્રેરણા જાગશે, ને તે સિંહ ઉપર પ્રેમ આવશે.



-જ્ય મહાવીર

: ચૈત્ર : ૨૫૦૧

આત્મધર્મ

: ૪૭:



આત્મધર્મ અંક-૭૭૫ માં જે કામ શોધી કાઢવાનું પૂછેલ, તે ઉત્તમ કામ છે ‘સ્વાધ્યાય’. તે તમે એકલા પણ કરી શકો છો; સ્વાધ્યાય વખતે તો આપણો આપણી વણાલી જિનવાણીમાતાના ખોળામાં બેઠા હોઈએ એવી શાંતિ થાય છે, ને આપણો થાક ઉત્તરી જાય છે. આપણો એકલા હોઈએ ત્યારે ‘સ્વાધ્યાય આપણો ખાસ સાથીદાર બની જાય છે ને આપણને આનંદ આપે છે. સ્વાધ્યાય વખતે ‘પાનું ફરે ને શાંતિ જરે’ છે. જિનવાણીની સ્વાધ્યાયથી આત્માને લાભ જ થાય છે, તેનાથી નુકશાન થતું નથી, તેથી તો જિનવાણીને ‘હિતોપદેશી’ કહેલ છે. એક નિર્વિકલ્પધ્યાન સિવાય સ્વાધ્યાયને સર્વોત્તમ કાર્ય ગણીને સર્વે સંતોષે તેનો ઉપદેશ કર્યો છે; સ્વાધ્યાયને પરમ તપ કહેલ છે. દરેક મુમુક્ષુ દરરોજ સ્વાધ્યાય કરે છે, એ તેનું પ્રિય અને નિર્દોષ કાર્ય છે. તેમાં કોઈ આરંભ કરવો પડતો નથી; મુનિઓ પણ તે કાર્ય કરે છે; સ્વાધ્યાય રાત્રે પણ થઈ શકે છે....અને જ્યારે તમે આ વાંચી રહ્યા છો ત્યારે તમે પણ ‘સ્વાધ્યાય’ જ કરી રહ્યા છોને?

જેમ જિનમંદિરે જવું તે દરરોજનું કર્તવ્ય છે, તેમ સ્વાધ્યાય કરવી તે પણ તેટલું જ (અથવા તેથી પણ વધારે) ઉપયોગી દરરોજનું કર્તવ્ય છે.

આત્મતત્ત્વનું શાન કરવા.....સ્વાધ્યાય કરો.....સ્વાધ્યાય કરો.  
મોહભાવનો નાશ કરવા.....સ્વાધ્યાય કરો....સ્વાધ્યાય કરો.

( સાક્ષી: પ્રભુ કુંદુંદેવની પ્રવચનસાર ગાથા ૮૯ માં )

**શાસ્ત્રોપ્તે પ્રત્યક્ષ-આદિથી જાળતો જે અર્થને,  
તસુ મોહ પામે નાશ નિશ્ચય, શાસ્ત્ર સમધ્યયનીય છે.**

હે મુમુક્ષુ! કદાચ ખાધા વગર રહેજે પણ સ્વાધ્યાય વગરનો દ્વિવસ ગુમાવીશ મા! થોડાક જિનવચનની સ્વાધ્યાયથી પણ તને જે શાંતિ મળશે-તે શાંતિ દુનિયામાં બીજે કયાંય નહીં મળે.

## મહાવીર નિર્વાણમહોત્સવમાં વીર બાળકોનો ઉત્સાહ

ભગવાન મહાવીરના અઢીહજારવર્ષીય નિર્વાણમહોત્સવનો જે અનેરો પ્રસંગ આપણા જીવનમાં આવ્યો છે તેના હર્ષોલ્લાસના પ્રતીક તરીકે ખાસ કરીને બાળકો તેમજ વડીલો તરફથી અઢીહજાર પૈસા આત્મધર્મ-બાળવિભાગમાં આવી રહ્યા છે, તેની યાદી-

|     |                             |       |     |                         |       |
|-----|-----------------------------|-------|-----|-------------------------|-------|
| ૫૩૫ | ઈલાબેન શાંતિલાલ શાહ         | કલકતા | ૫૬૧ | દિલિપ સંઘવી             | કલકતા |
| ૫૩૬ | દિપેન શાંતિલાલ              | કલકતા | ૫૬૨ | સમરતબેન સંઘવી           | કલકતા |
| ૫૩૭ | દેવેસ શાંતિલાલ              | કલકતા | ૫૬૩ | ભાનુભાઈ દેસાઈ           | કલકતા |
| ૫૩૮ | અંજનાબેન શાંતિલાલ શાહ       | કલકતા | ૫૬૪ | દ્યાકુવરબેન દેસાઈ       | કલકતા |
| ૫૩૯ | ચંદ્રિકાબેન જૈન             | કલકતા | ૫૬૫ | આશાબેન દેસાઈ            | કલકતા |
| ૫૪૦ | મુક્તાબેન શેઠ               | કલકતા | ૫૬૬ | મહેન્દ્ર દેસાઈ          | કલકતા |
| ૫૪૧ | વર્ષાબેન મનસુખલાલ જૈન       | કલકતા | ૫૬૭ | જાતેન્દ્ર દેસાઈ         | કલકતા |
| ૫૪૨ | જયેશ મનસુખલાલ જૈન           | કલકતા | ૫૬૮ | અરૂણાબેન દેસાઈ          | કલકતા |
| ૫૪૩ | પારુલ છબીલદાસ જૈન           | કલકતા | ૫૬૯ | નિલમ હસમુખલાલ જૈન       | કલકતા |
| ૫૪૪ | અમિતાબેન છબીલદાસ જૈન        | કલકતા | ૫૭૦ | ચુનીલાલ જેઠાલાલ શાહ     | કલકતા |
| ૫૪૫ | જાતેશ છબીલદાસ જૈન           | કલકતા | ૫૭૧ | સમજુબેન શાહ             | કલકતા |
| ૫૪૬ | મંજુલાબેન ભાઈલાલ વોરા       | કલકતા | ૫૭૨ | કેસરબેન શાહ             | કલકતા |
| ૫૪૭ | સુરેશભાઈ દેસાઈ              | કલકતા | ૫૭૩ | ચંદ્રિકાબેન જૈન         | કલકતા |
| ૫૪૮ | રાજેન્દ્રકુમાર કનેચાલાલ જૈન | કલકતા | ૫૭૪ | પદ્માબેન જૈન            | કલકતા |
| ૫૪૯ | માલાબેન ચંદુલાલ મેધાણી      | કલકતા | ૫૭૫ | કિરીટ જૈન               | કલકતા |
| ૫૫૦ | જયેશ ચંદુલાલ મેધાણી         | કલકતા | ૫૭૬ | સુભાષ જૈન               | કલકતા |
| ૫૫૧ | દિલિપભાઈ જૈન                | કલકતા | ૫૭૭ | ચદ્રકાંત ચુનીલાલ શાહ    | કલકતા |
| ૫૫૨ | અશીનભાઈ જૈન                 | કલકતા | ૫૭૮ | તરુલતાબેન શાહ           | કલકતા |
| ૫૫૩ | આરતીબેન જૈન                 | કલકતા | ૫૭૯ | મિનાક્ષીબેન જૈન         | કલકતા |
| ૫૫૪ | અતુલભાઈ જૈન                 | કલકતા | ૫૮૦ | મુકેશ જૈન               | કલકતા |
| ૫૫૫ | કલ્યાણબેન જૈન               | કલકતા | ૫૮૧ | નિતીન જૈન               | કલકતા |
| ૫૫૬ | મિતાબેન જૈન                 | કલકતા | ૫૮૨ | રંજનબેન વોરા            | કલકતા |
| ૫૫૭ | નિશાબેન જૈન                 | કલકતા | ૫૮૩ | હેમલતાબેન શેઠ           | કલકતા |
| ૫૫૮ | અમિતાબેન જૈન                | કલકતા | ૫૮૪ | ભંવરદેવી જૈન            | કલકતા |
| ૫૫૯ | પ્રકાશચંદ્ર મનસુખલાલ જૈન    | કલકતા | ૫૮૫ | ઇન્દ્રાબેન મનસુખલાલ શાહ | કલકતા |
| ૫૬૦ | સુધાબેન સંઘવી               | કલકતા | ૫૮૬ | અરૂણાબેન છબીલદાસ જૈન    | કલકતા |
|     |                             |       | ૫૮૭ | બિપિન શાંતિલાલ શાહ      | કલકતા |

: ચૈત્ર : ૨૫૦૧

આત્મધર્મ

: ૪૮ :

## \* અહો, જિનેન્દ્રદેવના કલ્યાણક પ્રસંગે ઘણા જીવો ધર્મ પામે છે. \*

### \* ચૈતન્યચક્વતીઃ ૮૬ ૨૮૦૮ પૃ. ૪ થી ચાલુ \*

૨૮. અહો, જ્યાં છ કારકરૂપ સ્વશક્તિનો નિર્જય કર્યો ત્યાં નિજકાર્યને માટે બહારના સાધનોની ચિંતા નથી રહેતી, એ રીતે નિશ્ચિંત-પુરુષો વડે આત્મા સધાય છે.
૩૦. પોતામાં જેણે સ્વભાવની પૂર્ણતા ન હેખી તે જીવ પોતાના કાર્યને માટે બાધ્ય સાધનના ફાંઝાં મારે છે ને પરાશ્રયથી દુઃખી થાય છે.
૩૧. અહો સ્વભાવની પૂર્ણતા અને છાએ કારકોની સ્વાધીનતા બતાવીને આચાર્યદિવ સ્વાશ્રય તરફ લઈ જાય છે...કે જે સ્વાશ્રયમાં અનંત ગુણની નિર્મળ અનુભૂતિનું પરમ સુખ વેદાય છે.
૩૨. શાનસ્વભાવી આત્માને પોતાની અનંત શક્તિ સાથે એકત્વ, ને અનંત પરપદાર્થોથી વિભક્તપણું છે. સ્વમાં એકત્ર કરાવીને પરથી વિભક્તપણું કરાવે તે જ ખરી વિભક્તિ કહેવાય; તેમાં કર્તા-કર્મ-કરણ વગેરે છાએ કારકો સમાઈ જાય છે.
૩૩. આત્મા પોતાના કારકોને (-કર્તાને સાધનને, વગેરેને) ક્યાંય બહારથી નથી લાવતો, અંતમુખપણે પોતે જ પોતાના સમ્યજ્ઞનાદિના છાએ કારકોરૂપે પરિણામી જાય છે. આ રીતે છાએ કારકની સ્વતંત્ર પ્રભુતાથી શોભતો તે ચૈતન્યચક્વતી છે.
૩૪. જૈન ચક્વતીને પરાધીનતા હોય નહિ તેમ છાએ કારકો જેને સ્વતંત્ર-સ્વાધીન છે એવા ચૈતન્યચક્વતીને પોતાના કાર્યની સિદ્ધિ માટે કોઈ અન્ય કારકોની પરાધીનતા નથી; સ્વાધીનપણે સ્વાશ્રયવડે તે પોતાના કાર્યને સાધે છે.
૩૫. અહો ! મારા સ્વભાવનું કાર્ય કરવાની તાકાત મારામાં જ પડી છે... એમ એક વાર દેટપણે નક્કી તો કરો... -એ નક્કી કરતાં જ પરાશ્રયબુદ્ધિ છૂટી જશે, ને સ્વાશ્રયની નિર્મળકાર્ય થશે.
૩૬. જે નિર્મળકાર્ય-સમ્યજ્ઞનાદિ-થયું તેનો કર્તા પણ આત્મા સ્વયમેવ છે. કોઈ બીજો તો કર્તા નહિ, નિમિત્ત તો કર્તા નહિ, રાગ તો કર્તા નહિ, ને પૂર્વની

: ૫૦:

આત્મધર્મ

: ચૈત્ર : ૨૫૦૧

## \* જિનેન્દ્રદેવના અચિંત્યસ્વરૂપને ઓળખતાં આત્મા ઓળખાય છે. \*

-  નિર્મળપર્યાય પણ તેની કર્તા નહિ. તે સમયે સ્વાશ્રયવડે આત્મા પોતે જ તેના કર્તાપણે પરિણામ્યો છે.
-  ૩૭. ચૈતન્યની પ્રભુતાથી શોભતો ભગવાન આત્મા પોતે જ સ્વતંત્રપણે નિજશક્તિથી પોતાના નિર્મળકાર્યનો કર્તા થાય છે.
-  ૩૮. ભાઈ, તારા કાર્ય માટે જગતની સામે ન જો.....તારામાં જ જો; -કેમકે સ્વતંત્રપણે તારા સમ્યકૃત્વાદિ કાર્યનો કર્તા થવાની તાકાત તારા આત્મામાં જ છે.
-  ૩૯. ક્ષાયિક સમ્યકૃત્વરૂપ કાર્ય કેવળી કે શ્રુતકેવળીની સમીપમાં જ થાય એવો નિયમ છે, -તો શું તે કાર્યના કર્તા કેવળી કે શ્રુતકેવળી છે ? ના; તે આત્મા પોતે જ પોતાની કાર્યશક્તિથી તેનો કર્તા થાય છે.
-  ૪૦. અહો, આ તો વીરપ્રભુએ વબ્ધવેલી સંજીવની છે....કે જેને જીલતાં ચૈતન્યનું ખરું જીવન પ્રાપ્ત થાય છે. ભાઈ, અંતર્મુખદૃષ્ટિવડે તારા આત્મભંડારને ખોલ, ને સાચું આનંદમય જીવન જીવ.
-  ૪૧. અંતર્મુખ થઈને નિર્મળપરિણામ થયા-સમ્યજ્ઞશન થયું, શાન થયું, ચાર્ચિત થયું, તેનું સાધન પોતાની કરણશક્તિવડે આત્મા પોતે જ થાય છે.
-  ૪૨. અહો, આ સાધકપણાનું સાધન ! ભાઈ, તારામાં જ તારું સાધન પડ્યું છે. તારો આત્મા પોતે જ એવો કરણપરમાત્મા છે કે સમ્યજ્ઞશનાદિનું સાધન થાય.
-  ૪૩. વ્યવહારમાં અનેક પ્રકારના સાધનોનું કથન આવે, પંચેન્દ્રિય તે સાધન, સત્તસમાગમ તે સાધન, શુભરાગ તે સાધન, પૂર્વની પર્યાય તે સાધન-પરંતુ એ બધાને ઉપચારથી સાધન ક્યારે કહેવાય ? -કે અંતર્મુખ થઈને ચિદાનંદસ્વભાવને જ્યારે સાધન બનાવે ત્યારે.
-  ૪૪. ભાઈ, તારા સર્વ સાધન તારા ચૈતન્યધામમાં જ છે કેમકે-જ્યાં ચેતન ત્યાં સર્વ ગુણ...કેવળી બોલે એમ.
-  ૪૫. અહો, મારું ચૈતન્યધામ જ મારા સર્વ સાધનથી પરિપૂર્ણ છે-એમ પહેલાં એની સ્વચ્છ થવી જોઈએ. સ્વચ્છ થતાં તે તરફ પરિણામન થાય છે.

: ચૈત્ર : ૨૫૦૧

આત્મધર્મ

: ૫૧:

## \* ધર્મની વૃદ્ધિ કરનારા વર્જ્ઝમાનહેવ ! આમ અંતરમાં બિરાજે છે \*

૪૬. દ્વય તરફ સચિ થઈ ત્યાં આરાધકપણું થયું, તે આરાધકપણાનું કારણ થાય એવો જ આત્માનો સ્વભાવ છે; વિરાધકપણાનું કારણ થાય એવો આત્માનો સ્વભાવ નથી.
૪૭. હે વીર ! તારો માર્ગ તો અફર છે...તારા માર્ગ ચડ્યો તે પાછો ફરે નહીં; આરાધના પૂરી કરીને મોક્ષ લીધે છૂટકો.
૪૮. પોતાના સ્વભાવથી દેવામાં આવતો જે ભાવ (-ક્યો ભાવ ? -કે સમ્યજ્ઞર્ણનાં નિર્મળભાવ); તેને પોતે લ્યે એવી સંપ્રદાનશક્તિ આત્મામાં છે.
૪૯. આત્માથી શું દેવામાં આવે છે ? -શું આત્મા પરદવ્ય આપે છે ? -ના; આત્મા વિકાર આપે છે ? -ના; વિકાર કાંઈ આત્મસ્વભાવમાં ભર્યો નથી કે તે વિકાર આપે. સ્વભાવસન્મુખ થતાં આત્મા પોતે પોતાને નિર્મળપર્યાય આપે છે, ને પોતે જ પાત્ર થઈને તે લ્યે છે.

( વિશેષ આવતા અંકે )



## કેસે ભૂલેં યાદ આપકી....

[ શ્રી રૂપેન્દ્ર જૈન ( બયાના ) ના કાવ્યના આધારે: બ્ર. હ. જૈન ]

જૈનધર્મકા અનુપમ ઝંડા ભારતમે ફરારાયા હૈ,  
નિજવૈભવકા તત્ત્વ સભીકો, મહાવીર ! બતલાયા હૈ.  
કેસે ભૂલેં યાદ આપકી, તુમને હુમેં જગાયા હૈ,  
વિષયભોગમેં મસ્ત પડે હમ, તુમને શાન કરાયા હૈ.  
વીતરાગ-સર્વક્ષ બનકર પાવન પથ બતલાયા હૈ,  
નિજાતમકી દિવ્યશક્તિકો, ખોલ ખોલ સમજાયા હૈ.  
રાગ-દ્રેષ્ટકે ઊપર ઉઠકર, સમતાભાવ સિખાયા હૈ,  
આત્મધર્મકા અદ્ભુત ચેતન સત્યરૂપ દિખલાયા હૈ.  
કેસે ભૂલેં યાદ આપકી, તુમને હુમેં જગાયા હૈ.

## સદ્ગુરુ સાદ પાડે છે—

### મોક્ષપુરીના મારગ

### આવો.....ઓ અનજીન બટોડી

[ શ્રીગુરુ શાંતિવિભોર પ્રવચન કરતાં કરતાં જ્યારે આંખ બંધ  
કરીને કહે છે કે હે જીવ ! એકવાર તો તારી અંદર જો. -એ સાંભળતાં  
શ્રોતાઓને અંતરમાંથી કેવા જંકાર ઉઠે છે આપ વાંચો. ] ( બટોડી = મુસાફર )

પરસે પ્રીતિ લગાકર અબ તક વ્યર્थ ઉમરિયા ખોઈ,  
ચારોં ગતિમે ભટક રહા કર્યો ઓ અનજીન બટોડી !  
પરમે ખોજ રહા જિસ સુખકો વહુ હૈ તેરે અંદર,  
એકવાર તો દેખ સુખોંકા લહરા રહા સમુંદર,  
બન કર દીન ડેલતા હૈ કર્યો ઓ શિવપુરકે વાસી,  
તૂ હી સ્વયં સિદ્ધ પરમાત્મ અજર અમર અવિનાશી.  
અબ તક મિથ્યા ભ્રમમે પડકર કાણી મંજુલ ખોઈ,  
ચારોં ગતિમે ભટક રહા કર્યો ઓ અનજીન બટોડી !  
કિયાકાંડકો ધર્મ સમજકર અબ તક સમય ગમાયા,  
સંકલેશોંકા સાગર જેલા સુખકો સમજ ન પાયા,  
ભટક રહા મોહંધકારમે ઉમર ગમાતા પ્રતિક્ષણ,  
તત્પોકી પૈની છેનીસે કાટ મોહક બંધન.  
રાગ-દ્વેષકો માર તુરે બનના હોણા નિર્મોહી,  
મોક્ષપુરીકે મારગ આઓ ઓ અનજીન બટોડી !  
સદ્ગુરુ બુલા રહે હેન્તજ હે મૃગતૃષ્ણાકા ફેરા,  
યુગો-યુગોંકે બાદ આજ આયા હૈ સુખદ સબેરા.  
મોહનીદકો ત્યાગ બેદન્વિજ્ઞાન હદ્યમે ધર લે,  
સમ્યજ્ઞનકા દર્શન કર જગસે પાર ઉત્તર લે,  
'કાકા ! ' વ્યર્થ ગમાયા નરભવ અગર ઘડી યહ ખોઈ,  
ચારોં ગતિમે ભટક રહા કર્યો ઓ અનજીન બટોડી !  
મોક્ષપુરીકે મારગ આઓ ઓ અનજીન બટોડી !

[ કવિ - ફિજારીલાલ જૈન 'કાકા' પો. સકરાર ( જાંસી ) ]

# જૈનશાસનની વીતરાગતા અજોડ છે

અહો, વીતરાગી વીરનાથપ્રભુએ પ્રકાશેલું આપણું જૈનશાસન !  
આ જૈનશાસનની વીતરાગતા એવી અજોડ છે કે જીવને ક્યાંય અશાંતિ  
થવા દેતી નથી. જૈનશાસનના સેવનવડે પ્રગટેલી ચૈતન્યતત્ત્વની વીતરાગી  
શાંતિમાં અશાંતિ ઊભી કરવાની તાકાત જગતના કોઈ જ પ્રસંગમાં નથી.

પરમ વૈરાઘ્યરસધોલનને લીધે મુમુક્ષુનું ચિત્ત સંસારમાં ક્યાંય  
ચોટનું નથી...એની વૈરાઘ્યભાવના નિરંતર વધતી જ જાય છે.

હે મુમુક્ષુ ! તે ચૈતન્યનું મુમુક્ષુપણું પ્રગટ કર્યું છે, તો હવે તે  
મુમુક્ષુપણાનું એક વધુ પગથિયું ચડીને આત્મામાં પહોંચી જાં...બસ, પછી  
તો સસારની લાખો મુંજવણ પણ તને ડગાવી નહિ શકે. જગતની બધી  
મુંજવણો વચ્ચે અડગ રહીને માર્ગ કાઢી લેનારું પરમ-પરમ શાંત આપણું  
ચૈતન્યતત્ત્વ-કે જે મહાવીરપ્રભુની પ્રસાદીરૂપે આપણને મળ્યું છે-તેને યાદ  
કરીને, તેના જ આધારે ધૈર્ય-શાંતિ-સમાધાન બધુંય મેળવવાનું છે. અને એ  
રીતે થતી શાંતિમાં જે વીતરાગતા છે તે જગતમાં અજોડ છે.

આધાતના પ્રસંગોમાં દુનિયા તો દુનિયાની રીતે સમાધાન કરે છે;  
પણ મુમુક્ષુની ચૈતન્યરસમય સમાધાનની રીત દુનિયાથી નીરાળી છે. ક્યાંય  
રાગ-દ્વેષની વૃદ્ધિવગર તે પોતાની શાંતિમાં વૃદ્ધિ કરે છે, ને એ જ સાચું  
સમાધાન છે.

હું તો જ્ઞાન છું-એવી નિજભાવનામાં તત્પર મુમુક્ષુને, જગતનો  
કોઈ પ્રસેગ શું તેના માર્ગથી ચલિત કરવા સમર્થ છે? પોતે પોતાના  
આત્માથી જ પ્રસન્ન રહેનારો તે જીવ સંયોગ પાસેથી શાંતિની ભીખ  
માંગતો નથી, પોતે જ સ્વયં શાંતભાવરૂપ થઈ જાય છે.

વીરનાથ અને બાહુબલી જેવા સંતો જગતને સેંદેશ આપી રહ્યા છે  
કે દુનિયામાં ગમે તે બનો, મોક્ષનો સાધક તો પોતાની આત્મસાધનામાં  
મસ્ત રહે છે-દુનિયાથી અલિપ્ત !

**વાહ રે વાહ, શાયકતત્ત્વ ! તારી બલિદ્ધારી છે.**

## મહાવીર ભગવાનનો મોટો ઉપકાર છે

### તેમનો ઉત્સવ સૌ આનંદથી ઉજવો

[ શાનથી, ભક્તિથી, ને તન-મન-ધનથી સૌ ઉત્સવમાં ભાગ લ્યો. ]



ચૈત્રસુદ તેરસે ભગવાનના જન્મની મંગલ વધાઈ આવી ગઈ. અત્યારે ભગવાન મહાવીરના અઠીહજારવર્ષીય નિર્વાણમહોત્સવનો મંગલ નાદ ભારતભરમાં ખુણે ખુણે પ્રસરી રહ્યો છે. આખો દેશ જાગ્યો છે, -મંદિરો ને મકાનો મહાવીરપ્રભુની ભક્તિના જ્યનાદથી ગુંજું રહ્યા છે... જાણે ફરીને ધર્મયુગ આવી રહ્યો છે. આપણા સર્વે જૈનબધુઓ!-બેનો! જાગો....આનંદથી ફળીમળીને આત્મસાધના કરતાં-કરતાં ભગવાનના મોક્ષનો ઉત્સવ ઉજવો. પ્રભુએ આપણને જે મોક્ષમાર્ગ બતાવ્યો છે તે મોક્ષમાર્ગના શાનવડે, તેમના સર્વજ્ઞતા વગેરે ગુણોપ્રત્યેની ભક્તિવડે, તન -મન-ધનને શાસનની સેવામાં જોડીને, ધર્મપ્રભાવના કરો; -હરકોઈ પ્રકારે- જે રીતે સ્વ-પરને લાભ થાય તે રીતે-આનંદમય ઉત્સવને ઉજવો. ઉત્સવ ઉજવવાના હજારો પ્રકાર છે, તેમાંથી જે પ્રકાર તમને રૂચે તે પ્રકારે ઉત્સવ ઉજવો. આપણા ભગવાનનો ઉત્સવ આપણે સૌ જૈનો નહિ ઉજવીએ તો બીજું ડોષ ઉજવશે? ઉત્સવદ્વારા પ્રભુની ભક્તિ કરવી તે આપણી ફરજ છે, -કેમકે- ‘ન હિ કૃતમુપકારં સાધવો વિસ્મરન્તિ।’ તો પ્રભુના પરમ ઉપકારોને આપણે કેમ ભૂલીએ?

આ મહાન ઉત્સવ માટે પ્રસન્નતાપૂર્વક પોતાની સમ્મતિ અને આશીર્વાદ આપતાં પૂ. શ્રી કાનછસ્વામીએ જ્યપુરમાં, ફિલ્પિન્સ, સોનગઢમાં તેમજ મુંબઈ વગેરેમાં વારંવાર કહું છે કે-

બધા જૈનોએ ભેગા થઈને આનંદથી મહાવીર ભગવાનના નિર્વાણના અઠી હજાર વર્ષનો ઉત્સવ કરવો-તે સારું છે. તે જૈનધર્મની પ્રસિદ્ધિનું તથા પ્રભાવનાનું કારણ છે. તેમાં મતભેદ ભૂલીને સૌએ સાથ આપવો જોઈએ. જૈનના બધા સંપ્રદાયોએ મળીને ભગવાન મહાવીરના માર્ગની પ્રસિદ્ધ થાય તે કરવા જેવું છે; તેમાં કોઈએ વિરોધ કરવો ન જોઈએ. અરસપરસ કોઈ જાતના કલેશ વગર સૌ સાથે મળીને મહાવીર ભગવાનનો ઉત્સવ થાય તે તો સારી વાત છે. મહાવીર ભગવાનના

: ચૈત્ર : ૨૫૦૧

આત્મધર્મ

: ૫૫ :

વીતરાગમાર્ગમાં પરસ્પર કલેશ થાય તેવું કોઈએ કરવું જોઈએ નહીં.  
જગતમાં જૈનસમાજની શોભા વધે, દુનિયામાં તેનો મહિમા પ્રસિદ્ધ થાય ને  
ભગવાનના ઉપદેશની પ્રભાવના વધે-તેમ આપણો સૌએ કરવું જોઈએ.”

“સત્ત્વેષુ મૈત્રી” ની ઉત્તમભાવના, જેમાં જગતના સર્વે જીવો  
પ્રત્યે નિર્વેર ક્ષમાભાવ ભરેલો છે. તે ભાવના, આપણને વીરપ્રભુના  
વારસામાં મળી છે....તે વારસો સાચવીને તેમાંથી વીતરાગીઓનાનંદનો લાભ  
લઈએ, ને ‘ગુણીષુ પ્રમોદ’ જ્યાંજ્યાં સાધમના ગુણો દેખીએ ત્યાં પ્રમોદ  
કરીએ, એમાં આપણી સૌની શોભા છે, તેમાં આપણું હિત છે, તે આપણું  
કર્તવ્ય છે.



મંગલ ઉત્સવની મંગલ નોબતો  
ક્યારની વાગી ચુકી છે....ભક્તોના હૃદય અનેચા  
ભજિત્તભાવથી ઝણાઝણી ઊઠ્યા છે...આબાલવૃદ્ધ,  
સાધકો કે જિશાસુઓ સૌ આનંદથી ઉત્સવમાં ભાગ  
લઈ રહ્યા છે ને પોતાની ધાર્મિકભાવનાને પુષ્ટ કરી  
રહ્યા છે....અને....અને...દેખો, દેખો! મહાવીર  
ભગવાન આપણા સૌના ઉપર મંગલ આશીર્વદ  
વરસાવી રહ્યા છે!

ॐ જય મહાવીર ॐ ( બ્ર. હ. જૈન )

## વીરપ્રભુના મોક્ષધામ પાવાપુરીમાં મંગલ પ્રવચન

[ વીર સં. ૨૪૮૮ માં યાત્રા પ્રસંગે: ફા. સુદ્ધ ૨ ]

જુઓ, આ પાવાપુરીધામમાં મહાવીર ભગવાન નિર્વાણપદને  
પામ્યા છે. દેહથી પાર જ્ઞાનાનંદતત્ત્વનું ભાન તો પહેલેથી હતું, ને એવા  
ભાન સહિત અહીં અવતર્યા હતા. ત્યારબાદ ચારિત્રદ્શા પ્રગટ કરી, ને  
વૈશાખ સુદ્ધ દશમીએ પ્રભુને કેવળજ્ઞાન થયું. કેવળજ્ઞાન પછી ત્રીસ વર્ષ  
સુધી સહજપણે ઈચ્છા વિના વિદ્ધાર થયો ને દિવ્ય ઉપદેશ નીકળ્યો....  
ત્યારબાદ આ પાવાનગરીમાં પદ્ધાર્યા, ને અંતિમદેશના બાદ યોગ-નિરોધ  
કરીને અહીંથી ભગવાન મોક્ષ પામ્યા; તે મોક્ષસ્થાનની બરાબર ઉપર સિદ્ધ  
ભગવાનપણે અત્યારે તેઓ બિરાજે છે.

: ૫૬ :

આત્મધર્મ

: ચૈત્ર : ૨૫૦૧

ભગવાન સર્વજ્ઞ હતા, વીતરાગ હતા ને હિતોપદેશી હતા; ભગવાને હિતોપદેશમાં શું કહ્યું? જેનાથી આત્માનું પરમહિત થાય-તેવો ઉપદેશ ભગવાને કર્યો. ભગવાન પોતે તો સર્વજ્ઞ-વીતરાગ થયા ને પોતાના આત્માનું પરમહિત સાધી લીધું. પછી જે વાણી નીકળી તેમાં પણ એવા હિતનો જ ઉપદેશ નીકળ્યો કે અહો આત્મા! તારો આત્મા પણ એક ક્ષણમાં પરિપૂર્ણ જ્ઞાન-આનંદથી ભરેલો છે; અમે જે અનંત જ્ઞાન-દર્શન-સુખ ને વીર્ય પામ્યા તે આત્માની અંતર શક્તિમાંથી જ પામ્યા છીએ. અમારા ને તારા આત્માના અંતરસ્વભાવમાં ફેર નથી. આત્માની ક્ષણિક અવસ્થામાં જે શુભ-અશુભ લાગણી છે તે વિકૃત છે, તે હિતનું કારણ નથી; તે શુભ-અશુભનો અભાવ કરીને અમે અમારું પૂર્ણ હિત સાધ્યું છે, માટે પહેલાં એમ નક્કી કર કે હું જે હિત પ્રાપ્ત કરવા માંગું છું તે મારા આત્માની શક્તિમાંથી જ આવશે. ક્યાંય બહારથી નહિ આવે. આમ સ્વભાવસન્મુખ થવાનો જે પરમહિતોપદેશ સર્વજ્ઞ ભગવાને આપ્યો, તેનાથી જ ભગવાનની મહત્તા છે.

આથ સ્તુતિકાર સ્વામી સમન્તભદ્ર કહે છે કે હે ભગવાન! આપ મોક્ષમાર્ગના નેતા છો-હિતમાર્ગના પ્રણેતા છો; કર્મરૂપી પર્વતને બેદી નાખનાર છો, ને વિશ્વના સમસ્ત તત્ત્વોના પ્રત્યક્ષણાતા છો. આવા ગુણોની પ્રાપ્તિ માટે આપને વંદન કરું છું-આવા ગુણોવડે ઓળખીને આપની સ્તુતિ કરું છું.

-ત્યારે જાણે કે ભગવાન તેને પૂછે છે: હે ભદ્ર! સ્તુતિમાં આ સમવસરણ, આ દેવોનું આગમન, આકાશમાં ગમન, આ ચામર-છત્ર વગેરે દિવ્યવૈભવ-તેનું તો તેંસ્તવન ન કર્યું! !

ત્યારે સમન્તભદ્રસ્વામી, ભગવાનને જવાબ આપતાં કહે છે કે હે નાથ! શું આ દેવોનું આવવું, આકાશમાં ચાલવું ને ચામરાદિ વૈભવ, -તેને લીધે આપ અમારા મનને પૂજ્ય છો? શું તેને લીધે આપની મહાનતા છે?? ના, ના; પ્રભો! એવું તો માયાવી-ઈન્દ્રજાળી પણ દેખાડી શકે. હે નાથ! અમે તો આપના સર્વજ્ઞતા-વીતરાગતા વગેરે ગુણોને ઓળખીને તેના વડે જ આપની સ્તુતિ કરીએ છીએ.

**દેવાગમ      નમોયાન      ચામરાદિવિભૂતયઃ।**

**માયાવિષ્વપિ દૃશ્યન્તે નાત: ત્વમસિ નો મહાન्॥**

હે નાથ! આ સમવસરણનો વૈભવ, આ દેવોનું આગમન, આ આકાશમાં

: ચૈત્ર : ૨૫૦૧

આત્મધર્મ

: ૫૭ :

વિલાર-એના વડે અમે આપની મહત્ત્વા નથી માનતા; -એવું તો માયાવી દેવો પણ બતાવી શકે છે. હે નાથ! અમે તો આપના પરમ હિતોપદેશવડે આપની સર્વજ્ઞતા ને વીતરાગતાનો પરીક્ષાવડે નિર્ણય કરીને તેનાથી જ આપની મહત્વા માનીએ છીએ.-

**મોક્ષમાર્ગस્ય નેતારં, ભેત્તારં કર્મભૂભૂતામ।  
જ્ઞાતારં વિશ્વતત્ત્વાનાં, વન્દે તદગુણલબ્ધયે॥**

જુઓ, આ ભગવાનની સુતિ! જેમ નદીના પ્રવાહમાં તરંગ ઉઠે તેમ જ્ઞાનીના હૃદયમાં સમ્યજ્ઞાનનો પ્રવાહ વહે છે. તેમાં આ ભક્તિરૂપી તરંગો ઉઠ્યા છે. જ્ઞાનીની સુતિ પણ જુદી જ્ઞાતની હોય છે. ભગવાનને ઓળખીને અને ભગવાને શું કહું તેની પરીક્ષા કરીને ભગવાનની સુતિ કરે છે, એકલા પુષ્યનો ઠાડ હોય તેની જ્ઞાનીને મહત્વા નથી. અરે! જ્ઞાની ધર્માત્મા તો એમ વિચારે છે કે ઈન્દ્રપદ કે ચક્રવર્તી પદ મળે તે પણ પુષ્યનું ફળ છે, -રાગનું ફળ છે, ને તે વૈભવના ભોગવટામાં તો પાપવૃત્તિ છે, તેમાં ક્યાંય ચૈતન્યનું સુખ નથી. ઈન્દ્રનો વૈભવ કે ચક્રવર્તીનો વૈભવ પૂર્વના પુષ્યથી મળ્યો ત્યાં ધર્માને તેનો આદર નથી-તેની રૂચિ નથી. ચૈતન્યના અતીન્દ્રિય આનંદનો જ આદર છે, તેની જ મીઠાશ છે. આત્માના આવા આનંદસ્વભાવની સંનુખ થવાનો ઉપદેશ ભગવાને કર્યો. અત્યારે તો ભગવાન વાણી રહિત થઈ ગયા છે ને સિદ્ધપદમાં બિરાજે છે, ત્યાં ક્ષણેક્ષણે આનંદની નવી નવી પર્યાયનો અનુભવ કરે છે. ને તેમણે બતાવેલા માર્ગમાં ચાલનારા મુમુક્ષુજીવો આજે પણ આત્મિક આનંદને સાધતા-સાધતા મોક્ષના માર્ગ ચાલ્યા જાય છે.

-જ્યે મહાવીર!

### **‘કર વિચાર તો પામ’**

મુમુક્ષ જ્યે આત્મસ્વરૂપનો વિચાર કરવો. વિચાર કરવામાં ડરવાનું નથી. વિચાર વખતે જે રાગાંશ છે તે ભલે દોષ છે, પણ તે વિચાર વખતે જે ‘જ્ઞાન’ તત્ત્વનિર્ણયનું કામ કરી રહ્યું છે-તે દોષ નથી. તે જ્ઞાનને વસ્તુના વિચારમાં ઉંડે ને ઉંડે લઈ જતાં, રાગથી છૂટું પડીને તે ચૈતન્યના સત્ય સ્વરૂપને રાગથી જુદું ઓળખી લેશો... ને પહેલાં જે વસ્તુનો વિચાર કરતો હતો તે વસ્તુને અનુભૂતિમાં સાક્ષાત્ પામી લેશો. માટે કહ્યું કે-

**‘કર વિચાર તો પામ.’**



મનાવીને જન્મોત્સવ કર્યો, ને જન્માભિષેક માટે વૈશાલી-કુંડપુરમાં આવ્યા... ઐરાવતસંહિત નગરીને ત્રણ પ્રદક્ષિણા કરી. જગતની જનતા આ મંગલ દિનો જોવા ઉભરાણી.

તો આ બાજુ વૈશાલી-કુંડપુરમાં સિદ્ધાર્થમધારાજાની રાજસભામાં પણ આનંદનો પાર ન હતો. પ્રભુજન્મની મંગલ વધાઈથી ચારેકોર આનંદ-આનંદ છિવાઈ ગયો હતો. રાજાઓ પોતાનો ફર્ખાનંદ વ્યક્ત કરી રહ્યા હતા. આશ્ર્યકારી આનંદમય કોલાહલથી નગરી ગાળ રહી હતી. તેમાંય જ્યારે શચી-ઇન્દ્રાણી નાનકડા તીર્થકરને તેડીને બહારમાં આવ્યા ત્યારે તો પ્રભુને દેખીને ફજારો ભક્તો ફર્ખાનંદથી નાચી ઉઠ્યા; ઇન્દ્ર તો એવા ખુશ થયા કે ફજાર આંખ કરીને પ્રભુને જોવા લાગ્યા. અંતે થાકીને તેણે કહ્યું-અહો દેવ ! આપનું રૂપ તો અતીન્દ્રિયાંખવડે જ દેખાય તેવું છે. પ્રભુ ઐરાવત હથી ઉપર બિરાજમાન થયા, ને પ્રભુની સવારી લઈને ઇન્દ્રો ધામધૂમથી મેરુ તરફ ચાલ્યા. પ્રભુની સવારી નીરખવા અપાર ભીડ ઉમટી હતી. જૈનસમાજને માટે અને જગતને માટે આ ભવ્ય ઐતિહાસિક મહોત્સવ હતો. ભાગ્યશાળી હતા એના જોનારા પણ.

જન્મોત્સવ દેખીને જનતામાં એટલો બધો આનંદનો કોલાહલ થવા લાગ્યો કે પ્રભુનો જન્મોત્સવ દેખીને ફરખથી જીવો પાગલ થઈ જશે કે શું ! -એમ થતું હતું. અહીં, એકકોર ભગવાનની અલિપ્ત ચેતના, અને એકકોર આ ફરખનો હીલોળો, -જૈન-

: ચૈત્ર : ૨૫૦૧

આત્મધર્મ

: ૫૮ :

શાસનમાં બંનેનો કેવો મજાનો આશ્ર્યકારી સુમેળ છે! અહો જિનેન્દ્ર! તારા શાસનની અદ્ભુતતાને જ્ઞાની જ જાણે છે. પ્રભો! ચારેકોર તારી ભક્તિથી દુનિયા ગાજ રહી છે, ત્યારે તું તો તારી ચેતનાની શાંતિમાં મસ્ત થઈને બેઠો છો! વાહ રે વાહ! વીતરાગમાર્ગના ભગવાન તો આવા જ શોભેને!

વાહ! જેના જન્મે હર્ષનો આટલો ખળભળાટ! તે ભગવાન કેવા! હજુ પરમાત્મપદ પામ્યા પહેલાં જે આત્માનો આટલો પ્રભાવ! તેના પરમાત્મપદના મહિમાની તો શી વાત! આમ આનંદોત્સવપૂર્વક હજારો ભવ્યજીવો પ્રભુના જન્મોત્સવમાં ભાગ લઈ રહ્યા છે. નાની નગરીમાં મોટો ઉત્સવ થઈ રહ્યો છે. સ્વર્ગથી ઇન્દ્રો ઉિતરી પડ્યા છે. “ભગવાનની સવારી મારા ઉપર” એવા મહાન ગૌરવથી પેલો હાથી એવો મસ્તાન બની ગયો છે....કે બસ! મારા ઉપર તીર્થકરભગવાન બેઠા એટલે હું પણ મોક્ષ પામીશ! અરે, અચેતન વસ્તુઓ પણ આજે જાણે આનંદિત થતી હોય તેમ રત્નવૃદ્ધિ વગેરે દ્વારા સુંદરતા પ્રગટ કરી રહી છે! તો પછી ચેતનવંતા ભવ્યજીવની તો શી વાત!! બાલતીર્થકરના અત્યંત મહિમાપૂર્વક આત્મઅનુભૂતિવાળા ઇન્દ્રોએ પ્રભુનો જન્માભિષેક કર્યો.—સાથે સાથે કરોડો ભક્તોએ આનંદથી તેમાં અનુમોદન કરીને પોતાનાં પાપોનો પણ અભિષેક કરી નાંખ્યો. સર્વત્ર આનંદ-આનંદ છવાઈ ગયો. શચીદેવી તો બાલ-તીર્થકરને તેડીને ખુશખુશાલ થઈ ગઈ; કેમકે બાલતીર્થકરને તેડતાં એને તો મોક્ષનો સિક્કો લાગી ગયો.

આમ અત્યંત આનંદપૂર્વક પ્રભુનો જન્માભિષેક થયો. પછી પ્રભુની સવારી જ્યારે નગરીમાં પાછી ફરતી હતી ત્યારે તે આનંદકારી સવારીમાં બિરાજમાન બાલતીર્થકરના આશ્ર્યકારી મહિમાને દેખીને, ચૈતન્યની અદ્ભુતતાના લક્ષ્યવડે ઘણાય જીવો સમ્યગ્રદ્ધન પામી જતા હતા. —આ રીતે અનેક જીવોનું કલ્યાણ કરનારો એ જન્મકલ્યાણક મહોત્સવ હતો.

અપૂર્વ મહાન આનંદ ઉલ્લાસથી ચૈત્ર સુદ તેરસે પ્રભુનો જન્મોત્સવ ઊજવો.

## ખ જ્ય મહાવીર ખ

ધન્ય ધડી ધન્ય કાળ શુભ દેખો,  
હરિ અભિષેક કિયો પ્રભુજીકો;  કુસુમ સુદેવનને વરસાયે,  
હમ ઈત મંજૂલ મંગલ ગાયે.

## અર્જિકામાતાજી સાથે ચર્ચા



( સર્વેદશિખર જેવા તીર્થધામમાં નિવૃત્તિપૂર્વક રહીને  
યાત્રા કરતાં અને આત્મહિતની ભાવના ભાવતાં-ભાવતાં,  
એકાએક મહાભાગ્યથી ચંદના કે રાજુલમાતા જેવા કોઈ  
અર્જિકામાતાઓનો સંગ મળતાં મુમુક્ષુબેનને મહાપ્રસંજ્ઞતા  
થઈ....ને તેમની સાથે આત્મહિતની ચર્ચા કરી...શું ચર્ચા કરી ?  
-આ પિષ્યસંબંધી આપણે જે નિબંધો માંજ્યા છે તેનો એક  
નમૂનો અહીં આપ્યો છે. ( સં. )

મુમુક્ષુબેન અર્જિકામાતાઓને વંદન કરીને હર્ષ વ્યક્ત કરે છે કે અહો માતાજી !  
મહાભાગ્યથી આજે આપના દર્શન થયા; આપના સત્સંગે મારી ભાવના જરૂર પૂરી થશે.

હે માતા ! અનુભૂતિસ્વરૂપ થયેલો આત્મા તમારા અંતરમાં બિરાજે છે, તો એવી  
અનુભૂતિ કેમ થાય ! તો મને સમજાવો.

માતાજી જવાબ આપે છે: -હે બેટી ! અનુભૂતિનો મહિમા ઘણો ગંભીર છે,  
આત્મા પોતે જ્ઞાનની અનુભૂતિસ્વરૂપ છે. તે જ્ઞાનની અનુભૂતિમાં રાગની અનુભૂતિ  
નથી: -આવું સ્યાદ બેદજ્ઞાન કરીને વારંવાર ઉંડું ઘોલન કરતાં અપૂર્વ અનુભૂતિ પ્રગટે છે.

મુમુક્ષુબેન પૂછે છે કે: હે માતા ! આત્માની અનુભૂતિ થતાં શું થાય !

માતાજી કહે છે: -સાંભળ બેન ! તારી જિજ્ઞાસા ઉત્તમ છે. અનુભૂતિ થતાં આખો આત્મા પોતે પોતામાં ઠરી જાય છે; એમાં અનંતગુણના ચૈતન્યરસનું એવું ગંભીર વેદન થાય છે કે જેના મહાન આનંદને આત્મા જ જાણે છે. એ વેદન વાણીમાં આવતું નથી.

મુમુક્ષુ ફરી પૂછે છે: -હે માતા ! વાણીમાં આવ્યા વગર એ વેદનની ખબર કેમ પડે ! અર્જિકામાતા ઉત્તર આપે છે: -હે પુત્રી ! પોતે પોતાના સ્વસંવેદનથી આત્માને તેની ખબર પડે છે. જેમ આ સમેદશિખર પર્વત નજરે દેખાય છે, તેમ અનુભૂતિમાં આત્મા તેનાથી પણ સ્પષ્ટ જણાય છે.

મુમુક્ષુબેન ફરી પૂછે છે: - હે માતા ! આંખ વડે સમેદશિખર જણાય તેનાં કરતાંય આત્માના જ્ઞાનને વધુ સ્પષ્ટ કેમ કર્યું !

માતાજી જવાબ આપે છે: -હે પુત્રી ! પણ નું જ્ઞાન તો ઇન્દ્રિયજ્ઞાન છે, એટલે પરોક્ષ છે, ને આત્માને જાણનારું જ્ઞાન તો અતીન્દ્રિય છે તેથી પ્રત્યક્ષ છે, માટે તે વધારે સ્પષ્ટ છે.

અનુભૂતિના વધુ ને વધુ ઊંડાણમાં જઈ રહેલી તે મુમુક્ષુબેન ફરી પૂછે છે કે:- અનુભૂતિ વખતે તો મતિ-શુતજ્ઞાન છે છતાં તેને પ્રત્યક્ષ અને અતીન્દ્રિય કેમ કર્યા !

માતાજી જવાબ આપે છે:- કેમકે અનુભૂતિ વખતે ઉપયોગ આત્મામાં એવો લીન થયો છે કે ઇન્દ્રિયનું કે મનનું અવલંબન છૂટી ગયું છે, તેથી તે વખતે પ્રત્યક્ષપણું છે. અહા, એ વખતના અદ્ભુત નિર્વિકલ્પ આનંદની શી વાત !

મુમુક્ષુબેન કહે છે કે:- હે માતા ! તમે અનુભૂતિની અદ્ભુત વાત સમજાવી. આજે તો જાણે તમારા અંતરમાંથી કોઈ અલૌકિક ચૈતન્યરસ જરી રહ્યો છે ! મહાભાગ્યે આપ મળ્યા ને અનુભૂતિનું રહસ્ય સમજાવ્યું, તો હું ય જરૂર એવી અનુભૂતિ પ્રગટ કરીશ ને આપની સાથે રહીશ.

માતાજી આશીર્વાદ આપતાં પ્રસંગતાથી કહે છે:- બેટી ! ધન્ય છે તારી ભાવના ! તને જરૂર અનુભૂતિનો મહાન લાભ થશે.

‘અહો માતા ! મારા જેવા જીવોને અનુભૂતિનો માર્ગ બતાવીને આપ મહાન ઉપકાર કરી રહ્યા છો. હું મહાભાગ્યશાળી છું કે આપની સેવા કરવાનો ને આપની સાથે રહેવાનો અવસર મને પ્રાપ્ત થયો છે. મારી તીર્થયાત્રા ખરેખર સફળ થઈ.



# ઇન્દ્રસભામાં તીર્થકરનો જન્મોત્સવ

## એકાએક મંગલ ઘંટનાદ-વાજાં-પ્રકાશ

( સૌધર્મ ઇન્દ્ર ) :- અરે અરે ! મારું આ ઇન્દ્રસન આજ એકાએક કેમ ડોલી રહ્યું છે ? મારા સિંધાસનને કંપાવનાર આ જગતમાં કોણ છે ? અરે, આ મધુર ઘંટનાદ એની મેળે કેમ વાગી રહ્યા છે ? આ દૈવી વાજાં કેમ વાગી રહ્યા છે ? ચારેકોર આ દિવ્યપ્રકાશનો જગળગાટ કેમ પ્રસરી રહ્યો છે ? ત્રણલોકનું વાતાવરણ આટલું બધું હર્ષમય કેમ બની રહ્યું છે ? જરૂર કોઈક આશ્ર્યકારી ઘટના બની છે.

( અવધિશાનથી જાણીને પછી-ગીભા થઈને બોલે છે. )

અહો, આનંદ....આનંદ...આનંદ !

દેવો સાંભળો ! મધ્યલોકમાં ભરતક્ષેત્રની વૈશાલીનગરીમાં ત્રિશલાદેવી માતાની કુંખે ચોવીસમા તીર્થકરનો અવતાર થઈ ચુક્યો છે. ( એ સાંભળતાં વેત સૌધર્મ-ઇન્દ્ર સહિત બધા દેવ-દેવીઓ નીચે ઉત્તરી પ્રભુને નમસ્કાર કરે છે. )

( બધા દેવો ) :- ધન્ય હો....ધન્ય હો.... ! બોલિયે મહાવીર ભગવાનકી જય હો.

( દેવી ) :- અહો ધન્ય અવતાર ! મધ્યલોકમાં તીર્થકરનો અવતાર થતાં ઊર્ધ્વલોકનું આપણું આ સ્વર્ગ પણ ઉજ્જવળ બન્યું.

( દેવ ) :- અરે, નરકના જીવોને પણ બેઘડી સાતા થઈ હશે, ને તીર્થકરનો મહિમા જાણીને ઘણા જીવો સમ્યકૃત્વ પામી ગયા હશે.

( દેવી ) :- અહા, જે આત્માનો પુણ્યવૈભવ પણ આવો અદ્ભુત, તેમના આત્મવૈભવની તો શી વાત ?

( દેવ ) :- અહા, એમના આત્મવૈભવનો મહિમા સમજતાં આપણને આપણા આત્માનો સ્વભાવ પણ સમજાઈ જાય છે.

: ચૈત્ર : ૨૫૦૧

આત્મધર્મ

: ૬૩ :

( દેવી ) :- એ જ આપણા જૈનશાસનની ખૂબી છે કે કોઈ પણ તત્ત્વનો સાચો નિર્ણય કરતાં આત્મા સ્વસન્મુખ થાય છે, ને વીતરાગતા થાય છે.

( દેવ ) :- તેથી જ સર્વ શાસ્ત્રોનું તાત્પર્ય વીતરાગતા કહ્યું છે. વીતરાગતાનો ઉપદેશ તે જ ઈષ ઉપદેશ છે. એવો ઉપદેશ દેનારા તીર્થકરનો આજ અવતાર થયો છે.

( દેવી ) :- અરે, અરિહંતદેવ પ્રત્યેનો શુભરાગ પણ જ્યાં સંસારનું જ કારણ છે ત્યાં બીજા રાગની તો શી વાત ? ખરેખર વીતરાગતામાં જ મહાન આનંદ છે.

( દેવ ) :- પરમાગમનું પણ એ જ ફરમાન છે-

તેથી ન કરવો રાગ જરીએ ક્યાંય પણ મોક્ષેચ્છાએ,  
વીતરાગ થઈને એ રીતે તે ભવ્ય ભવસાગર તરે.

( દેવી ) :- અહો, બલિહારી છે તીર્થકરોની, કે જેમણે પોતે આવો વીતરાગમાર્ગ સાધ્યો અને જગતને પણ બતાવ્યો.

( દેવી ) :- અહા, કેવો સુંદર માર્ગ છે ! મનુષ્ય થઈને આનંદી આવા માર્ગને સાધતાં સાધતાં મોક્ષમાં જઈશું.

( દેવી ) :- અરે, આવા સુંદર માર્ગને પણ જગતના અજ્ઞાની જીવો નિંદે છે; અરે, આવો માર્ગ સાંભળવાની પણ ના પાડે છે.

( દેવ ) :- ભગવાનના આવા સુંદર માર્ગને પણ કોઈ નિંદે તો નિંદો, પણ મુમુક્ષુજીવો જિનમાર્ગની ભક્તિ કદી છોડતા નથી, સાચા માર્ગથી કદી ડગતા નથી.

( દેવી ) :- અહા, આવા સુંદર વીતરાગમાર્ગને પ્રસિદ્ધ કરવા માટે જ તીર્થકરોનો અવતાર છે. માટે આપણે ભક્તિથી આવા માર્ગને સાધીને આત્મહિત કરવું.

( દેવ ) :- જિનેન્દ્ર ભગવાનનો માર્ગ પરમ સુંદર છે-

પણ કોઈ સુંદર માર્ગની ઈર્ઝી કરે નિંદા વડે;  
તેનાં સુણી વચનો કરો ન અભક્તિ જિનમારગ વિષે.

( દેવી ) :- અહા, આજ તો મહાવીર તીર્થકરના અવતારનો મંગલ દિવસ છે. ભગવાનના કલ્યાણક એટલે આત્માનું કલ્યાણ કરવાનો અવસર !

( દેવ ) :- અહા, ધન્ય છે પ્રભો ! આપનો અવતાર ધન્ય છે. જગતને વીતરાગવિજ્ઞાનનો મહાન સંદેશ આપવા આપ અવતર્યો છો.

: ૬૪ :

આત્મધર્મ

: ચૈત્ર : ૨૫૦૧

( દેવી ) : -ખરેખર વીતરાગવિજ્ઞાનની પ્રાપ્તિ એ જ ભગવાનની સાચી ભક્તિ છે.

( દેવ ) : -ધર્માત્માઓ ભેદજ્ઞાનવડે સદાય એવી ભક્તિ કરી રહ્યા છે.

( દેવી ) : -બરાબર છે; આજે મહાવીરપ્રભુ જન્મ્યા તેમને પણ આવું ભેદજ્ઞાન વર્તી જ રહ્યું છે.

( દેવ ) : -અહીં, ભગવાન તો હજુ એક દિવસના બાળક છે, છતાં તે પણ પોતાના ચૈતન્યસ્વભાવને ઉપાસી રહ્યા છે.

( દેવ ) : -એવા ભેદવિજ્ઞાની-ભગવાનનો જન્મોત્સવ કરવાનો આજે અવસર આવ્યો છે.

( દેવ ) : -વાહ રે વાહ ! ભગવાનને ઓળખીને ભવથી તરવાનો આ મહાન અવસર છે.

“જ્ય મહાવીર”

( લે. બ્ર. ડ. જૈન )




## બે-ધારા: એક મોકણી; એક બંધની

રાગભાવ તો બંધનું કારણ થાય છે ને અરાગભાવ મોકણું કારણ થાય છે. સાધકને આવી બંને ધારા સાથે હોય છે. પણ જ્યાં એકલો શુભરાગ છે ને રાગ વગરનો ભાવ જરાય નથી તો ત્યાં ધર્મ નથી.

ચોથા ગુણસ્થાને જે રાગ છે તે રાગ સમ્યગુર્દર્શનની શુદ્ધીને હણી શકતો નથી. જો તે રાગ પ્રગટેલી શુદ્ધતાને નુકશાન કરતો હોય તો તો કોઈને સાધકપણું થઈ જ ન શકે. છંકે ગુણસ્થાને જે સંજીવલનરાગ છે તે ત્યાંની શુદ્ધીને હણી શકતો નથી. આમ બંને ધારા એક સાથે છે, છતાં બંને ધારા એક થઈ જતી નથી; તેમ જ સાધકને વીતરાગતા થયા પહેલાં બંનેમાંથી એક્ઝેય ધારા સર્વથા છૂટી જતી નથી. જો શુદ્ધતાની ધારા તૂટે તો સાધકપણું છૂટીને અજ્ઞાની થઈ જાય; અને જો રાગની ધારા છૂટી જાય તો તુરત વીતરાગ થઈને કેવળજ્ઞાન થઈ જાય. આ રીતે સાધકને નિરંતર નિશ્ચયનું પરિણામન વર્તી રહ્યું છે. ચોથા ગુણસ્થાનથી શરૂ કરીને દરેક ગુણસ્થાને તે તે ભૂમિકાને યોગ્ય શુદ્ધતાની ધારા નિરંતર વર્તે છે.

## ऋषभादि वीरान्तेभ्यः कुर्वन्तु जगन्मंगलम्



અદ્ભુત વીતરાગીશાંતમુદ્રામાં શોભી રહેલા, આ  
ચોવીસીના પહેલા અને છેલ્લા તીર્થકરભગવંતો,-ભગવાન  
આદિનાથ અને ભગવાન મહાવીર, -લંડનશહેરના ભ્યુજીયમને  
કેવા શોભાવી રહ્યા છે ! ભારતની આ ભવ્ય વીતરાગી સંસ્કૃતિ  
જગતમાં સૌને આકર્ષી રહ્યી છે.....એટલે તો અંગ્રેજો એને  
ભારતમાંથી વિલાયત લઈ ગયા ! પ્રલુ ભલે વિલાયતમાં બિરાજે,  
પણ ભરતના ભક્તોના નમસ્કાર તો ત્યાં પણ પણોંચી જાય છે.

( જ્યાં જ્યાં પ્રતિમા જિનતણી...ત્યાં ત્યાં કરું પ્રણામ. )

## જિનબિંબ-પ્રતિષ્ઠા...તીર્થયાત્રા...પ્રભાવના.... ધર્મચક વિહાર....જ્ઞાનશિબિર...

આપ આ વાંચતા હશો ત્યારે, ચૈત્ર સુદ તેરસે, બેંગલોરશહેરમાં જિનભગવંતોની મંગલપ્રતિષ્ઠા ગુરુ કહાનના મંગલહસ્તે થઈ રહી હશે..... ધર્મચકના ફર્ખમય ધમધમાટ વચ્ચે મહાવીર ભગવાનનો ભવ્ય જન્મકલ્યાણકઉત્સવ ઉજવાતો હશે.

પૂ. ગુરુદેવ સાગરશહેર પદ્ધારતાં શેઠશ્રી ભગવાનદાસજીની આગેવાનીમાં ભવ્ય સ્વાગત થયું. હજારો જિજ્ઞાસુઓએ ઉમંગથી લાભ લીધો. મધ્યપ્રેદેશમાં તત્ત્વજ્ઞાનની ખૂબ જાગૃતી આપના પ્રતાપે આવી છે—એમ કઢીને શેઠજી પૂ. ગુરુદેવનો ઉપકાર માની રહ્યા છે.

મધ્યપ્રેદેશના ડાકુગીરી છોડીને શરણે આવેલા ભૂતપૂર્વ ડાકુઓને બેગમગંજની ખુલ્લી જેલમાં વૈરાગ્યમય સંબોધન ગુરુદેવે કર્યું હતું, ને સજ્જનતાપૂર્ણ શાંતિમય જીવન જીવવાની પ્રેરણા કરી હતી.

તા. ૨૮-૩-૭૫ પૂ. ગુરુદેવ ખંડવાશહેર પદ્ધારતાં જૈન-સમાજે ઉમંગભર્યું સ્વાગત કર્યું. પરસ્પર વત્સલતા દેખીને પ્રસન્નતા થતી હતી. આ પ્રસંગે સિદ્ધચકમંડલવિધાનની પૂર્ણતા થઈ હતી. પ્રવચન દ્વારા શુદ્ધ જ્ઞાન-આનંદસ્વરૂપ મમત્વહીન આત્માનો મહિમા હજારો જિજ્ઞાસુઓના છદ્યમાં ગુંજી રહ્યો હતો; ને વીતરાગ જૈનમાર્ગ એ જ આત્મહિતનો સાચો માર્ગ છે—એમ સર્વત્ર પ્રસિદ્ધ થઈ રહ્યું હતું.



: ચૈત્ર : ૨૫૦૧

આત્મધર્મ

: ૬૫ :

- ૩ તા. ત૧ માર્યના રોજ ભક્તિસહિત નૌકાવિહારપૂર્વક સિદ્ધવરકૂટ-સિદ્ધિધામની યાત્રા ર૫૦ યાત્રિકોના સંઘસહિત ગુરુદેવે હર્ષોલ્લાસપૂર્ણ વાતાવરણમાં કરી. સિદ્ધવરકૂટ તીર્થનું રોમાંચક વર્ણન વાંચવા, અને નૌકાવિહારના ભક્તિમય વાતાવરણમાં મહાલવા ચાહેતા હો તો 'મંગલતીર્થયાત્રા' પુસ્તક વાંચો. તીર્થયાત્રામાં પૂર્ણ બેનશ્રીબેને આનંદકારી ભક્તિ કરાવી હતી.
- ૪ બીના-બજરિયા: પૂર્ણ કાનળુસ્વામી પધારતાં આનંદ-ઉત્સવપૂર્વક જિનમંદિર ઉપર કળશ ચઢાવવામાં આવ્યો, ને સુંદર ધર્મપ્રભાવના થઈ. જૈન સમાજને ઘણો ઉત્સાહ હતો.
- ૫ **દિલ્હી શહેરમાં મહાવીર-ધર્મચકનું ભવ્યસ્વાગત અને આપણું કર્તવ્ય:** ભગવાન મહાવીરનું ધર્મચક આજ ભારતભરમાં ચાલી રહ્યું છે. ભારતના વિધવિધ પ્રાંતોમાં અત્યારે છ ધર્મચક જૈનધર્મનો જ્યયજ્યકાર ગજાવી રહ્યા છે. જાણે ફરીથી મહાવીર ભગવાન આ ભરતભૂમિમાં વિચરતા હોય એમ ઠેરઠેર મહાન ઉલ્લાસપૂર્વક તેમના ધર્મચકનું ઉમંગભર્યું સ્વાગત થઈ રહ્યું છે. તા. ૧૨-૩-૭૫ ના રોજ આઠસો યાત્રિકોના સંઘસહિત ગુજરાતપ્રદેશનું ધર્મચક દિલ્હીનગરીમાં પ્રવેશ્યું ત્યારે નગરીને ખૂબજ શાશગારીને, આકાશમાંથી પુષ્પવૃદ્ધિ સહિત ભવ્ય સ્વાગત થયું હતું. ધર્મધ્યજ-બેન્ડવાળાં શાથી-ધોડા-ઊંટ, અનેક ધાર્મિકરચનાઓ તેમજ ભજન-મંડળીઓ અને હજારો ભક્તજનોએ જે ઉમંગથી ધર્મચકનું સ્વાગત કર્યું તે દર્શનીય હતું. આજે ભારતના ખુણો-ખુણો અને વિદેશોમાં પણ તીર્થકર મહાવીરજિનેશરનો જે અપાર મહિમા પ્રસિદ્ધ થઈ રહ્યો છે તે દેખીને આનંદ થાય છે. આપણા જીવનમાં આપણને આ એક અભૂતપૂર્વ એવો મજાનો સુઅવસર મળ્યો છે કે આપણે બધા જૈનો હૃદયથી એક થઈને, આપણા મહાવીરભગવાનના ધર્મધ્યજને વિશ્વના ઉન્નત ગગનમાં ફરજાવીએ અરે, મહાવીરના ભક્ત આપણે બધા સાધર્માઓ જો એકબીજા સાથે રહીને પ્રેમથી અરસ્પરસ નહીં ફળીમળીએ તો આપણા ઉત્સવની શોભા કેમ વધશે? આવો....એકમેક થઈ ફળીમળીને ઉત્સવની શોભા બઢાવો.

## **"હઠાગ્રહ છોડ દો.....સાધર્માપ્રેમ જોડ દો ! "**

- ૬ આપણે વ્યવહારકુશળ ગણાતા જૈનલોકો, લાખો રૂપિયાના ખર્ચે કેસ લડીલડીને, કોઈ જૈનેતર ન્યાયધીશ દ્વારા આપણા તીર્થો બાબતમાં અપાતા ફેસલાને માનવા તૈયાર છીએ, -પરંતુ આશ્ર્ય છે કે, આપણા જ શાસનનાયક વીરનાથ ભગવાનના નામ પર

: ૬૬ :

આત્મધર્મ

: ચૈત્ર : ૨૫૦૧

એકબીજા હળીમળીને કોઈ સુયોગ્ય-સર્વહિતકારી સમાધાન હજી પણ નથી કરી શકતા ! બસ, હવે તો અવસર આવી ગયો છે.-‘વીતરાગતા જ સૌથી શ્રેષ્ઠ ન્યાય છે-જે આપણા મહાવીર ભગવાને આપણને શીખડાવ્યો છે. આપણે તે શિખીશું અને રાગ-દેખ છોડીને પરસ્પર પ્રેમથી હળીમળીને વીતરાગમાર્ગમાં આગળ વધીશું. -બસ, આપણે આટલું કરશું જ કરશું.

- ❖ મહાવીર-ધર્મચક્ઝની પ્રભાવનાના વિશેષ સમાચાર આહારજી તીર્થક્ષેત્ર, સમેદશિખરમહાતીર્થ, થુબોનજી, વારાણસી વગેરે અનેક જગ્યાઓથી આવ્યા છે. કલક્તામાં પણ સારો ઉત્સાહ હતો, દ્રોષણીરીમાં જ્યારે ધર્મચક આવ્યું ત્યારે, મધ્યપ્રદેશમાં શરણાગતિ સ્વીકારીને ડાકુગીરી છોડીદેનારા મૂરતસિંહે ખુલ્લી જેલમાંથી અધિવેશનના મંચ ઉપર આવીને ઘણી પ્રસન્નતાપૂર્વક ધર્મચકનું સ્વાગત કર્યું હતું. એક ડાકુના હદ્યપરિવર્તનનું એ દેશ્ય રોમાંચકારી હતું, ને મહાવીર-ધર્મચક સર્વ જીવહિતકારી છે-એમ પ્રસિદ્ધ કરતું હતું.
- ❖ બડનગર : પૂ. ગુરુલેદેવ પધારતા ઉત્સાહપૂર્ણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો પ્રવચન, ભક્તિ વગેરે કાર્યક્રમોમાં જૈનસમાજે ઉલ્લાસથી ભાગ લીધો હતો.
- ❖ નાગપુર શહેરમાં ૮૦૦ યાત્રિકોસહિત મહાવીરધર્મચકના આગમન પ્રસંગે, ‘ભગવાન મહાવીર પ્રદર્શની’ નું એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન તા. ૧૨ એપ્રીલના રોજ થયું છે ને તા. ૨૫ એપ્રીલ સુધી ચાલુ રહેશે. તેમાં અનેક કલામય કૃતિઓ દર્શનીય છે.
- ❖ ભદ્રાસ શહેર : પૂ. ગુરુલેદેવ પધારતાં આનંદમય વાતાવરણ વર્ચ્યે ઝાગણ વદ દશમના મંગલદિવસે ભવ્ય જિનમંદિરનું શિલાન્યાસ થયું હતું. (વિશેષ સમાચાર હવે પણી)

### \* કરુણાદાન-ગાયોના ઘાસ માટે ખાસ અપીલ \*

- ❖ સોનગઢ કહાનરાહતકેન્દ્ર ટ્રસ્ટ તરફથી સૂચિત કરવામાં આવે છે કે દુષ્કાળની પરિસ્થિતિમાં સોનગઢની ગાયોને નિભાવી લેવા માટે આ ટ્રસ્ટદ્વારા ખૂબ પ્રયત્ન કરીને અત્યાર સુધી ઘાસચારો નાંખવામાં આવ્યો છે. હજી કટોકટીના ત્રણ મહિના પસાર કરવા માટેના રાહત ફંડમાં સૌના સાથ-સહકારની જરૂર છે. તો આ બાબત લક્ષમાં લેવા સૌને વિનંતી છે. રાહત માટે ચેક-ડ્રાફ વગેરે “કહાનરાહતકેન્દ્ર ટ્રસ્ટ,” સોનગઢ ( સૌરાષ્ટ્ર ) એ નામથી મોકલવું.

: ચૈત્ર : ૨૫૦૧

આત્મધર્મ

: ૬૭ :

કોટા ( રાજસ્થાન ) માં તા. ૨૪-૫-૭૫ થી તા. ૮-૬-૭૫ સુધી વીતરાગવિજ્ઞાન -શિક્ષણશિબિરનું આયોજન છે. તા. ૧ થી ૮ જૂન સુધી પૂર્ણ ગુરુદેવનો કોટા પધારવાનો કાર્યક્રમ છે.

[ નિર્વાણ મહોત્સવ નિમિત્તે આવેલ રકમોની યાદી પાનું ૪૮ થી ચાલુ ]

|     |                           |        |     |                           |       |
|-----|---------------------------|--------|-----|---------------------------|-------|
| ૫૮૮ | યોગેશચંદ્ર રાજેશચંદ્ર જૈન | અલીગંજ | ૫૮૮ | રશ્મીકાંત વૃજલાલ જૈન      | મુંબઈ |
| ૫૮૯ | અણતકુમાર ચીમનલાલ જૈન      | પાદરા  | ૫૮૯ | પૂર્ણિમાબેન રશ્મીકાંત જૈન | મુંબઈ |
| ૫૯૦ | રસિકલાલ નાગરદાસ મોદી      | મુંબઈ  | ૫૯૪ | ઇન્ડિયાબેન જમનાદાસ શાહ    | મુંબઈ |
| ૫૯૧ | લીલાવંતીબેન વૃજલાલ મોદી   | મુંબઈ  |     | ( તા. ૨૮-૩-૭૫ સુધી )      |       |

[ આ ઉપરાંત અંબેશકુમાર જૈન મુંબઈ તરફથી રૂ. ૧૦૧/- આવ્યા છે. ]

\* આત્મધર્મ-ગુજરાતી વર્ષ કારતકથી આસો: લવાજમ છ રૂપિયા છે. ગમે ત્યારે ગ્રાહક થવાય છે, પણ અંકો કારતકથી આસો સુધીના મળે છે.

સરનામું: આત્મધર્મ કાર્યાલય, સોનગઢ ( સૌરાષ્ટ્ર: ઉ૬૪૨૫૦ )



## -: ૫.....૬.....કો.....ર:-

આત્માનો સ્વાનુભવ થતાં સમકિતી જીવ કેવળજ્ઞાની જેટલો જ નિઃશંક જાણો છે કે આત્માનો આરાધક થયો છું ને પ્રભુના માર્ગમાં ભણ્યો છું, સ્વાનુભવ થયો ને ભવકટી થઈ ગઈ; હવે અમારે આ ભવભ્રમણમાં રખડવાનું હોય નહિ. -આમ અંદરથી આત્મા પોતે જ સ્વાનુભવના પડકાર કરતો જવાબ આપે. અનંતગુણના ઊજળા કિરણોથી જગઝગાટ કરતો ચૈતન્યસૂર્ય ઊર્ઘ્યો-તે કેમ છાનો રહે ! અશાંતિમાંથી શાંતિ થઈ, હુખ મટીને સુખ થયું, અજ્ઞાન મટીને જ્ઞાન થયું, બંધ ટળીને મોક્ષભાવ શરૂ થયો. એવી દશા થતાં આખો આત્મા પલટી ગયો.....તે આત્મા પોતે સ્વાનુભૂતિના પડકાર કરતો સ્વસંવેદનમાં પોતાને પ્રત્યક્ષ જાણો છે.

## ભગવાન મહાવીર ૨૫૭૨ વર્ષીય જન્મ-મહોત્સવ



**\* વીરપ્રભુના સૌ સંતાન, છે તૈયાર.....છે તૈયાર \***

|                               |    |       |    |        |
|-------------------------------|----|-------|----|--------|
| મહાવીર પ્રભુનાં સૌ સંતાન..... | છે | તૈયાર | છે | તૈયાર. |
| નિર્વાણ-મહોત્સવ મોટો કરવા.... | છે | તૈયાર | છે | તૈયાર. |
| જિનશાસનની સેવા કરવા,          | છે | તૈયાર | છે | તૈયાર. |
| સિદ્ધ પદનું સ્વરાજ દેવા,      | છે | તૈયાર | છે | તૈયાર. |
| અરિંત પ્રભુની સેવા કરવા,      | છે | તૈયાર | છે | તૈયાર. |
| શાની ગુરુની સેવા કરવા,        | છે | તૈયાર | છે | તૈયાર. |
| તીર્થધામની યાત્રા કરવા,       | છે | તૈયાર | છે | તૈયાર. |
| જૈનધરમના શાસ્ત્રો ભણવા,       | છે | તૈયાર | છે | તૈયાર. |
| શાસન માટે જીવન દેવા....       | છે | તૈયાર | છે | તૈયાર. |
| સમ્યજ્ઞન પ્રાપ્ત કરવા,        | છે | તૈયાર | છે | તૈયાર. |
| સમ્યજ્ઞાનની જ્યોત જગાવવા....  | છે | તૈયાર | છે | તૈયાર. |
| સાધુદ્શાનું સેવન કરવા,        | છે | તૈયાર | છે | તૈયાર. |
| મોહશત્રુને જીતી લેવા.....     | છે | તૈયાર | છે | તૈયાર. |
| વીતરાગી નિર્માણી થાવા....     | છે | તૈયાર | છે | તૈયાર. |
| આત્મ ધ્યાનની ધૂન મચાવા....    | છે | તૈયાર | છે | તૈયાર. |
| શાયકનો પુરુષાર્થ કરવા....     | છે | તૈયાર | છે | તૈયાર. |
| વીરના માર્ગ દોડી જવા.....     | છે | તૈયાર | છે | તૈયાર. |
| મોક્ષના દરવાજા ખોલવા....      | છે | તૈયાર | છે | તૈયાર. |
| સંસારસાગર પાર ઉત્તરવા,        | છે | તૈયાર | છે | તૈયાર. |
| સિદ્ધપ્રભુની સાથે રહેવા,      | છે | તૈયાર | છે | તૈયાર. |



# મહાવીર ભગવાનનો મંગલ અવતાર

પોતે અનંત આનંદને સાધ્યો....ને જગતને આનંદનો માર્ગ બતાવ્યો

મહાવીરભગવાનના મંગલ જન્મ દિવસે ચૈત્રસુદ તેરસે આનંદમય વાતાવરણમાં ગતવર્ષે ગુરુદેવે કહું કે અહો ! આજે પ્રભુના જન્મનો મંગલ દિવસ છે. અનંત-અનંત આનંદસ્વરૂપ આત્મા છે, તેમાં સન્મુખતા થવી તે મંગળ છે. આનંદસ્વરૂપમાં સન્મુખતા થતાં જ પરલાવોથી વિમુખતા થઈ જાય છે, ને આત્મામાં મોક્ષના ભણકાર આવી જાય છે. ભગવાન મહાવીર આવા આનંદસ્વરૂપને પામ્યા....ને જગતને તેવા આનંદનો ઉપદેશ આપ્યો...-આવા ભગવાનના જન્મકલ્યાણકનો આજે મંગલ દિવસ છે.

( ચૈત્ર સુદ તેરસના પ્રવચનમાંથી )

જન્મ તો તેનો સફળ છે કે જેણે ફરીને જન્મવાનું બંધ કર્યું. ભગવાન મહાવીર આ અવતારમાં જન્મીને સિદ્ધપદને પામ્યા. પાવાપુરીમાં જે ક્ષેત્રેથી પ્રભુ મોક્ષ પામ્યા ત્યાં ઉપર લોકાંગે પ્રભુ સાદિ અનંતકાળ સુધી સિદ્ધપદમાં બિરાજે છે. પહેલવહેલા સં. ૨૦૧૩ માં ત્યાં યાત્રા કરવા ગયા હતા. -એવા સિદ્ધક્ષેત્રની યાત્રા કરતાં પ્રભુની સ્મૃતિ થાય છે કે અહો ! ભગવાન આનંદસ્વરૂપમાં લીન થઈને અહીંથી સાદિઅનંત સિદ્ધપદને પામ્યા. આવા મહાવીર ભગવાનના જન્મનો આજે મંગળ દિવસ છે.

ભગવાન મહાવીર ત૦ વર્ષ કુમાર અવરસ્થામાં રહ્યા, પછી મુનિ થઈ સાડાબાર વર્ષ મુનિદશામાં વિચર્યા; ને પછી કેવળજ્ઞાન પામીને ત૦ વર્ષ સુધી અરહિંતપદે રહીને જગતને કલ્યાણનો ઉપદેશ આપ્યો. તે ભગવાન મહાવીરે કેવળજ્ઞાન થયા પછી સમવસરણમાં જે ઉપદેશ આપ્યો તેનો અંશ આ સમયસારમાં છે; તેમાં મોક્ષના ઉપાયરૂપ ભેદજ્ઞાન કેમ થાય તેની વાત ચાલે છે. પ્રથમ તો આત્માનું સ્વલક્ષ્ણ ચૈતન્ય છે; ને બંધનું લક્ષ્ણ રાગાદિકભાવોને બંધ સાથે સમપણું છે, આત્માના ચૈતન્યભાવ સાથે રાગાદિકને સમપણું નથી; ચૈતન્યલક્ષ્ણ આત્માના સમસ્ત ગુણપર્યાયમાં રહેલું છે; તેના વગરના કોઈ ગુણ-પર્યાય હોતાં નથી; ત્યારે રાગ વગરનો તો આત્મા

: ૭૦ :

### આત્મધર્મ

: ચૈત્ર : ૨૫૦૧

અનુભવાય છે. આ રીતે રાગને અને ચેતનાને અત્યંત બિજ્ઞ જાણતાવેંત ચેતનાસ્વરૂપે આત્મા અનુભવાય છે, ને બંધભાવો તે અનુભૂતિથી જુદા રહી જાય છે. અરે જીવ ! એકવાર રાગથી બિજ્ઞ ચેતનાવડે આત્માને લક્ષ્ણગત તો કર, તને પૂર્વે કદી ન થઈ હોય એવી અપૂર્વ શાંતિનું વેદન થશે....મોક્ષના ભણકાર અત્યારે જ આવી જશે.

અત્યારે ભગવાન મહાવીરનું શાસન ચાલે છે; તેમનો આજે જન્મકલ્યાણકનો દિવસ છે. જન્મ તો જગતમાં વણાં જીવોનાં થાય છે, પણ ભગવાનનો તો આ જન્મ તીર્થકર તરીકેનો જન્મ હતો; આ જન્મમાં કેવળજ્ઞાન પ્રગટ કરીને તેમણે જગતને મોક્ષનો માર્ગ બતાવ્યો, તેથી ભગવાનનો જન્મ તે મંગળરૂપ છે, તે કલ્યાણક તરીકે ઉજવાય છે. આ ભવ પહેલાં ભગવાનને આત્માનું ભાન હતું ને તીર્થકર નામકર્મ બાંધ્યું હતું. પછી જ્યારે ત્રિશલામાતાની કુંભે પ્રભુ સ્વર્ગમાંથી અવતર્યા ત્યારે પણ આત્માનું ભાન તેમ જ અવધિજ્ઞાન સહિત હતા. ભગવાનનો જન્મ થતાં ઇન્દ્ર આવીને ભગવાનના માતા-પિતાની પણ સ્તુતિ કરે છે: અહો માતા ! તું જગતની માતા છો, તારા ઉદરમાં જગતના નાથ તીર્થકર બિરાજે છે, તેથી તું રત્નકુંખધારિણી છો. ભગવાનનું તો બહુમાન કરે, પણ તેમના માતાનું પણ બહુમાન કરે છે. હે માતા ! વીરપ્રભુ તારો તો પુત્ર છે પણ અમારો તો પરમેશ્વર છે; તારો ભલે પુત્ર, પણ જગતનો તે તારણહાર છે. -આમ કહીને ઇન્દ્રો માતાને નમસ્કાર કરે છે.

ભગવાન તો જન્મથી જ ત્રણ જ્ઞાન સહિત છે. આત્માનું સામર્થ્ય અદ્ભુત છે; તેનું ભાન કરીને તેનો વિકાસ કરતાં કરતાં આ ભવમાં ભગવાને પૂર્ણ પરમાત્મપદ સાધી લીધું. આત્મામાં અનંત સામર્થ્ય છે. આત્માનો પૂર્ણ વિકાસ તો બધા અરિહંત-કેવળીભગવંતોને હોય છે, પણ તીર્થકરના આત્માને પવિત્રતાની સાથે પુણ્ય પણ વિશિષ્ટ હોય છે, તેમની દિવ્યધ્યનિ વડે જગતના લાખો-કરોડો જીવો ધર્મ પામે છે. ભરતક્ષેત્રમાં એવા તીર્થકરના અવતારનો આજે દિવસ છે. જીવો પોતાની ચૈતન્યસંપદાને પામે અને મુક્તિના પંથે દોરાય-એવો ઉપદેશ તીર્થકરોની વાણીમાં હોય છે. આવા ભગવાનના જન્મને ઇન્દ્રો પણ ઊજવે છે. અહા, જેણે અનાદિ સંસારનો અંત કર્યો ને આત્માનું પરમાત્મપદ પ્રગટ કર્યું, સાદ્ય-અનંત મુક્તદશા જેમણે પ્રગટ કરી-એવા આત્માનો જન્મ તે સફળ છે, ને તેના ઉત્સવ ઉજવવામાં આવે છે. બાકી જન્મીને જેણે આત્માનું કાંઈ કર્યું નથી એનો જન્મોત્સવ શો ? એનો જન્મ તો નિષ્ફળ છે. જન્મીને રાગાદિમાં રખડે-એનાં તે જન્મોત્સવ શા ? જન્મ તો તેના ઉજવાય કે જેણે ફરીને જન્મવાનું બંધ

: ચૈત્ર : ૨૫૦૧

આત્મધર્મ

: ૭૧ :

કર્યું; જેણે સંસારમાં અવતરવાનું બંધ કર્યું ને મોક્ષને સાધ્યો, તેનો અવતાર સફળ છે.  
-એવા ભગવાનનો આજે જન્મ-કલ્યાણક દિવસ છે.

અહો, ભગવાને જ્ઞાન અને રાગની અત્યંત ભિન્નતા બતાવી છે. ચૈતન્યલક્ષ્ણ તે આત્મા છે, ને રાગ તે બંધન એટલે કે અંદર સંસાર છે; એ બંનેને જુદા અનુભવવા તે મોક્ષનો ઉપાય છે. એ બંનેનું ભિન્નપણું ભગવતી જ્ઞાનચેતના વડે અનુભવી શકાય છે. ભગવાન મહાવીરે એવા અનુભવ વડે મોક્ષને સાધ્યો, ને જગતને તેની રીત બતાવી. ભગવાને કહેલો માર્ગ જે સમજે તેણે જ મહાવીર ભગવાનનો ખરો જન્મોત્સવ ઉજવ્યો કહેવાય, ને તેના જન્મ-મરણનો અંત આવી જાય.

અહો, ભેદજ્ઞાનની રીત બતાવીને સંતોષે મોક્ષના મારગ ખોલી નાંખ્યા છે. જુઓ, આ મહાવીર ભગવાનનો માર્ગ ! તે માર્ગ આજે પણ જ્યવંત વર્તે છે. ચાલો સાધ્માર્ગો ! પ્રભુના અઢીકારવર્ષીય-નિર્વાણમહોત્સવમાં આનંદથી

હળીમળીને આપણે પ્રલુના માર્ગ જઈએ.



### આત્મધર્મ માસિક-પત્ર સંબંધી માહિતી

પ્રકાશન સ્થાન-શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ ( સૌરાષ્ટ્ર )

પ્રકાશન તારીખ-દરેક માસની વીસમી તારીખ.

પ્રકાશક-શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ.

તંત્રી-પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર, ભાવનગર.

સંપાદક-બ્ર. હરિલાલ જૈન, સોનગઢ.

મુદ્રક-મગનલાલ જૈન, અજિત મુદ્રણાલય, સોનગઢ.

રાષ્ટ્રીયતા-ભારતીય.

માલિક-શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ.

આથી હું જાહેર કરું છું કે ઉપરોક્ત વિવરણ મારી જાણકારી અને વિશ્વાસ અનુસાર સત્ય છે.

વ્યવસ્થાપક - ( મેનેજર )

શ્રી દિ. જૈન. સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ.

તા. ૨૦-૪-૭૫

# \* ભગવાન મહાવીરનું ફરમાન \*

( ઉપકાર-અંજલિ )

આખી દુનિયા આજે મહાવીરપ્રભુના નામથી ગાજી રહી છે; ભારતભરના નાના-મોટા સૌ જૈનો પોતાની બધી શક્તિથી, કળાથી-તન-મન-ધનના વૈભવથી મહાવીરપ્રભુના ગુણગાનમાં લાગી ગયા છે. સાહિત્ય તો એટલું છપાય છે કે બધું વાંચવાની વાત તો દૂર રહી, -એક ઘરમાં તે બધું સમાઈ પણ ન શકે. ચિત્ર-વિચિત્ર કાર્યક્રમો, પ્રદર્શનો વગેરે પણ એટલા ભરચક છે કે કોઈ વ્યક્તિ તે બધામાં ભાગ લેવામાં પહોંચી શકે નહિ.

-આટલું આટલું કરવા છતાં ભગવાન મહાવીરનો મહિમા જાણે હજી પૂરો થતો નથી; કંઈક બાકી રહેતું હોય તેમ અધૂરું-અધૂરું લાગે છે.

ઉંડો વિચાર તો કરો.....શું બાકી રહે છે?

બસ એક જ ! જે અનુભૂતિવડે ભગવાન મહાવીર ‘મહાન વીર’ બન્યા તેવી આત્મઅનુભૂતિ કરવાથી જ વીરનાથના ગુણગાન પૂરા થાય તેમ છે. એ આત્મ-અનુભૂતિના માર્ગને જેમ બને તેમ વધુ પ્રસિદ્ધ મળે તે છાટ છે; એવી અનુભૂતિ તે જ મહા આનંદમય નિર્વાણમહોત્સવનો પ્રારંભ છે, એ જ પ્રભુ મહાવીરનું ફરમાન છે.

પ્રભુના એ ફરમાનને બહુમાનથી જીલીને, આ ચૈત્રમાસના ખાસ અંક દ્વારા આત્મધર્મના સંપાદક અને હજારો-લાખો સાધર્મી-પાઠક-ભાઈ-બહેનો, પ્રભુને ભાવભીની ઉપકાર અંજલિ આપીએ છીએ.

- બ્ર. ફ. જૈન

\* આત્મધર્મ એક ઉજ્જ ( ફાગણ ) માં પાંચમા પાને ત્રીજી લીટીમાં “રાગથી બિન્ન ચૈતન્યને જ જાણતો હોવાથી” એમ ભૂલથી છપાયેલ છે તેને બદલે “રાગથી બિન્ન ચૈતન્યને નહિ જાણતો હોવાથી” -એમ સુધારીને વાંચવું.

\* આત્મધર્મના આ વિશેષ અંકને શોભાવવા માટે તથા ઝડપથી સમયસર તૈયાર કરી આપવા માટે અજિત પ્રેસના માલિક ભાઈશ્રી મગનલાલજી જૈન તથા સ્ટાફના સર્વે ભાઈઓને ધ્યાનાદ !

# “વીતરાગ સંત એ કેવા હશે ! ”



‘મને કો’ને કુંદુંદ પ્રભુ કેવા હશે ? જ્યાં રહેતા હશે ? શું કરતા હશે ? મને૦ ૧ પોન્નૂર ગિરિ પર ધ્યાન ધરનારા, વિદેહના યાત્રિક કેવા હશે ? મને૦ ૨ સીમંધર દેવના દર્શન કરીને, સંદેશો લાવનાર કેવા હશે ? મને૦ ૩ સાર-સમય કેરી બંસરી બજાવી, હૈયા ડોલાવનાર કેવા હશે ? મને૦ ૪ પરમાગમની અદ્ભુત પ્રસાદી, દેનાર સંત એ કેવા હશે ? મને૦ ૫ દર્શન મહત્ત્વા ને ચેતનની શુદ્ધતા, વિશ્વે ગજાવનાર કેવા હશે ? મને૦ ૬ નિશ્ચય નિહાળનાર શાસન શોભાવનાર, સુધાના સીંચનાર કેવા હશે ? મને૦ ૭ સ્ય-પર જ્ઞાનમાં સ્થાપી સિદ્ધોને, મંગલ કરનાર એ કેવા હશે ? મને૦ ૮ ધૂન મચાવી સર્વજ્ઞ પદની, એ સર્વજ્ઞનંદન કેવા હશે ? મને૦ ૯ તીર્થકર તુલ્ય આ ભરતક્ષેત્રમાં ધર્મપ્રભાવી કેવા હશે ? મને૦ ૧૦ પંચ પરમાગમ આપ્યાં શાસનને અહો, એ શ્રુતધર કેવા હશે ? મને૦ ૧૧ વીરપ્રભુના માર્ગ પ્રકાશક વીતરાગ સંત એ કેવા હશે ? મને૦ ૧૨

फोन नं. ३४ :

“आत्मधर्म”

Regd. No. G.B.V.10

